

અખીલભારતીય દૂર રહી, સ્વચ્છતા અને સંસ્કારિતાને અપનાવી પ્રસિદ્ધ થતાં 'ગુજરાત ડુડે'

દૈનિકને સ્ત્રીઓ અને બાળકોને વંચાવવા દરમ વસાવો.

(લોકહિત પ્રકાશન સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા જનહિતાર્થે પ્રકાશિત)

ગુજરાત ડુડે

GUJARAT TODAY
(Daily)

AHMEDABAD
SINCE-1991

કરન્સી માર્કેટ	
US.ડોલર	૮૩.૯૨
પાઉન્ડ	૧૧૧.૦૬
યુરો	૮૩.૭૨
સહીદી રિયાલ	૨૨.૩૬
સોનુ (૧૦ ગ્રા. ૨૪ કરેટ)	૭૩,૯૧૫
ચાંદી (૧ કિલો)	૮૩,૦૦૦

Regd. No.Guj.168/2023-2025 Valid up to Dt. 31-12-2025 ● RNI. No. 48870/91 ● વર્ન-૩૪ અંક-૩૦ ● તંત્રી : સુરુજાભાઈ ● E-mail : gujarattodaydaily@gmail.com For Advertisement:gtadv@yaho.co.in

મમતા બેનરજીને પદ પરથી હટાવવાની માંગ સાથે નવા વિદ્યાર્થી સંગઠનની રેલી હિંસક બની, ભાજપનું આજે ૧૨ કલાક પશ્ચિમ બંગાળ બંધનું આહ્વાન

'નાબન્ના અભિજન': દેખાવકારોએ બેરિકેડ તોડતાં પોલીસનો લાઠીચાર્જ, પાણીનો મારો

પોલીસની ફૂર કાર્યવાહી મામલે ભાજપે મમતા સરકારને નિશાન બનાવી, તૃણમૂલ કોંગ્રેસે શાંતિ હોળવાનો પ્રયાસ ગણાવ્યો



મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં કથિત બળાત્કાર અને હત્યા કેસ અંગે મુખ્યમંત્રી મમતા બેનરજીના રાજીનામાની માંગ કરવાનો હતો. હાલમાં બિજા પાસે ભીડને આગળ વધવા માટે પ્રદર્શનકારીઓએ બેરિકેડને તોડવાનો પ્રયાસ કર્યો અને પોલીસ પર પથ્થરમારો કર્યો ત્યારે પોલીસ દ્વારા લાઠીચાર્જનો ઉપયોગ કરવો પડ્યો ત્યારે મુખ્ય સ્થળે જામીન પર બોલ્ટ કરીને લોકોને જવાબમાં કોલકાતા પોલીસે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી જેમાં તેઓ પર પથ્થરમારો 'ગેરકાયદેસર અને અનધિકૃત' જાહેર કરાયેલા વિરોધમાં સમગ્ર શહેરમાં ભારે પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. ડીસીપી સાઉથ ઈસ્ટ ક્રાંતિલાલ પાટીલે જણાવ્યું, 'આ ઘટના સોમવારે રાત્રે ૧૧:૩૦થી ૧૨:૦૦ વાગ્યાની વચ્ચે સંતોષ નગર પોલીસ સ્ટેશનની હદમાં બની હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને સીસીટીવી દ્વારા ટ્રેકિંગ કર્યા પછી બે લોકોને કસ્ટડીમાં લીધા. તેમાંથી એક વ્યક્તિ મુખ્ય જવાબદાર છે. મુખ્ય સ્થળે પર ૬૦૦થી વધુ કોલકાતા પોલીસ કર્મચારીઓ તેનાતી સાથે શહેર એક કિલ્લામાં પરિવર્તિત થઈ ગયું હતું. કાલીઘાટ સ્થિત મમતા બેનરજીના નિવાસસ્થાન પાસે પણ સુરક્ષા સહન કરવામાં આવી હતી. મધ્ય કોલકાતાના કોલેજ સ્વરે અને હાલમાં સંતરાગાદીથી શરૂ થયેલી રેલી વિરોધકર્તાઓને રાજ્ય સચિવાલય સુધી

આર.જી. કરની ભયાનક ઘટના મામલે 'ગેરકાયદે' વિરોધ પ્રદર્શન માટે નાબન્નામાં બેરિકેડ અને ડ્રોન સાથે પોલીસ સજજ બની હતી

(એજન્સી) કોલકાતા, તા. ૨૭ મંગળવારે કોલકાતામાં 'નાબન્ના અભિજન' વિરોધ કૂચ દરમિયાન દેખાવકારોની પોલીસ સાથે અથડામણ થતાં તણાવ વધી ગયો હતો. નવા રચાયેલા વિદ્યાર્થી સંગઠન પશ્ચિમ બંગાળ છાત્ર સમાજ (પશ્ચિમ બંગાળ વિદ્યાર્થી સમાજ) દ્વારા આયોજિત રેલીનો ઉદ્દેશ્ય આર.જી. કર

કોલકાતામાં 'નાબન્ના અભિજન'નું નેતૃત્વ કરનાર વિદ્યાર્થી સંગઠન છાત્ર સમાજ શું છે

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭ સરકારે વાત એ છે કે, ૩૧ વર્ષથી રેલિંગ્ટ ડેક્ટર માટે ન્યાય મેળવવાની ચળવળનું નેતૃત્વ કરી રહેલા વિરોધી જુનિયર ડેક્ટરોએ 'માર્ચ ટુ નાબન્ના' અથવા 'નાબન્ના અભિજન' રેલીથી પોતાને અલગ કર્યા હતા. તેના બદલે તેઓએ બુધવારે મધ્ય કોલકાતામાં એક અલગ રેલીનું આહ્વાન કર્યું છે. શહેરીઓએ પણ રેલીથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. CPI(M)ના યુવા નેતા મિનાબી મુખરજીએ કહ્યું છે કે, ગાંધી વિદ્યાર્થી સંગઠન, SFI અને DYFI રેલીમાં ભાગ લેશે નહીં અને એવું કહેવાયું કે, તે RSS સમર્થિત સંસ્થા દ્વારા આયોજિત કરવામાં આવી રહી છે. કોલકાતામાં મંગળવારે નવા વિદ્યાર્થી સંગઠન છાત્ર સમાજ દ્વારા નાબન્ના અભિજન રેલીનું આયોજન કરાયું હતું જેમાં આર.જી. કર મેડિકલ કોલેજમાં રેલિંગ્ટ ડેક્ટરના બળાત્કાર અને હત્યાની ઘટનામાં મુખ્યમંત્રી મમતા બેનરજીના રાજીનામાની મુખ્ય માંગ હતી. વહીવટીતંત્ર દ્વારા આ રેલીને ગેરકાયદે જાહેર કરાઈ હોવા છતાં સંગઠન રાજ્ય સચિવાલય તરફ કૂચ કરી હતી. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળ છાત્ર સમાજ કોઈ નોંધાયેલ વિદ્યાર્થી સંગઠન નથી. રવિન્દ્ર ભારતી યુનિવર્સિટીના માર્સલ વિદ્યાર્થી પ્રબીર દાસ, કલ્યાણી યુનિવર્સિટીના સુભાંકર હલદર અને રવિન્દ્ર મુક્તા યુનિવર્સિટીના સાયાન લાહિરી દ્વારા રેલીનું આહ્વાન કરાયું હતું. આ સંગઠનનો છાત્ર સમાજ નામ આપાયું હતું.

પહોંચતા અટકાવવા માટે બહુવિધ પોઈન્ટ બનાવવામાં આવ્યા હતા અને એલ્યુમિનિયમની સિક્યુરિટી દીવાલો રખાઈ હતી. એડીજ (કાયદો અને વ્યવસ્થા) મનોજ વર્માએ ચાર વિદ્યાર્થીઓની નિવારક ધરપકડની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, તેઓ 'હત્યાના કાવતરા અને હત્યાના પ્રયાસમાં સામેલ હતા.' પોલીસે કોના એક્સપ્રેસ વે અને વિદ્યાસાગર સેતુ જેવા મુખ્ય સ્થળે જામીન પર બોલ્ટ કરીને લોકોને અને સ્ટીલ સાથેના બેરિકેડ્સને પણ મજબૂત કર્યા હતા. હિંસાના ભય વચ્ચે હુલોળી નદીની બંને બાજુએ સશસ્ત્ર પોલીસ, આરએએફ અને વિશેષ લડાયક ટુર્પોની વિશાળ તેનાતી જોવા મળી હતી. પોલીસે ટિયરગેસના શેલ અને વોટર કેનન સાથે સર્વેલન્સ માટે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો હતો. પશ્ચિમ બિહારપુરમાં ભાજપ દ્વારા હિંસા ભડકાવી હોવાનો વીડિયો જાહેર કરનાર તૃણમૂલ કોંગ્રેસે આરોપ મૂક્યો હતો કે, 'રેલી એ જાહેર અવ્યવસ્થા બનાવવાનું ષડ્યંત્ર છે' ત્યારબાદ વીડિયોમાં દેખાતા લોકોને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. અશાંતિની અપેક્ષાએ ઘણી શાળાઓએ ઓનલાઈન વર્ગો પસંદ કર્યા અથવા મંગળવારે રજા જાહેર કરી. ગવર્નર વધુ કોલકાતા પોલીસ કર્મચારીઓ તેનાતી સાથે શહેર એક કિલ્લામાં પરિવર્તિત થઈ ગયું હતું. કાલીઘાટ સ્થિત મમતા બેનરજીના નિવાસસ્થાન પાસે પણ સુરક્ષા સહન કરવામાં આવી હતી. મધ્ય કોલકાતાના કોલેજ સ્વરે અને હાલમાં સંતરાગાદીથી શરૂ થયેલી રેલી વિરોધકર્તાઓને રાજ્ય સચિવાલય સુધી

રેલી પહેલાં જ વિદ્યાર્થી ગુમ : ભાજપ, જાહેર સુરક્ષા અને સલામતીને જોતા ધરપકડ કરી, પરિવારને જાણ કરાઈ : પોલીસ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭ આર.જી. કર ડેક્ટરના બળાત્કાર અને હત્યા અંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના રાજીનામાની માગણી કરતી 'નાબન્ના અભિજન' કૂચના થોડા કલાકો પહેલાં ચાર વિદ્યાર્થી કાર્યકરો ગુમ થયા હોવાનો ભાજપે દાવો કર્યો હતો. વિપક્ષના નેતા સુવેદુ અધિકારીએ દાવો કર્યો વિદ્યાર્થીઓની ઓળખ સુભોજિત ઘોષ, પુલોકેશ પાંડે, ગોમત સેનાપતિ અને પ્રીતમ સરકાર તરફ કરવામાં આવી છે જે મધ્યરાત્રિ પછી ગાયબ થતાં પહેલાં હાલના સ્ટેશન પર સ્વયંસેવકોને પાછા પદાર્થો વહેંચી રહ્યા હતા. અમારી શંકા છે કે, પોલીસે તેમની ધરપકડ કરી હોય અથવા અટકાયત કરી હોઈ શકે છે. જો કે, રાજ્ય પોલીસે આ દાવાને પગથી કાઢતા આ કસ્ટોડિયન પર જણાવ્યું હતું કે, 'એક ચોક્કસ રાજકીય નેતા ગત રાતથી દેખીતી રીતે ગુમ થયેલા ચાર વિદ્યાર્થીઓ વિશે ખોટી વાર્તા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સત્ય એ છે કે, કોઈપણ ગુમ નથી.' પોલીસે ઉમેર્યું હતું કે, 'આ ચારેય મંગળવારે નાબન્ના અભિજન દરમિયાન મોટાપાયે હિંસા આયોજિત કરવાની યોજના ઘડી રહ્યા હતા અને તેઓ હત્યા અને હત્યાના પ્રયાસના કાવતરામાં સામેલ હતા. જાહેર સલામતી અને સુરક્ષાના હિતમાં તેમની ધરપકડ કરવામાં આવી છે અને તેમના પરિવારોને જાણ કરવામાં આવી હતી.'

ગુંડાઓના ટોળાએ પોલીસ પર ઈંટો ફેંકી : મહુઆ મોઈત્રા

(એજન્સી) કોલકાતા, તા. ૨૭ તાજેતરના નાબન્ના અભિજન વિરોધ કૂચ પર પ્રતિક્રિયા આપતા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાએ મંગળવારે પ્રદર્શનની ટીકા કરી હતી અને વિરોધ કરનારાઓને 'ગુંડા' ગણાવ્યા હતા જે બાદ પોલીસે પણ પ્રતિક્રિયા આપી હતી. એક્સ પર મોઈત્રાએ કહ્યું, 'અમને પાઠ આપવાની જરૂર નથી' છાત્ર સંગઠન દ્વારા પોલીસ પર ઈંટો ફેંકાય છે, SHOનું માથું ફાટી ગયું છે. ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા અને બંગાળ ભાજપે પોલીસના 'અન્યાયો'ના વિરોધમાં બંધનું એલાન કર્યું છે. આ એક જૂની રમત છે. તેમણે ઉમેર્યું કે, 'ના, મુતદેહો પડ્યા નથી. ભાજપ અને ગોંદી મીડિયાને માફ કરશો તમારી ધોર ઈન્જાઓને નિરાશ થવું પડશે. આ કોઈ સામાન્ય નાગરિકની કૂચ નથી. વિદ્યાર્થીઓ? સ્ત્રીઓ? કે પછી ગુંડાઓનું ટોળું પોલીસ પર ઈંટો ફેંકે છે અને તેમને પ્રતિક્રિયા આપવા માટે ઉશ્કેરે છે.' અગાઉ તૃણમૂલ કોંગ્રેસે તેના અધિકૃત એક્સ-હેડલ પર ભાજપ પર વિરોધ પ્રદર્શન કરવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે, 'કોઈ ભૂલ ન કરશો, આ ન્યાય માટેનો વિરોધ નથી, આ અરાજકતા બંગાળ ભાજપ દ્વારા ગોઠવવામાં આવી છે, ભાડે રાખેલા ગુંડાઓ તંગદિલી ફેલાવે છે, બેરિકેડ તોડી રહ્યા છે અને કરજ પરના પોલીસ અધિકારીઓ પર હુમલો કરે છે. અશાંતિ ભડકાવવા અને બંગાળને અસ્થિર કરવા માટે આ એક આયોજનબદ્ધ કાવતરું છે.'

આર.જી. કર હોસ્પિટલના સેમિનાર રૂમમાં ભીડનો વીડિયો : તૃણમૂલના વરિષ્ઠ સાંસદે પૂછ્યું 'તેઓ કોણ છે'

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭ ભાજપના આઈટી સેલના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના પ્રબારી મહા મહાવિદ્યાએ સોમવારે કોલકાતાની આર.જી. કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના યોથા માળે સેમિનાર રૂમમાં ભીડ દર્શાવતો એક કથિત વીડિયો શેર કર્યો જ્યાં એક રેલિંગ્ટ ડેક્ટરનો ભયાનક બળાત્કાર અને હત્યા થઈ હતી, વીડિયો ઘટનાના થોડા સમય પછીનો છે. અમિત માલવિયા અનુસાર ડેક્ટરનો, પોલીસકર્મીઓ, હોસ્પિટલ સ્ટાફ અને બહારના લોકોની છાજરી સાથે ગુનાનું દૃશ્ય 'સંપૂર્ણપણે નાશ' કરવામાં આવ્યું હતું. દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સુખેન્દુ શેખર રોયે કથિત વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. શેખરે એક્સ પર લખ્યું કે, 'મીડિયામાં અહેવાલ મુજબ બળાત્કાર અને હત્યા બાદ આર.જી. કરના સેમિનાર હોલમાં ઘણા લોકો એકઠા થયા હતા. તેઓ કોણ છે? તેઓ શા માટે આવ્યા? કોની સૂચનાથી આવ્યા? શું તેમની કોલકાતા પોલીસે કે સીબીઆઈ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે? જો નહીં તો શા માટે? કૃપા કરીને લોકોને જવાબ આપો. આ લોકશાહી છે. મારે જવાબ આપવો જ પડશે.'

BNSSની કલમ ૧૬૩ હેઠળ પાંચ કે તેથી વધુ લોકોના મેળાવાનો રોકવા માટે નાબન્ના નજીક પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા હતા. સરકાર દ્વારા વ્યવસ્થા જાળવવાના પ્રયાસો છતાં વિરોધ પ્રદર્શન ચાલુ હોવાથી સ્થિતિ તંગ બની હતી. પોલીસે જણાવ્યું કે, પ્રદર્શનકારીઓએ બેરિકેડ તોડ્યા પછી સુરક્ષાકર્મીઓ પર હુમલા કર્યા હતા ત્યારબાદ અમારે લાઠીચાર્જ અને વોટર કેનનો સહારો લેવો પડ્યો હતો.

બેડૂતોના આંદોલન પર કંગનાની 'બળાત્કાર અને મૂતદેહો'ની ટિપ્પણીથી ભાજપ હરિયાણામાં મુશ્કેલીમાં આવી ગયું છે

(એજન્સી) ગુરુગ્રામ, તા. ૨૭ ભાજપની મંડી સાંસદ અને અભિનંદના કંગના રનોતે ભાજપને હરિયાણામાં મુશ્કેલીમાં મૂકી દીધી છે, તેણે એક ઈન્ટરવ્યુમાં આરોપ લગાવ્યો છે કે ૨૦૨૦-૨૦૨૧ના બેડૂતોના આંદોલન દરમિયાન, "મુતદેહો લટકતા હતા અને બળાત્કાર થઈ રહ્યા હતા" અને ત્યાં ભારતમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ બનાવવાની યોજના હતી. તેણીએ એવું પણ સૂચવ્યું હતું કે આ વિરોધની પાછળ વિદેશી સત્તાઓ, ચીન, અમેરિકા હતા.

દૈનિક ભાસ્કર સાથેના ઈન્ટરવ્યુમાં તેણીની ટિપ્પણીથી રાજકીય તોફાન ઊભું થયું છે અને ભાજપ ડેમોક્રેટીક મોડમાં આવી ગયું છે અને તેણીના મંતવ્યોથી પોતાને દૂર રાખ્યા છે. દિલ્હીમાં મીડિયા વિભાગ દ્વારા સોમવારે જારી કરાયેલ એક નિવેદનમાં પાર્ટીએ કહ્યું છે કે બેડૂતોના આંદોલનના સંદર્ભમાં કંગનાની ટિપ્પણી એ પાર્ટીનો અભિપ્રાય નથી અને તે તેની સાથે અસંમતિ વ્યક્ત કરે છે. રાજાવાતને ભવિષ્યમાં આવા નિવેદનો ન આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ભાજપ "સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિચારસ અને સબકા પ્રયાસ" અને સામાજિક સમરસતાના તેના સિદ્ધાંતને અનુસરવા માટે સંકલ્પબદ્ધ છે. હરિયાણા ભાજપના નેતાઓએ કોલકાતાની વિધાનસભાની ચૂંટણીમાં બેડૂતો સામેની તેણીની ટિપ્પણીથી પાર્ટીને થતા નુકસાન વિશે માહિતગાર કરવા માટે પાર્ટી હાઈકોમિશનનો સંપર્ક કર્યો હોવાનું જણવા મળ્યા પછી કેન્દ્રીય ભાજપે હસ્તક્ષેપ કર્યો છે. ઘણા BJP નેતાઓ રનોતેની ટિપ્પણીના પરિણામ વિશે ચિંતિત છે. કંગનાની આગામી ફિલ્મ ઈમરજન્ટ પ્રમોટ કરવાના હેતુ સાથે આ ઈન્ટરવ્યુની એક ક્લિપ X રવિવારના રોજ શેર કરવામાં આવી હતી અને આ અભિનેત્રી દ્વારા તેને ફરીથી પોસ્ટ કરવામાં આવી હતી. તેમાં તેણીને કહેતા સાંભળી શકાય છે કે જે બાંગ્લાદેશમાં થયું તે અહીં ભારતમાં થઈ શકે છે. જો અમારું દેશનું નેતૃત્વ મજબૂત ન હોત તો આનું થયું હોત. જ્યારે બેડૂતોએ દિલ્હીની બહાર વિરોધ પ્રદર્શન કર્યો હતો, ત્યારે ત્યાં લાશો લટકતી હતી અને બળાત્કાર થઈ રહ્યા હતા. અને, જ્યારે બેડૂતો



હિમાચલના મંડીના સાંસદ રણોત દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીથી પોતાને દૂર રાખતા ભાજપે સોમવારે નિવેદન બહાર પાડ્યું હતું. તેણે કહ્યું કે આ ટિપ્પણીઓ 'પાર્ટીનો અભિપ્રાય નથી' અને પક્ષ તેની સાથે 'અસંમત' છે

મંડીપૂર્ણ બિલો પાછા લેવામાં આવ્યા, ત્યારે સમગ્ર દેશને આંચકો લાગ્યો હતો. પરંતુ તે બેડૂતો હજી પણ ધરપકડ પર બેઠા છે. તેઓએ ક્યારેય વિચાર્યું ન હતું કે સરકાર અલગ પડે તેથી શેરે. તેણીએ કહ્યું કે, શું તમને લાગે છે કે આ યોજના બેડૂતોની હતી? ચીન અને અમેરિકા જેવા વિદેશી દળો અહીં આપણા દેશમાં કામ કરી રહ્યા છે. હરિયાણાના કેટલાક વરિષ્ઠ બીજીપી નેતાઓએ સ્વીકાર્યું છે કે અભિનેત્રીના આ નિવેદનો વિધાનસભાની ચૂંટણી પહેલા મુશ્કેલી ઊભી કરી શકે છે. રાજ્યના એક નેતાએ, નામ ન આપવાની વિનંતી કરતાં જણાવ્યું હતું કે મોટાભાગના પક્ષના નેતાઓ, પાસ કરીને ગ્રામીણ મતવિસ્તારમાં રહેલા લોકો ચિંતિત હતા. જ્યારે લોકસભાની ચૂંટણી શરૂ થઈ ત્યારે અમારી પાર્ટી માટે બેડૂતોનો વિરોધ એક મોટો મુદ્દો હતો. પૂર્વ મુખ્યમંત્રી ફિલ્મ ઈમરજન્ટ પ્રમોટ કરવાના હેતુ સાથે આ ઈન્ટરવ્યુની એક ક્લિપ X રવિવારના રોજ શેર કરવામાં આવી હતી અને આ અભિનેત્રી દ્વારા તેને ફરીથી પોસ્ટ કરવામાં આવી હતી. તેમાં તેણીને કહેતા સાંભળી શકાય છે કે જે બાંગ્લાદેશમાં થયું તે અહીં ભારતમાં થઈ શકે છે. જો અમારું દેશનું નેતૃત્વ મજબૂત ન હોત તો આનું થયું હોત. જ્યારે બેડૂતોએ દિલ્હીની બહાર વિરોધ પ્રદર્શન કર્યો હતો, ત્યારે ત્યાં લાશો લટકતી હતી અને બળાત્કાર થઈ રહ્યા હતા. અને, જ્યારે બેડૂતો

વિદ્યાર્થી મંચ 'છાત્રસમાજ' અને રાજ્ય સરકારના કર્મચારીઓના 'સંસ્ક્રામી જોથા મંચ' દ્વારા આયોજિત આ રેલી ઉત્તર કોલકાતાના કોલેજ સ્વરે અને હાલમાં સંતરાગાદી એમ બે સ્થળેએથી શરૂ થઈ હતી.

દેશના અઢદાતાઓ માટે નફરત કેમ છે? ભાજપે હિંસા આપણા બેડૂતોને જુદા, છેતરપિંડી કરનારા, ઇચ્છ્ય કરનારા કહ્યા છે અને અન્યાયો કર્યા છે. અને ફરી એકવાર, એક બીજીપી સાંસદ અમારા બેડૂતો પર પાયાવિહોણા આક્ષેપ કર્યા છે. પ્રશ્ન એ છે કે... શું કંગનાએ ભાજપની ચૂંટણીની રણનીતિના ભાગરૂપે બેડૂતો પર આ અધમ આરોપ લગાવ્યા છે? કોંગ્રેસના સોશિયલ મીડિયા અને ટિજિટલ પ્લેટફોર્મના ચેરપર્સન સુપ્રિયા શ્રીનેતા પણ કંગનાની ટિપ્પણીની નિંદા કરી અને માફીની માંગ કરતા કહ્યું કે, કંગના રનોતે ગર્ભકાંડ દેશના બેડૂતોને હત્યાના અને બળાત્કારની કહ્યા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે અમેરિકા અને ચીન બેડૂતોના વિરોધને ભડકાવીને દેશમાં અસ્થિરતા પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપ આનાથી છટકી શકે નહીં. હરિયાણાના બીજીપીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે પાર્ટીએ કંગનાને તેના ડેમેનની બહારના મુદ્દાઓ વિશે વાત કરવાનું બંધ કરવાનું કહેવાની જરૂર છે. શું બોલવું અને શું ન બોલવું તે શીખવામાં અમને થવું લાગ્યા છે. પક્ષની સંભાવનાઓને અસર કરતી બાબતો પર બેડૂતોનો અભિપ્રાય આપતા પહેલા તેણીએ પણ ઘણું શીખવાની જરૂર છે. તે કિસાન નેતા, રાષ્ટ્રીય પ્રવક્તા અથવા હરિયાણાની પણ નથી, તેથી સ્પષ્ટપણે આવા નિવેદનો આપવાનું તેણીનું કામ નથી. તે વિપક્ષને મુશ્કેલો આપે છે, જે પહેલાથી જ કુસ્તીબાજીના મુદ્દાઓ અભિપ્રાય યોજના પર ભાજપને નિશાન બનાવી રહ્યા છે.

લોકસભા ચૂંટણી દરમિયાન, તેણીની વિવાદાસ્પદ ટિપ્પણીથી ચિંતિત, ભાજપે કંગનાને મોટી સરકારના કામ અને ખલિલા સશસ્ત્રકરણ સાથે સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને બોલવા માટે કહ્યું હતું. વરિષ્ઠ નેતાઓને પણ વિવાદ ટાળવા માટે કાર્યકર્મો દરમિયાન તેમની સાથે રહેવાનું કામ સોંપવામાં આવ્યું હતું. હરિયાણા બીજીપીના પ્રવક્તા સંજય શામગે દલીલ કરી હતી કે કંગનાની ટિપ્પણીનો યોગ્ય સંદર્ભમાં સમજવામાં આવી નથી. ૨૦૨૧માં, પશ્ચિમ બંગાળની ૨૬ વર્ષીય કાર્યકર્તા પર ટીકા કરી વિરોધ સ્થળ પર કથિત રીતે બળાત્કાર થયો હતો. થોડા અઢવાડિયા પછી તેણીનું કોવિડથી મૃત્યુ થયું, અને તેના પિતાની હરિયાદ પર હુલોડો સામે ગેંગરેપની એક્સઆઈઆર નોંધવામાં આવી હતી.

'આ શરમજનક અને બેડૂત વિરોધી વિચારધારા છે': રાહુલ ગાંધીએ કંગના રણોતની ટિપ્પણી પર ભાજપની ટીકા કરી

X પર હિન્દીમાં એક પોસ્ટમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, બેડૂતોને આપેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ ગયેલી મોટી સરકારની પ્રચાર મશીનરી સતત બેડૂતોનું અપમાન કરી રહી છે. કોંગ્રેસે કહ્યું છે કે જો શાસક પક્ષ કંગના રણોતની ટિપ્પણીથી સહમત નથી તો તેને પાર્ટીમાંથી હાંકી કાઢવી જોઈએ

(એજન્સી) તા. ૨૭ કોંગ્રેસે મંડીના સાંસદ કંગના રનોતેની બેડૂતોના આંદોલન અંગેની ટિપ્પણી પર ભાજપની ટીકા કરી છે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે આ શરમજનક અને બેડૂત વિરોધી ટિપ્પણીઓ પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ તેમજ સમગ્ર દેશના બેડૂતોનું અપમાન છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાજીન પાડોને પણ આ ટિપ્પણી પર ભાજપ પર આકાર પ્રહારો કર્યા અને કહ્યું કે આ શરમજનક અને અત્યંત નિંદનીય બેડૂત વિરોધી વિચારધારા છે અને તે મોટી સરકારની ટીકા છે. કોંગ્રેસે કહ્યું છે કે જો શાસક પક્ષ રણોતની ટિપ્પણીઓ સાથે અસંમત હોય તો તેને પાર્ટીમાંથી હાંકી કાઢવી જોઈએ.

તા. ૨૭ કોંગ્રેસે મંડીના સાંસદ કંગના રનોતેની બેડૂતોના આંદોલન અંગેની ટિપ્પણી પર ભાજપની ટીકા કરી છે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે આ શરમજનક અને બેડૂત વિરોધી ટિપ્પણીઓ પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ તેમજ સમગ્ર દેશના બેડૂતોનું અપમાન છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાજીન પાડોને પણ આ ટિપ્પણી પર ભાજપ પર આકાર પ્રહારો કર્યા અને કહ્યું કે આ શરમજનક અને અત્યંત નિંદનીય બેડૂત વિરોધી વિચારધારા છે અને તે મોટી સરકારની ટીકા છે. કોંગ્રેસે કહ્યું છે કે જો શાસક પક્ષ રણોતની ટિપ્પણીઓ સાથે અસંમત હોય તો તેને પાર્ટીમાંથી હાંકી કાઢવી જોઈએ.

સાંસદે બેડૂતોને ૩૭૮ દિવસની મેરેશોન સંઘર્ષ દરમિયાન પોતાના ૭૦૦ લોકોનું બલિદાન આપનારને બળાત્કારીઓ અને વિદેશી દળોના પ્રતિનિધિઓ તરીકે ઓળખાવ્યા છે અને તે પક્ષની બેડૂત વિરોધી નીતિ અને ઈરાદાનો વધુ એક પુરાવો છે. આ શરમજનક બેડૂત વિરોધી પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ તેમજ સમગ્ર દેશના બેડૂતોનું ધોર અધ્યક્ષ મલ્લિકાજીન પાડોને પણ આ ટિપ્પણી પર ભાજપ પર આકાર પ્રહારો કર્યા અને કહ્યું કે આ શરમજનક અને અત્યંત નિંદનીય બેડૂત વિરોધી વિચારધારા છે અને તે મોટી સરકારની ટીકા છે. કોંગ્રેસે કહ્યું છે કે જો શાસક પક્ષ રણોતની ટિપ્પણીઓ સાથે અસંમત હોય તો તેને પાર્ટીમાંથી હાંકી કાઢવી જોઈએ.

મંડીના સાંસદે હિન્દી દૈનિક ભાસ્કર સાથેના તેના ઈન્ટરવ્યુની ક્લિપ પોસ્ટ કર્યા પછી વિરોધ પક્ષની આ પ્રતિક્રિયા આવી છે. આ ક્લિપમાં તેણીએ સૂચવ્યું હતું કે ભારતમાં "બાંગ્લાદેશ જેવી પરિસ્થિતિ" ઊભી થઈ શકે છે પરંતુ દેશના મજબૂત નેતૃત્વને લીધે આ શક્ય બન્યું નથી. ત્યારબાદ તેણીએ આક્ષેપ કર્યો હતો કે હવે ત્રણ કૃષિ કાયદા સામે બેડૂતોના વિરોધ દરમિયાન ત્યાં મુતદેહો લટકાવવામાં આવ્યા હતા અને બળાત્કાર થઈ રહ્યા હતા. તેણીએ આ "ઇચ્છ્ય"માં ચીન અને યુએસની સંરેવણીનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, બેડૂતોને આપેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ ગયેલી મોટી સરકારની પ્રચાર મશીનરી સતત બેડૂતોનું અપમાન કરી રહી છે. ભાજપના

સાંસદે બેડૂતોને ૩૭૮ દિવસની મેરેશોન સંઘર્ષ દરમિયાન પોતાના ૭૦૦ લોકોનું બલિદાન આપનારને બળાત્કારીઓ અને વિદેશી દળોના પ્રતિનિધિઓ તરીકે ઓળખાવ્યા છે અને તે પક્ષની બેડૂત વિરોધી નીતિ અને ઈરાદાનો વધુ એક પુરાવો છે. આ શરમજનક બેડૂત વિરોધી પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ તેમજ સમગ્ર દેશના બે

દોષિત ઠરાવવા વિરુદ્ધ પૂર્વ IPS સંજીવ ભટ્ટની અપીલ અંગે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારી

પ્રભુદાસ વૈષ્ણાનીના મૃત્યુ માટે સહ-આરોપી પ્રવિણસિંહ ઝાલા સાથે સંજીવ ભટ્ટને દોષિત ઠરાવવામાં આવ્યા હતા, ભટ્ટે ગુજરાત હાઈકોર્ટના જાન્યુઆરી ૨૦૨૪ના ચુકાદા સામે અપીલ કરી હતી, પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટે ૧૯૯૬ના ડ્રગ પ્લાન્ટિંગ કેસમાં દોષિત ઠરાવ્યા હતા

(એજન્સી) તા.૨૭ સુપ્રીમ કોર્ટે મંગળવાર, ૨૭ ઓગસ્ટના રોજ પૂર્વ ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી સંજીવ ભટ્ટની ૧૯૯૬ના કસ્ટોડિયલ ડેથ કેસમાં તેમની દોષિત ઠરાવવામાં આવ્યા તેની વિરુદ્ધ અરજી પર ગુજરાત સરકારનો જવાબ માંગ્યો હતો. તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ન્યાયાધીશ વિક્રમનાથ અને પ્રસન્ના બી. વરાલેની બેન્ચે જણાવ્યું હતું કે, આ નોટિસનો ચાર સપ્તાહમાં જવાબ આપવાનો રહેશે. કોર્ટે આ અપીલને કેસ સાથે સંબંધિત અન્ય બાબતો સાથે પણ ટેંગ કરી છે.



એ જિએ જેલની બહાર છે. રિવિઝન બેન્ચે આદેશ આપતા જણાવ્યું હતું કે, આઈપીસીની કલમ ૩૦૨ હેઠળ સજાપાત્ર અપરાધો માટે સંબંધિત આરોપીઓને દોષિત ઠરાવવાનો વખતે અમે ટ્રાયલ કોર્ટ દ્વારા નોંધાયેલા તર્કનો આદેશ પસાર કર્યો છે. ન્યાયાધીશોએ જણાવ્યું હતું કે, રેકોર્ડ પર આધારિત પુરાવાઓ પરથી, અમારો અભિપ્રાય છે કે, ટ્રાયલ કોર્ટે પાંચ આરોપીઓને કલમ ૩૦૨ હેઠળ સજાપાત્ર અપરાધો માટે યોગ્ય રીતે દોષિત કર્યા છે. ભટ્ટ અને ઝાલા બંને પોલીસ અધિકારીઓને જાનનગરની સેશન્સ કોર્ટે ૨૦ જૂન, ૨૦૧૯ના રોજ હત્યા

અધિકારીઓ પર ફરિયાદો તેને રોચક કરવાનો અને તેના મૃત્યુનો આરોપ લગાવ્યો હતો. ભટ્ટની ૫ સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેના પર ડ્રગ રાખવા માટે એક વ્યક્તિને ખોટી રીતે ફસાવવાનો આરોપ છે. આ કેસમાં સુનાવણી ચાલી રહી છે. તેઓ કાર્યકર્તા તિસ્તા સેતલવાડ અને ગુજરાતના પૂર્વ પોલીસ મહાનિદેશક આર.બી. શ્રીકુમાર સાથે ૨૦૦૨ના ગુજરાત રમખાણોના કેસમાં પુરાવાના કથિત બનાવટના કેસમાં પણ આરોપી છે. ૨૦૦૨ના ગુજરાત રમખાણોમાં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા અંગે સુપ્રીમ કોર્ટમાં એક્ટિવિટ દાખલ કરતી વખતે ભટ્ટ હેડલાઈનમાં આવ્યા હતા. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તેમના આરોપોને રદિયો આપવામાં આવ્યો હતો. તેમને ૨૦૧૧માં સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ઓગસ્ટ ૨૦૧૧માં ગૃહ મંત્રાલય દ્વારા 'અનધિકૃત રહેઠાણ' માટે ભરતરફ કરવામાં આવ્યા હતા. કસ્ટોડિયલ ડેથ કેસમાં જાનનગર કોર્ટે અન્ય પાંચ પોલીસકર્મીઓ - સબ-ઈન્સ્પેક્ટર દિપક શાહ અને શૈલેષ પંડ્યા અને કોન્સ્ટેબલ પ્રવિણસિંહ જાડેજા, અનો પસિંહ જેટવા અને કેશુભા જાડેજાને બે વર્ષની જેલની સજા ફટકારી હતી.

યુકેન યુદ્ધ નિષ્ફળ જતાં પુતિને ચેચન મસ્જિદમાં કુઆનને ચુંબન કર્યું

(એજન્સી) મોસ્કો, તા.૨૭ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કુઆનની નક્કલને ચુંબન કરતા દર્શાવતી એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ચેચનની રાજધાની શ્રોઝનીમાં નવનિર્મિત પયગમ્બર ઈસા(અ.સ.) મસ્જિદની મુલાકાત લેતા પુતિને આ ઈશારો કર્યો હતો. તેમની સાથે ચેચન રિપબ્લિકના વિવાદાસ્પદ નેતા રમઝાન કાદિરોવ હતા, જેમણે યુકેન પર રશિયાના આક્રમણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. વીડિયોમાં પુતિનને કુઆનની સોનાની કોપી સાથે રજૂ કરતા જોઈ શકાય છે, તેને ચુંબન કરતા પહેલા અને તેને પકડી રાખે છે, જ્યારે કાદિરોવ તેમની બાજુમાં ઊભા છે. રશિયન નેતાએ મંગળવારના દિવસે લગભગ ૧૩ વર્ષમાં ચેચનના તેમની પ્રથમ સફર કરી હતી, યુકેન પુસ્તકાલયમાં આંચકા વચ્ચે, યુકેનિયન દળોએ દુર્ક વિસ્તારની આસપાસના રશિયન પ્રદેશમાં ઘુસણખોરી ચાલુ રાખી હતી. યુકેનમાં યુદ્ધ ચાલુ હોવાથી તેઓ રશિયન સશસ્ત્ર દળોમાં ચેચનની ભરતીને પ્રોત્સાહિત કરવા માટે ત્યાં હતા. રશિયન નેતાએ સ્પેશિયલ ફોર્સ એકેડમીની મુલાકાત લીધી જ્યાં યુકેનમાં તેનાથ પહેલા સૈનિકોને તાલીમ આપવામાં આવી રહી હતી અને ચેચન સ્વયંસેવકોની પ્રશંસા કરતા કહ્યું કે, જ્યાં સુધી રશિયા પાસે તેમના જેવા માણસો છે ત્યાં સુધી તે અજેય છે. કાદિરોવે પુતિનને આવકારતા કહ્યું, અમે ૧૩ વર્ષથી તમારી રાહ જોઈ રહ્યા છીએ અને હું જાણું છું કે તમારી પાસે



ઘણી સમસ્યાઓ છે, મુદ્દાઓ છે જે તેમને જાતે જ હલ કરશે છે, જેમાં અમારા પ્રજાસત્તાકનો પણ સમાવેશ થાય છે. કાદિરોવે ૨૦૦૭થી રશિયામાં રશિયન તરફી વહીવટને નેતૃત્વ કરી રહ્યા છે. પ્રજાસત્તાકને અંગીત રશિયન નિયંત્રણથી અલગ થવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે ૧૯૯૦ અને ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં બે વિનાશક યુદ્ધ થયા હતા. કાદિરોવે રશિયન આશ્રય હેઠળ યુસ્તપણે શાસન કર્યું છે, અસંમતિ અને માનવ અધિકારો તમજાવવામાં આવેલા વહીવટને ટળાવી અને ચેચન લડવામાં ચેચન માટે લડવા માટે યુકેન તરફ દોષ્ય છે. સ્વતંત્રતા તરફી ચેચન લડવામાં રશિયા સામે યુકેન માટે લડી રહ્યા હોવાનો માનવામાં આવે છે. કુઆન તરફ પુતિનનો સંકેત મુસ્લિમોને આપી રહ્યા માટે રશિયાની સૈનિકોને તાલીમ આપવામાં આવી રહી હતી અને ચેચન સ્વયંસેવકોની પ્રશંસા કરતા કહ્યું કે, જ્યાં સુધી રશિયા પાસે તેમના જેવા માણસો છે ત્યાં સુધી તે અજેય છે. કાદિરોવે પુતિનને આવકારતા કહ્યું, અમે ૧૩ વર્ષથી તમારી રાહ જોઈ રહ્યા છીએ અને હું જાણું છું કે તમારી પાસે

અલ-અક્સા મસ્જિદ ખાતે યહૂદી દેવળ બાંધવાની ઈઝરાયેલની દરખાસ્ત વખોડી કાઢતું સઉદી અરેબિયા, આ તો વિશ્વભરના મુસ્લિમોની ઉશ્કરણી કરવા સમાન

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૭ ઈઝરાયેલના આંતરિક સુરક્ષામંત્રી બેન-ગ્વિર દ્વારા અલ-અક્સા ખાતે યહૂદી ધર્મનું દેવળ બનાવવાની હિમાયત કરતા ઉચ્ચારણને સઉદી અરેબિયાએ સખત શબ્દોમાં વખોડી કાઢ્યા છે. સઉદી વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં ઈઝરાયેલી મંત્રીના વિધાનોની ટીકા કરવામાં આવી છે અને આ ચૂચનને અત્યંત કટ્ટરવાદી અને ઉદ્દેશજનક ગણાવ્યું છે. ગાઝામાં યુદ્ધ વિરામની મંત્રણાઓ ચાલી રહી છે બરાબર એ સમયે ઈઝરાયેલી મંત્રીના નિવેદનથી તણાવમાં વધારો થયો છે. એક મુલાકાતમાં ઈઝરાયેલના સુરક્ષા મંત્રીએ અલ-અક્સાની જગ્યાએ દેવળ બાંધવાની જે વાત કરી છે એ ચારેતરફથી ટીકાને ખાત બન્યું છે અને આ નિવેદનને સખત પ્રદેશમાં વધારો કરનારું જણાવવામાં આવ્યું છે. સઉદી



અરેબિયાએ સખત ટીકા કરતા જણાવ્યું છે કે, અલ-અક્સા મસ્જિદના ઐતિહાસિક અને કાનૂની વૈધાનિક દરજ્જાને માન આપવું મહત્વપૂર્ણ છે. સઉદી મંત્રીના નિવેદનને કારણે ઈઝરાયેલના વિદ્યાર્થીઓ વિરુદ્ધ અસહકારક પગલા લેવા સઉદી અરેબિયાએ વિશ્વ સમાજને અનુરોધ કર્યો છે.

રત્નાગીરીમાં ફરજ પૂરી કરી ઘરે પરત ફરતી નર્સિંગની વિદ્યાર્થીની પર ઓટો ડ્રાઈવરનો બળાટકાર પીડિતાના માતા પિતા દ્વારા દુષ્કર્મનો કેસ દાખલ કરાયો, યુવતી હોસ્પિટલમાં, સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને શોધી રહી છે પોલીસ મહારાષ્ટ્રમાં રેપની એક વધુ ઘટનાથી સનસનાટી

(એજન્સી) મુંબઈ, તા.૨૭ મહારાષ્ટ્રમાં રેપની વધુ એક ઘટના બહાર આવી છે રત્નાગીરીમાં ફરજ પૂરી કરતી ઘરે પરત ફરી રહેલી ૧૯ વર્ષની ઉંમરની એક નર્સિંગ વિદ્યાર્થીની પર ફોટો ડ્રાઈવરે બળાટકાર કર્યો હતો તેની ફરિયાદ પીડિતાના માતા પિતાએ નોંધાવ્યું હતું. વિદ્યાર્થીનીને સારવાર માટે હોસ્પિટલમાં યુવતીને પીણામાં નશાની દવા મિલાવી ડ્રાઈવરને બળાટકાર કર્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. ઘટનાને પગલે ભારે લંગમા મચી ગયો છે અને દેખાવો શરૂ થઈ ગયા છે. પોલીસે જણાવ્યું હતું કે નર્સિંગની વિદ્યાર્થીની ઓટોમાં બેસીને ઘરે પાછી

૨૦૨૦ દિલ્હી રમખાણો : કોર્ટે મીરાં હેદરને ૧૦ દિવસના વચગાળાના જામીન આપ્યા

(એજન્સી) દિલ્હીની એક અદાલતે ૨૦૨૦ના રમખાણો પાછળના કથિત કાવતરાને લગતા UAPA કેસમાં જામિયા મિલિયા ઈસ્લામિયાના વિદ્યાર્થી મીરાં હેદરને ૧૦ દિવસના વચગાળાના જામીન આપ્યા છે તે મીડિયાને બોલશે નહીં કે ઈન્ટરવ્યુ આપશે નહીં અને સામાન્ય લોકોને પણ મળશે નહીં. ઓરિસ્સા સેશન્સ જજ સમીર બાજપાઈ સાર અઠવાડિયા માટે વચગાળાના જામીન માટે હેદરની અરજી પર સુનાવણી કરી રહ્યા હતા. કોર્ટે માનતાના પોરણે આપેલી અરજીની નોંધ લીધી હતી અને નોંધ્યું કે તેની બહેન સાથે રહેવા માટે કોઈ પુરૂષ સત્વ નથી, જેમનું અકાળ બાળક મૃત્યુ પામ્યું હતું. તેમણે અરજીની નોંધ લીધી છે હેદર ૧ એપ્રિલ, ૨૦૨૦થી વચગાળાના જામીન

ઉત્તરપ્રદેશમાં બે યુવતીઓના મૃતદેહ ઝાડ પર લટકતા મળી આવ્યા, બેવડી આત્મહત્યાની ઘટના હોવાની પોલીસને આશંકા

જિલ્લા પોલીસ વડા કહે છે, વૃક્ષ પાસેથી બાળાઓના કપડામાંથી એક મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યા

(એજન્સી) ફરૂખાબાદ, તા.૨૭ ઉત્તરપ્રદેશના ફતેહગઢ વિસ્તારમાં મંગળવારે ૧૫ અને ૧૯ વર્ષની વયની બે યુવતીઓના મૃતદેહો ઝાડ પર લટકતા મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને પ્રથમદર્જી રીતે બેવડી આત્મહત્યાનો કેસ હોવાની પોલીસને શંકા છે. ફતેહગઢના પોલીસ વડા આલોક પ્રિયદર્શિએ જણાવ્યું હતું કે, કાયમગંજ પોલીસ મથક વિસ્તારના ગામની બહારથી બંને બાળાઓના મૃતદેહો સવારે વૃક્ષ પર લટકતા મળી આવ્યા હતા. આ બાબતમાં તપાસ ચાલી રહી છે. ગ્રામજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા જ સ્થાનિક પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી બંને યુવતીઓ ૧૫ અને ૧૮

રાજસ્થાનના ભીલવાડામાં બે મુસ્લિમોને માર મારવામાં આવ્યો, કોમી તંગદિલી રાજસ્થાનના ભીલવાડામાં બે મુસ્લિમો (કાસિમ અને રેહાન)ને બેરહમીથી માર મારવામાં આવ્યો

(એજન્સી) ભીલવાડા, તા.૨૭ રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં આગલા દિવસે એક મંદિર પાસે ગાયની કપાલે પૂંછડી મળી આવતા વિરોધ કરી રહેલા હિન્દુવાદી સંગઠનોના ગુસ્સાનો ભોગ ત્યાંથી મુસ્લિમ થઈ રહેલ બે મુસ્લિમોએ બન્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, રાજસ્થાનના ભીલવાડા શહેરમાં એક મંદિરની નજીક 'ગાયની પૂંછડી'નો કપાલ ભાગ મળી આવ્યાના બીજા દિવસે કોમી તંગદિલી સર્જતું દુકાનદારોએ દુકાનના શટર પાડી દીધા હતા. બે મુસ્લિમોના વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે જેમાં તેઓ મુસ્લિમ કહી રહ્યા છે કે તેઓ વિરોધના સ્થળેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે હિન્દુવાદી ટોળાએ તેમને માર માર્યા હતા. મોહમ્મદ કાસિમે જણાવ્યું હતું કે જ્યારે તે શારૂની નગરમાંથી કેટલીક ઘરવપરાશની વસ્તુઓ ખરીદીને ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેને માર મારવામાં આવ્યો હતો અને તેનો મોબાઈલ ફોન સેટ ટોળાએ છીનવી લીધો



હતા જેઓ મને મારતા હતા." મુસ્લિમોના ઘરો અને દુકાનો પર પથ્થરમારો કરવામાં આવી રહ્યો હોવાના વીડિયો પણ સામે આવ્યા છે. હિન્દુવાદી ટોળાને મુસ્લિમ વિસ્તારમાં ઘૂસીને ઘરો પર પથ્થરમારો કરતા પછા જોઈ શકાય છે. પરિસ્થિતિ વિશે વાત કરતા, ભીલવાડાના કલેક્ટર નમિત મહેતાએ કહ્યું: "અમને એક એવી ઘટના વિશે માહિતી મળી છે જ્યાં એક ધાર્મિક સ્થળની સામે ગાયની પૂંછડી મળી આવી અને સ્થાનિક લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો. આ સંદર્ભે, સ્થાનિક જનપ્રતિનિધિઓ અને સંતો સાથે વાતચીત કરવામાં આવી હતી અને વિરોધનો અંત આવ્યો હતો. તેમને ખાતરી આપવામાં આવી હતી કે આ ઘટના પાછળ જેઓ છે તેમને જલ્દી પકડી લેવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ તૈનાત છે. વાતાવરણ શાંતિપૂર્ણ છે." ભીલવાડાના એસપી રાજન દુબેએ જણાવ્યું કે મંદિર પાસે ગાયની કપાલે પૂંછડી અંગે એક આઈઆર નોંધવામાં આવી છે.

દુબેને કહ્યું કે, "અમને ગાયની પૂંછડી વિશે માહિતી મળી જે ભીલવાડામાં એક ધાર્મિક સ્થળ પાસે મળી આવી હતી. ગાયને સ્થાનિક વેસ્તરની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. એક આઈઆર નોંધવામાં આવી છે અને ઘટના પાછળના લોકોની ઓળખ માટે તપાસ ચાલી રહી છે. આ ઘટનાનો વિરોધ કરવા માટે એક ઠાણે લોકોને કહેવામાં આવ્યું હતું કે આરોપીઓ જલ્દી પકડાઈ જશે. પ્રદર્શનાકારીઓ વિખેરાઈ ગયા છે અને પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ તૈનાત છે. અમે અસામાજિક તત્વો સામે સતર્ક છીએ. અમે કોઈને ભીલવાડામાં વાતાવરણને ખલેલ પહોંચાડવાની મંજૂરી આપીશું નહીં." તેમણે કહ્યું કે આઠ લોકોને પૂછપરછ માટે પકડવામાં આવ્યા છે. વિરોધીઓને મંદિર પાસે ગાયની પૂંછડી ફેંકનાર આરોપીઓ સામે બુલડોઝરની કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી. વિરોધે રદિયાઓ અને શોરૂ મ અને દુકાનોને નિશાન બનાવવામાં આવી હતી.

બલુચિસ્તાનના આતંકવાદી હુમલામાં પાકિસ્તાની આર્મીના ૧૪ જવાનો સહિત ૭૩નાં મોત

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૭ બલુચિસ્તાનમાં અલગ અલગ વિસ્તારોમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં ૭૩નાં મોત થયા છે. જેમાં ૧૪ સુરક્ષાકર્મીઓ પણ છે. લશ્કરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, બંદૂકધારીઓએ અલગઅલગ સ્થળે મુખ્ય હાઈવે પર બસ અને ટ્રકને રોકીને બેકામ ગોળીબાજ કર્યો હતો અને ૭૩ નાગરિકને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઘણાં સ્થળે તો મુસાફરોના આઈડી જોઈ જોઈને એમને ગોળીએ વીધવામાં આવ્યા હતા અને વાહનોને આગ લગાડી દેવામાં આવી હતી. એમના પરિવારની નજર સામે જ ઉતાડૂનોને ઠાર કરી દેવામાં આવ્યા હતા. મુસા ખેલ હાઈવે પર બંદૂકધારી આતંકવાદીઓએ ૩૫ વાહનોને આગ લગાડી દીધી હતી. પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નક્વીએ



જણાવ્યું હતું કે, તમામ હુમલાની જવાબદારી બલુચ લિબરેશન આર્મીએ લીધી છે. પૂબ જ આયોજિત કાવતરું કરીને હારુકામનું આઈડી એમપેરેશન ચલાવવામાં આવ્યું છે જેનો બદઈરાદો દેશમાં અરાજકતા ફેલાવવાનો છે. એ પછી પાકિસ્તાની સશસ્ત્ર દળોએ પણ જોરદાર વળતી કાર્યવાહી કરી હતી. આતંકીઓ સાથેના ભારે ગોળીબારમાં ૧૨ સૈનિકો અને પોલીસ કર્મી માર્યા ગયા હતા અને ૨૧ ત્રાસવાદીઓ પણ ઠાર થયા હતા.

મુંબઈ ડેટિંગ એપ સ્કેમ : ગોડફાધર કલબમાં હોટેલના બિલમાં ? ૫૫,૦૦૦ ગુમાવ્યા બાદ અંધેરીની અંબોલી પોલીસે પ્રથમ FIR દાખલ કરી

ડેટિંગ સાઈટ દ્વારા મહિલાને મળનાર વ્યક્તિ ગોડફાધર હોટેલમાં ગયો હતો, જ્યાં કથિત રીતે મહિલા અને હોટેલના કર્મચારીઓએ તેને પાવા-પીવા માટે રૂ. ૫૫,૦૦૦નું અધક બિલ આપીને છોટરવાનું કાવતરું ઘડ્યું હતું (એજન્સી) તા.૨૭ મુંબઈ પોલીસે ડેટિંગ એપ કોબાંડામાં પ્રથમ એક આઈઆર નોંધી છે. અંબોલી પોલીસે ૨૪ ઓગસ્ટે એક અજ્ઞાત મહિલા વિરુદ્ધ FIR દાખલ કરી હતી. ફરિયાદી, પ્રતિક જાધવ, ૩૨, ડેટિંગ એપ દ્વારા તેની સાથે જોડાયો હતો અને તેને અંધેરીમાં મથ્યો હતો. બાદમાં તેઓ ગોડફાધર હોટેલમાં ગયા, જ્યાં કથિત રીતે મહિલા અને હોટેલના કર્મચારીઓએ તેની સાથે પાવા-પીવાના રૂ. ૫૫,૦૦૦નું અધક બિલ લઈને છોટરવાનું કાવતરું ઘડ્યું. જાધવે ઘરો કર્યો હતો કે અન્ય એક વ્યક્તિ, અરૂણ કુમાર પણ આ

સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાના કેસની ટ્રાયલમાં વિલંબની નોંધ લીધી અને કે. કવિતાને જામીન આપ્યા

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, માત્ર એટલા માટે કે કોઈ મહિલા અત્યાધુનિક છે અથવા MP કે MLC છે તો શું તે જામીન માટે હકદાર નથી ?, આ કેસની સુનાવણી પૂર્ણ થવામાં લાંબો સમય લેશે, કોર્ટે મનીષ સિસોદિયાને જામીન આપતી વખતે આવું સમાન અવલોકન કર્યું હતું

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૭ સુપ્રીમ કોર્ટે મંગળવારે કથિત દિલ્હી દારૂ નીતિ કોબાંડા સાથે જોડાયેલા ED અને CBI બંને કેસમાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) નેતા કે. કવિતાને જામીન આપ્યા છે. AAP નેતાઓ મનીષ સિસોદિયા અને સંજયકાંઠ પછી આ કેસમાં જામીન મેળવનાર તે ત્રીજા હાઈ-પ્રોફાઇલ નેતા છે. મનીષ સિસોદિયાને જામીન આપતી વખતે આ કેસમાં ટ્રાયલ પૂર્ણ થવામાં લાંબો સમય લાગશે તેની નોંધ લીધી હતી. કવિતા પાંચ મહિનાથી તિરાહ જેલમાં બંધ છે, ED દ્વારા ૧૫ માર્ચે હેદરાબાદમાં ભારે પ્રામા વચ્ચે તેણીની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ સીબીઆઈએ ૧૧ એપ્રિલે તેની ધરપકડ કરી હતી. તપાસ એજન્સીએ ઘરો કબ્જે છે કે, તેલગાણાના પૂર્વ મુખ્યપ્રધાન કેસીઆરની પુત્રી કવિતા, દિલ્હી એક્સપ્રેસ પોલીસીના સંબંધમાં લાંબાની આપ-લે અને નાણાંની લોન્ટ્રિંગમાં સામેલ હતી. કે. કવિતાને જામીન આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કે. કવિતા પાંચ મહિનાથી જેલના સંજોગ પાછળ છે. નક્કરના ભવિષ્યમાં ટ્રાયલ પૂર્ણ થવાની સંભાવના ઓછી છે. વિવિધ ધોષણાઓમાં જણાવ્યા મુજબ અન્ય ટ્રાયલ કસ્ટોડિને સજામાં કેરવાઈ જોઈએ નહીં.



કવિતા પાંચ મહિનાથી તિરાહ જેલમાં બંધ છે, ED દ્વારા ૧૫ માર્ચે હેદરાબાદમાં ભારે પ્રામા વચ્ચે તેણીની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ સીબીઆઈએ ૧૧ એપ્રિલે તેની ધરપકડ કરી હતી. તપાસ એજન્સીએ ઘરો કબ્જે છે કે, તેલગાણાના પૂર્વ મુખ્યપ્રધાન કેસીઆરની પુત્રી કવિતા, દિલ્હી એક્સપ્રેસ પોલીસીના સંબંધમાં લાંબાની આપ-લે અને નાણાંની લોન્ટ્રિંગમાં સામેલ હતી. કે. કવિતાને જામીન આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કે. કવિતા પાંચ મહિનાથી જેલના સંજોગ પાછળ છે. નક્કરના ભવિષ્યમાં ટ્રાયલ પૂર્ણ થવાની સંભાવના ઓછી છે. વિવિધ ધોષણાઓમાં જણાવ્યા મુજબ અન્ય ટ્રાયલ કસ્ટોડિને સજામાં કેરવાઈ જોઈએ નહીં.

એટલા માટે કે મહિલા સુશિક્ષિત અથવા અત્યાધુનિક છે અથવા સંસદસભ્ય અથવા વિધાન પરિષદની સભ્ય છે તે પીએમએલએ એક્ટની કલમ ૪૫ની જોગવાઈનો લાભ મેળવવા માટે હકદાર નથી. ● જો દિલ્હી હાઈકોર્ટના આ આદેશને કાયદો બનાવતી મંજૂરી આપવામાં આવે તો આ વિકૃત અવલોકનોનો અર્થ એ થશે કે કોર્ટ પણ શિક્ષિત મહિલાને જામીન મળી શકશે નહીં. તેનાથી કોર્ટે કહ્યું કે, અદાલતોએ આવી બાબતોનો નિર્ણય કરતી વખતે ન્યાયિક રીતે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ, અદાલત એવું નથી કહેતી કે માત્ર એટલા માટે કે મહિલા સુશિક્ષિત અથવા અત્યાધુનિક છે અથવા સંસદસભ્ય અથવા વિધાન પરિષદની સભ્ય છે માટે તે PMLA એક્ટની કલમ ૪૫ની જોગવાઈનો લાભ મેળવવા માટે હકદાર નથી વિપરિત, અમે કહીએ છીએ કે અદાલતોએ સાંસદ અને સામાન્ય વ્યક્તિ વચ્ચે ભિન્નતા ન હોવી જોઈએ. ● કાર્યવાહી ન્યાયી હોવી જોઈએ. પોતાને દોષિત ઠરાવવાને વ્યક્તિને સાચી બનાવવામાં આવ્યો છે. કાલે તમે વમારી ઈન્છા પ્રમાણે કોઈની ધરપકડ કરશો ? તમે કોઈવિચ આરોપીને તમારી મરજી મુજબ ધરપકડ કરી શકતા નથી.

જન્માષ્ટમી ૨૦૨૪ : પંજાબમાં મુસ્લિમ પરિવારે બાળકને ભગવાન કૃષ્ણના પોશાક પહેરાવ્યા, હૃદયસ્પર્શી વીડિયો વાયરલ

(એજન્સી) તા. ૨૭
એક ભૂરખો પહેરેલી મહિલા તેના છોકરા સાથે તેના ઘરની બહાર પગ મૂકતી જોવા મળી હતી. જે ભગવાન કૃષ્ણની શૈલીમાં હતો. કૃષ્ણ જન્માષ્ટમીના અવસરે મુસ્લિમ પરિવારની ઉજવણીમાં ભાગ લેવાની રીતે ઈન્ટરનેટ વપરાશકર્તાઓના દિલ જીતી લીધા. પંજાબ, ભારતના એક મુસ્લિમ પરિવારને દર્શાવતો એક વીડિયો જેણે પોતાના બાળકને હિન્દુ ભગવાન ભગવાન કૃષ્ણનો વેશ પહેરાવ્યો હતો તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દેશમાં સુમેળ અને વિવિધતાના વખાણ કરતા ફેજ વ્યાપકપણે ઓનલાઈન પ્રસારિત થઈ રહ્યા છે. તે દર્શાવે છે કે કેવી રીતે મુસ્લિમ માતા-પિતાએ તેમના બાળકને એક સ્કૂલ ફેન્સી ડ્રેસ શો માટે કથિત રીતે હિન્દુ દેવતા જેવું બનાવવા માટે તૈયાર કર્યું. એક ભૂરખો પહેરેલી મહિલા તેના છોકરા સાથે તેના ઘરની બહાર પગ મૂકતી જોવા મળી હતી, જે ભગવાન કૃષ્ણની શૈલીમાં હતો. કૃષ્ણ જન્માષ્ટમીના અવસર પર મુસ્લિમ પરિવાર પોતાના બાળકને હિન્દુ ભગવાનનો વેશ ધારણ કરતો જોવા મળ્યો હતો. મહિલા બહાર નીકળી ત્યારે તે તેના પતિના ૨ વ્હીલર પર બેસી ગઈ હતી. મુસલમાન પહેરે તેવી ટોપી પહેરેલા માણસે તેની પત્ની અને તેના બાળકને શાળાએ લઈ ગયા કારણ કે નાના બાળકે ભગવાન કૃષ્ણ જેવા પોશાક અને એસેસરીઝ પહેરી હતી. નેટીઝ્સ દ્વારા પ્રશંસા : આ વીડિયો ૨૬ ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તે પડ મિલિયનથી વધુ વ્યૂઝ અને ૬૦ લાખ લાઈક્સ સાથે વાયરલ થઈ ચુક્યો છે. "આ આપણું ભારત છે" વીડિયોમાં મુસ્લિમ પરિવારે મોહક હાવભાવ સાથે હિન્દુઓના ઉજવણી અને સાંસ્કૃતિક ઉત્સવોમાં કેવી રીતે ભાગ લીધો તેના પર પ્રતિબિંબિત કરતી વખતે જણાવ્યું હતું.



પંજાબ લોકલ નામના ઈન્સ્ટાગ્રામ પેજ દ્વારા અપલોડ કર્યા પછી, વીડિયો ઓનલાઈન સપાટી પર આવ્યો, તેણે વિવિધ ધર્મો અને સાંસ્કૃતિક ઘટનાઓમાં સંવાદિતા અને આદરના સંદેશ માટે પ્રશંસા મેળવી. કૃષ્ણ જન્માષ્ટમીના અવસર પર, નેટીઝ્સે આ વીડિયો પર પ્રતિક્રિયા આપી અને તેને "દિવસનો શ્રેષ્ઠ વીડિયો" ગણાવ્યો. "પરિપક્વતા એ છે જ્યારે તમે સમજો છો કે તે રાજકારણ છે જે વ્યક્તિઓ વચ્ચે ઝઘડો પેદા કરે છે. તે બિનસંપ્રદાયિકતા છે જે ઈરેકની સ્વતંત્રતાનો આદર કરે છે, ઈરેકના ધર્મ અનુસરવાની સ્વતંત્રતા આપે છે". ઘણા યુઝર્સે વિડિયોને "મીડી" અને "હૃદય સ્પર્શી" ગણાવેને ટિપ્પણી કરી. સંવાદિતાના સમાન ઉદાહરણ : એ જ રીતે, ન્યૂઝ એજન્સી IANS દ્વારા શેર કરાયેલ ફોટામાં, રાજસ્થાનના જયપુરની મુસ્લિમ મહિલાઓ ભગવાન કૃષ્ણના વેશમાં તેમના બાળકો સાથે ઊભી જોવા મળી હતી. અગાઉ, ૨૦૧૯માં ભગવાન કૃષ્ણ અને રાધાના નામના પોશાક પહેરીને તેના ત્રણ બાળકો સાથે ફરતી મુસ્લિમ મહિલાઓ ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો. તેમાં એક મહિલાને પટિયાલા, પંજાબની એક શાળામાં બે છોકરીઓ અને એક છોકરા સાથે અનુક્રમે ભગવાન કૃષ્ણ અને રાધાના નામના પોશાકમાં જતી દર્શાવવામાં આવી હતી.

'મિયા મુસ્લિમોને હું આસામનો કબજો લેવા દઈશ નહીં', ૧૪ વર્ષની સગીરા પર ગેંગરેપના પગલે સીએમ હિમંતા સરમાની સાફ-સાફ ચેતવણી

(એજન્સી) તા. ૨૭
ગુવાહાટી તારીખ ૨૬ આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ એવા વિધાનો કર્યા હતા કે જે વસ્તી વધારાને ધ્યાનમાં લેવામાં આવે તો ગુનાખોરીનો દર વધે નહીં. નાગાંવ વિસ્તારમાં ૧૪ વર્ષની એક બાળા પર બળાત્મક ઘટનાને પગલે વિરોધ પક્ષોએ કાયદો અને વ્યવસ્થાના પરિસ્થિતિ પર ચર્ચા કરવા રજૂ કરેલા મોકૂફી પ્રસ્તાવનો જવાબ આપતા મુખ્યમંત્રી સરમાએ એવું પણ ઈરાન કર્યું હતું કે હું કોઈનો પણ લેવાનો નથી અને મિયા મુસ્લિમોને આસામનો કબજો લેવા દઈશ નહીં. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે જે વસ્તીના દરનો વધારો ધ્યાનમાં લેવામાં આવે તો ગુનાખોરીનો દર વધ્યો નથી. પક્ષપાતી હોવાનો વિધવાના આક્ષેપનો જવાબ આપતા સરમાએ ખુલ્લેઆમ કહ્યું હતું કે હું પક્ષ લઈશ તમે શું કરી શકશો? નીચલા આસામના લોકોને અપર આસામ શું કામ જવું પડે, મિયા મુસ્લિમોને આસામ પર કબજો જમાવવા દઈશ નહીં હું એવું કદી નહીં થવા દઉં. ખૂબ જ ગરમાગરમ વાસ્તવિકતા અને મર્ચાં વચ્ચે શાકક અને વિષક બંને તરફના સભ્યો ગુહની મધ્યમાં ઘસી ગયા હતા જેના કારણે દસ મિનિટ સુધી સ્પીકર વિશ્વજીત દ્વારા દસ મિનિટ સુધી ગુહની મોકૂફી જાહેર કરવી પડી હતી.



રાજ્યમાં મહિલાઓ સામેના વધતા જતા અપરાધો સહિત ગુનાખોરીમાં ઉછાળો આવ્યો છે માટે કોંગ્રેસ, એઆઈયુડીએક અને માર્કસ્વાદી પાર્ટી દ્વારા તથા એક માત્ર અપક્ષ સભ્ય દ્વારા ચાર મોકૂફી પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા હતા. દરમિયાન ગુવાહાટી ખાતે વિવિધ સ્થળે અને વિધાનસભા સંકુલમાં પણ વિરોધ પક્ષોએ ઉગ્ર દેખાવો કર્યા હતા અને એવા આક્ષેપ કર્યા હતા કે મહિલાઓને રક્ષણ આપવામાં અને ગુનાખોરી રોકવામાં રાજ્ય સરકાર કૃત્ય હતું પણ પોલીસે એમને રોક્યા હતા. દરમિયાન નાગાંવ વિસ્તારમાં બે અપરાધીઓ જે ભાગી ગયા છે તેમની ધરપકડ કરવાની માંગણી સાથે મહિલાઓ હતી બેનરો ફરકાવ્યા હતા અને સુઓચાર કર્યા હતા અને મહિલાઓની સુરક્ષાની માંગણી કરી હતી ઉપરાંત મહિલાઓ સામેની ગુનાખોરી બદલ કોઈ ચોક્કસ

ચંપઈ સોરેન શુક્રવારે ભાજપમાં જોડાશે સીએમ હિમંતા બિસ્વા સરમાની જાહેરાત

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપઈ સોરેન શુક્રવારે ભાજપમાં જોડાઈ રહેવાનું આસામના મુખ્યમંત્રી અને ઝરખંડ વિધાનસભા ચૂંટણી માટે પક્ષના ઈન્ચાર્જ હેમંત બિસ્વા સરમાએ આજે જાહેર કર્યું હતું. સોરેન નવી દિલ્હીમાં કેન્દ્રના ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા. એ પછી આસામના સીએમ સરમાએ ટવીટ પર જાહેર કર્યું હતું કે, દેશના નામાંકિત આદિવાસી નેતા ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. સોરેન ૩૦ ઓગસ્ટે રાંચી ખાતે વિધિવત ભાજપમાં જોડાઈ જશે. છેલ્લા કેટલાક સમયથી સોરેન અંગે ચાલી રહેલી અટકળોનો આ રીતે અંત આવ્યો છે. કેમ કે જે એમએમના કાર્યકારી પ્રમુખ હેમંત સોરેન જામીન પર છૂટયા બાદ મુખ્યમંત્રી પદેથી ચંપઈ સોરેનને અશોભનિય રીતે દૂર કરી દેવાયા બાદ આદિવાસી નેતા ઝારખંડ મોરચાને છોડી દેવાની ચર્ચા ચાલી હતી. ખુદ ચંપઈ સોરેને એવી ભાવનાત્મક પોસ્ટ લખી હતી કે, મારું પક્ષમાં ખરાબ રીતે અપમાન થયું છે



એટલે વિકલ્પ શોધવાની મને ફરજ પડી છે. આ પોસ્ટ પછી લગભગ નક્કી હતું કે, તેઓ ભાજપમાં જોડાઈ જશે. કોલ્હાનના ટાઈગર કહેવાતા આદિવાસી નેતા આવનારી વિધાનસભા ચૂંટણીમાં જેએમએમને કેટલું નુકસાન કરશે અને કેટલા મત તોડશે એ જોવાનું રહેશે.

નોઈડાનો છોકરો જેની માતા રસોઈયા તરીકે કામ કરતી હતી, તેણે અખિલ ભારતીય ક્રમાંક ૩૦૧૪ સાથે IIT JEE પાસ કરી

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
જ્યારે તમે કોઈ બાબતમાં ઘણો પ્રયાસ કરો છો અને ક્યારેય હાર માનો છો, ત્યારે તમે આંતરિક શક્તિનો વિકાસ કરો છો જે તમને સૌથી મુશ્કેલ અવરોધોને દૂર કરવામાં અને અંતે સફળ થવા માટે સક્ષમ બનાવે છે. આજની વાતની વિષય આ જીદી અને આત્મવિશ્વાસ ધરાવનાર વ્યક્તિઓમાંથી એક છે જેણે મુશ્કેલ નાણાકીય સંજોગોને દૂર કર્યા. પ્રતિબદ્ધતા અને ઉત્સાહનું ઉદાહરણ આપનાર આશિષ કુમાર JEE એડવાન્સ ૨૦૨૪માં સફળ થયો. નોઈડા ઉત્તર પ્રદેશના રહેવાસી આશિષ કુમારે IIT ધનબાદમાં પ્રવેશ મેળવ્યો હતો. અભ્યાસમાં ઘણો સમય લગાવ્યા પછી તેણે JEE એડવાન્સ પરીક્ષામાં અખિલ ભારતીય ક્રમાંક ૩૦૧૪ મેળવ્યો. આશિષને હવે IIT ધનબાદમાં પ્રવેશ મળ્યો છે, જ્યાં તે તેની કોમ્પ્યુટર સાયન્સની ડિગ્રી પૂરી કરશે. પરંતુ

કે, તેની માતા લોકોના ઘરે ભોજન બનાવતી હતી, જેના કારણે તે અને તેના ભાઈઓ તેમનું શિક્ષણ મેળવી શક્યા અને તેમની આકાંક્ષાઓ પૂરી કરી શક્યા. આ આધાર વિના તેઓ અભ્યાસ કરી શક્યા ન હોત. આશિષની માતાએ તેના પુત્રોના તમામ શૈક્ષણિક ખર્ચાઓ ઉઠાવ્યા. પરંતુ આશિષે એ પણ સુનિશ્ચિત કર્યું કે તેની માતાના પ્રયત્નો વ્યર્થ ન જાય. આશિષે તમામ અવરોધોને પાર કર્યા અને છતાં કે તેનો પરિવાર શ્રીમંત ન હતો, તેના સ્વપ્ને સાકાર કરવામાં કોઈ કસર છોડી ન હતી, તમામ પડકારો હોવા છતાં આશિષની યાત્રા નિ:સંકપ્તે મક્કમતા, અતૂટ બહાદુરી અને વ્યક્તિના સપનામાં અડગ વિશ્વાસની વાત છે. આશિષના મતે વિદ્યાર્થીઓ જે ખૂબ મહેનત કરે અને પોતાનામાં આત્મવિશ્વાસ રાખે તો JEE એડવાન્સમાં સરળતાથી સફળતા હાંસલ કરી શકે છે.



આશિષની અહીં પહોંચવાની સફર સાવ સરળ હતી. આશિષ ચાર ભાઈઓમાં સૌથી નાનો છે અને તેની માતાએ રસોઈયા તરીકે કામ કરીને તેના પરિવારનો ધનબાદમાં પ્રવેશ મળ્યો છે, જ્યાં તે તેની મીડિયા ઈન્ટરવ્યુમાં આશિષે ખુલાસો કર્યો

માયાવતીએ ૧૯૯૫ની કુખ્યાત ગેસ્ટ હાઉસની ઘટનાને યાદ કરતા કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર હુમલો કર્યો અને ભાજપની પ્રશંસા કરી

(એજન્સી) તા. ૨૭
BSPના સુપ્રીમો માયાવતીએ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા ૧૯૯૫ની કુખ્યાત ગેસ્ટ હાઉસની ઘટનાને યાદ કરી હતી. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાને કહ્યું કે ૧૯૯૫માં જ્યારે સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ તેમના પર "ઘાતક હુમલો" કર્યો ત્યારે કેન્દ્રમાં સત્તામાં હોવા છતાં, કોંગ્રેસ તેમની મદદ માટે આવી ન હતી. સપાને ૨ જૂન, ૧૯૯૫ના રોજ મારા પર જીવલેણ હુમલો કર્યો હતો, જ્યારે બસપાએ તેનું સમર્થન પણ ખેંચ્યું હતું, તો પછી કોંગ્રેસ આના પર કેમ બોલતી નથી? તે સમય દરમિયાન કેન્દ્રની કોંગ્રેસ સરકારે પણ સમયસર તેની જવાબદારી નિભાવી ન હતી. માયાવતીએ કહ્યું કે, જ્યારે કાંશીરામજી ગંભીર હાલતમાં હતા અને હોસ્પિટલમાં દાખલ હતા, ત્યારે પણ ગૃહમંત્રીને ટપકો આપવો પડ્યો હતો અને વિપલે સંસદનો ઘેરાવ કર્યો હતો, તે પછી જ કોંગ્રેસ સરકારે પગલાં લીધાં હતા. તે સમયે કેન્દ્રની કોંગ્રેસ સરકારના ઈરાદાઓ પ્રકાશ હતા, જે કોઈ અગ્રિય ઘટના બાદ ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાદીને પડતા પાછળથી પોતાની સરકાર ચલાવવા માંગતી હતી. જેનું કાવતરું બસપા દ્વારા નિષ્ફળ કરવામાં આવ્યું હતું.



બસપાના વડાએ સપામાં ગુનેગાર તત્વોથી બચાવવા બદલ ભાજપની પ્રશંસા કરતા કહ્યું કે, ભાજપ સહિત સમગ્ર વિપલે માનવતાના નામે મને એસપીના ગુનાહિત તત્વોથી બચાવવાની પોતાની ફરજ નિભાવી હતી. પરંતુ કોંગ્રેસને સમયાંતરે આની તકલીફ શા માટે થતી રહે છે? જો કે, માયાવતીએ સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો અને ૧૯૯૫માં ભાજપ સાથે હાથ મિલાવ્યા. તેમના નિર્ણયથી ગુસ્સે થયેલા, ૨ જૂન, ૧૯૯૫ના રોજ લખનૌના ગેસ્ટ હાઉસમાં માયાવતી અને પંચાયતને તેમના પક્ષના કાર્યકરો સાથે બેઠક કરી રહી હતી ત્યારે સપાના કેટલાક કાર્યકરોએ હુમલો કર્યો હતો. માયાવતી સાથે કથિત રીતે ડુબલ હાર અને મારપીટ કરવામાં આવી હતી.

નાબન્ના કૃષ્ય પહેલાં RSS વિદ્યાર્થીઓની કહેવાતી 'બિન-રાજકીય' રેલી અંગે મીડિયાના પ્રશ્નોમાં સત્ય બહાર આવ્યું

નાદિયાના રહેવાસી હલ્દરે જણાવ્યું હતું કે, તે કલ્યાણી યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે તેની સાથે તેના મિત્રો સયાન લહેરી અને પ્રબીર દાસ તેમજ અન્ય ચાર લોકો હતા



(એજન્સી) તા. ૨૭
મમતા બેનરજીના રાજીનામાની માંગણી કરવા માટે મંગળવારની નબન્ના કૃષ્યનું આહવાન કરનાર ત્રણ "ફેસબુક મિત્રો"માંથી એક હલ્દરે છે અને તેણે સોમવારે સાંજે કોલકાતા પ્રેસ ક્લબ ખાતે મીડિયાને સંબોધન કર્યું હતું. નાદિયાના રહેવાસી હલ્દરે કહ્યું કે તે કલ્યાણી યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે, તેની સાથે મિત્રો સયાન લહેરી અને પ્રબીર દાસ તેમજ અન્ય ચાર લોકો પણ હતા. તેઓ પુનરાગતન કરતા રહ્યા છે તે બિનરાજકીય ચળવળ છે. દાસે કહ્યું કે, : નહીં બધા પુખ્ત વયના છે અને તેમની પોતાની રાજકીય પસંદગીઓ છે. જો કે, એ અહીં એક ઇચ્છા છે જેણે જ્યાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી માટે ન્યાય માંગી રહ્યા છે. આ વિદ્યાર્થીઓનું આંદોલન છે અને તે બિન-રાજકીય છે. લહેરીને માંડિયાના એવા અહેવાલો અંગે પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો કે તેઓ ભાજપ સાથે ભૂતકાળમાં જોડાયેલા હતા. તેણે કહ્યું કે, હું મારા કોલેજના દિવસોમાં TMCP માટે કામ કરતો હતો. બાદમાં હું ભાજપમાં જોડાવો હતો પરંતુ મેં તેમની સાથેના તમામ સંબંધો ખતમ કરી લીધાં હતા. ભાજપના સુત્રોએ જણાવ્યું હતું કે, પાર્ટી રેલી માટે પૂર્વ મિત્રના પુત્ર, ઉત્તર ૨૪-પરગણા, હાલવા અને હુગલી જેવા જિલ્લાઓમાંથી લોકોને લાવવાનો પ્રયાસ કરી રહી છે. ઉત્તર ૨૪-પરગણાના એક બીજીપી નેતાએ કહ્યું કે, અમારા નેતાઓ તરફથી ચોક્કસ સુચનાઓ આવી છે કે અમારે સંદેશપાલી અને હિંગલગંજ જેવા

તેઓ તેમના દાવાને સ્થપિત કરવામાં નિષ્ફળ ગયા કે તેમની ચળવળ રાજકીય નથી. તુલુમુલના પ્રવક્તા કુશલ ઘોષે કહ્યું કે, અમે દાવો કરી રહ્યા છીએ કે આ કૃષ્યની જાહેરાત થઈ ત્યારથી જ ભાજપ તેની સાથે છે. આજે ખુલાસો થયો કે ભાજપ બંગાળના લોકોને ભમિત કરી રહ્યું છે. તે માત્ર ભાજપનો કાર્યક્રમ જ નથી, તેના એક આયોજક હલ્દરે પર એક મહિલાના ગૌરવનો અપમાન કરવાનો પણ आरोप છે. આ आरोप પરના પ્રશ્નોના જવાબમાં હલ્દરે કહ્યું કે, : શું મારી વિરૂદ્ધ IPC (બળાત્કાર)ની કલમ ૩૦૭નો કોઈ आरोप છે ? હું મમતા બેનરજી સિવાય કોંગ્રેસ પહેલાથી જ કહી ચુક્યા છે કે તેઓ રાજ્ય સચિવાલય તરફ કૃષ્યને સમર્થન આપતા નથી. રાજ્ય સચિવ મિનાક્ષી મુખરજીએ કહ્યું કે, આ કૃષ્ય ન્યાયની માંગની આડમાં એક ધડયંત્ર છે. હું ગુબેરી સમર્થકો અને કાર્યકરોને વિનંતી કરું છું કે તેઓ ભાજપ અને આરએસએસની જાળમાં ન ફસાય. એક સૂત્રએ જણાવ્યું હતું કે, ભાજપના રાજકારણીઓના એક વર્ગ દ્વારા આ કૃષ્યને સમર્થન આપ્યું છે અને એવું માનવામાં આવે છે કે વિપક્ષના નેતા, સુવેન્દુઅધિકારી દ્વારા પડદા પાછળથી આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ રાજકીય નેતાઓને કાર્યક્રમમાં ન જોડાવે વિનંતી કરી હતી. અધિકારીએ શરૂઆતથી જ આ કાર્યક્રમને ટેકો આપ્યો હતો, જ્યારે અન્ય લોકોએ જેમ કે રાજ્ય બીજીપી પ્રમુખ સુકાંત મજુમદાર હવે કેન્દ્રીય નેતૃત્વના પ્રોસ્ટાઇન હેઠળ આ કૃષ્ય છે. મીડિયાએ વિદ્યાર્થી નેતાઓને પ્રશ્નો કર્યા હતા અને તેમના જવાબોમાં

જો આક્ષેપો સાચા પુરવાર થાય તો ટેલિગ્રામ પર ભારતમાં પ્રતિબંધ મૂકાઈ જવાની શક્યતા

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
મેસેજ માટેની ખૂબ જ લોકપ્રિય એપ ટેલિગ્રામ મેસેજિંગ એપ સામે જુગાર અને ખંડોળીને વેગ આપવા સહિતની અપરાધી પ્રવૃત્તિઓ માટે સુવિધા કરી દેવાના आरोपોનો સામનો કરી રહેલી અને ભારત સરકારની જે નોટ ભરી નજર જેના પર છે એવી telegram પર આક્ષેપો પુરવાર થાય તો ભારતમાં પ્રતિબંધ મુકવામાં આવે તેવી શક્યતા છે કેમકે ભારત સરકારે પણ આ પ્લેટફોર્મની પ્રવૃત્તિઓ પર તપાસ શરૂ કરી દીધી છે એટલે જો તેના તારક્ષોના આધારે પ્રતિબંધ મુકાઈ શકે છે. ટેલિગ્રામ એપ માં ખંડોળી વસૂલી તેમજ જુગારની પ્રવૃત્તિઓને વેગ આપવાના आरोपસર અને અપરાધી પ્રવૃત્તિઓમાં તેની સામેલગીરી તથા આવી પ્રવૃત્તિને સુગમ કરી આપવાના તેની સામેના આક્ષેપો બદલ ભારત સરકારે તપાસ શરૂ કરી છે. તેમ એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું.



ફાન્સમાં ટેલિગ્રામના સીઈઓ પાવેલ ટૂરની ધરપકડ થયાના બીજા દિવસે ભારતમાં તપાસના અહેવાલ આવ્યા છે. ફાન્સમાં પ્રારંભિક તપાસમાં જાહેર થયું છે કે છેતરપિંડી, નશીલા પદાર્થોની હેરફેર, સાયબર હાક ધમકી તેમજ સંગઠિત ગુનાખોરીના आरोપસર અને અપરાધી आरोપોસર ટેલિગ્રામના સીઈઓ સામે ફાન્સમાં તપાસ શરૂ કરી છે. આવી પ્રવૃત્તિ અટકાવવામાં એપની નિષ્ફળતા અને તેની ઉદાર નીતિઓ અંગે ફાન્સના સત્તાવાળાઓએ ચિંતા વ્યક્ત કરી છે.

૧૬ વર્ષની વયે લગ્ન કરનાર સવિતા પ્રધાનને ઘરેલું હિંસાનો સામનો કરવો પડ્યો, પરંતુ IAS ઓફિસર બનવા માટે UPSC પરીક્ષા પાસ કરી

(એજન્સી) તા. ૨૭
આદિવાસી પરિવાર સાથે સંબંધ ધરાવતી સવિતા પ્રધાનને બાળપણથી જ આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો. આ મુશ્કેલીઓ હોવા છતાં, શિષ્યવૃત્તિને કારણે તેણી ૧૦મું પોરણ પૂર્ણ કરી શકી, આ સિદ્ધિ હાંસલ કરનાર તેણી તેના ગામની પ્રથમ છોકરી બની. જો કે, એક શ્રીમંત પરિવારમાં ગોઠવાયેલા લગ્નથી તેણીના શૈક્ષણિક સપનાઓ અચાંક તૂટી ગયા હતા. સવિતાના પતિએ તેના બે બાળકોના જન્મ પછી પણ તેના જીવનને ભય અને વેદનાથી ભરી દેતા તેનું શારીરિક શોષણ કર્યું અને ધમકી આપી. એક દિવસ સવિતા, નિરાશાની અને ઊભી હતી, તેણે પોતાનો જીવ લેવાનું વિચાર્યું. પરંતુ તેણીના બે માસુમ બાળકોને જોઈને તેણીને હિંમત મળી અને તેણી માત્ર ૩૨, ૨૦૦૦ રૂપિયા તેના અપમાનજનક લગ્નમાંથી ભાગી ગઈ. તેણીએ સફળતા હાંસલ કરી શકે છે.



ખોલ્યું અને તેનું શિક્ષણ ચાલુ રાખ્યું. તેમણે ભોખાલની બરકતુલ્લા યુનિવર્સિટીમાંથી પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં બીએ કર્યું. આ પડકારો છતાં, સવિતાએ પોતાનું જીવન બદલવાનો પોતાનો સંકલ્પ ક્યારેય છોડ્યો નહીં. તેમનો અથાક

નિશ્ચય તેમને સિવિલ સર્વિસમાં લઈ ગયો. ૨૪ વર્ષની ઉંમરે, તેમણે તેમના પ્રથમ પ્રયાસમાં રાજ્ય નાગરિક સેવાઓની પરીક્ષા પાસ કરી અને મુખ્ય મ્યુનિસિપલ અધિકારી તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી. તેમની યાત્રા અહીં પૂરી ન થઈ તેમના સમર્પણ અને સખત પરિશ્રમના કારણે તેઓ IAS અધિકારી બન્યા. આજ, તે ગ્વાલિયર અને ચંબલ પ્રદેશ માટે મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશનના સંયુક્ત નિયામક તરીકે સેવા આપે છે. સવિતા પ્રધાનની વિતામ આશા અને નિશ્ચયનું કિરણ છે. ત્યારથી તેણીએ પુનઃલગ્ન કર્યાં છે અને તેણીનો નિશ્ચય આજે પણ ઘણા લોકોને પ્રેરણા આપે છે. તેણી તેની યુટ્યુબ ચેનલ 'હિમંત વાલી લડકીયો' દ્વારા તેણીની મુશ્કેલી અને આંતરદૃષ્ટિ શેર કરે છે. જે અન્ય લોકોને હિંમત અને નિશ્ચય સાથે તેમના સંઘર્ષમાંથી બહાર આવવા પ્રોત્સાહિત કરે છે.

ઈઝરાયેલના બેન ગવિર કહે છે કે તેઓ અલ-અક્સા મસ્જિદ પરિસરમાં એક યહૂદી દેવળ બનાવવા માંગે છે !!

(એજન્સી) તા. ૨૭
ઈઝરાયેલના દક્ષિણપંથી રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ટામર બેન ગવિરે જણાવ્યું છે કે જો તેમની પાસે રસ્તો હશે તો તેઓ પૂર્વ જેરુસલેમમાં અલ-અક્સા મસ્જિદ સંકુલમાં સિનાગોગ બનાવશે. લાંબા સમયથી ચાલતા આંતરરાષ્ટ્રીય કારર હેઠળ યહૂદીઓને સ્થળ પર પ્રાર્થના કરવાની મંજૂરી નથી. બેન ગવિરે સોમવારે સવારે ઈઝરાયેલના આર્મી રેડિયોને જણાવ્યું કે, 'જો હું જે ઈચ્છું તે કરી શકું, તો તેમને માઉન્ટ પર એક સિનાગોગ પણ સ્થાપિત કરવામાં આવશે.' યહૂદી પરંપરા અલ-અક્સા સ્થળને ટેમ્પલ માઉન્ટ તરીકે દર્શાવે છે. 'જો હું કહું કે મુસલમાનોને નમાજ પઢવાની છૂટ નથી, તો તમે મને મારી નાખશો.' બેન ગવિરે જણાવ્યું કે તે જેરુસલેમના જૂના શહેરમાં મુખ્ય યહૂદી સ્થળ, પશ્ચિમી દિવાલ પર જાનમાલુ લાવવાથી મુસ્લિમને રોકશે નહીં. બેન ગવિરે જણાવ્યું કે, 'બિલકુલ નહીં. દરેક જણ કહેશે કે તે જાતિવાદ છે, પરંતુ મુસ્લિમો પશ્ચિમી દિવાલની પવિત્રતાને ઓળખતા નથી.' વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું કે અલ-અક્સામાં યથાસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. અલ-અક્સા મસ્જિદને એક ઈસ્લામિક સ્થળ



છે જ્યાં દાયકાઓ જૂના આંતરરાષ્ટ્રીય કારારો હેઠળ બિન-મુસ્લિમો દ્વારા બિનઆમંત્રિત મુલાકાતો, પ્રાર્થનાઓ અને ધાર્મિક વિધિઓ પર પ્રતિબંધ છે. ઈઝરાયેલી સમૂહ લાંબા સમયથી આ સ્થળ પર દરોડા પાડવા અને પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ કરવા માટે સત્તાવાળાઓ સાથે સંકલન કરીને આ નાજુક વ્યવસ્થાને ઉલ્લંઘન કર્યું છે. બેન ગવિર અને

જેરુસલેમની અલ-અક્સા મસ્જિદ પર બેન-ગવિરના વારંવારના હુમલાઓથી ઈઝરાયેલી અધિકારીઓ ચિંતિત

(એજન્સી) તા. ૨૭
ઈઝરાયેલી સરકારના અધિકારીઓ અને વિરોધ પક્ષના નેતાઓ સોમવારે પૂર્વ જેરુસલેમમાં અલ-અક્સા મસ્જિદની અંદર સિનાગોગ બનાવવા દેવા દરખાસ્તો રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ટામર બેન-ગવિર દ્વારા કરાયેલા કોલથી અસંતુષ્ટ છે. ઉઝાવદી મંત્રીએ ઠાવ્યું કે યહૂદીઓને અલ-અક્સા મસ્જિદમાં પ્રાર્થના કરવાનો અધિકાર છે અને કહ્યું કે તે વિવાદિત સ્થળ પર સિનાગોગ બનાવશે. જ્યુડિશ પાવર પાર્ટીના નેતા બેન-ગવિરે ઈઝરાયેલના આર્મી રેડિયોને જણાવ્યું, 'નીતિ ટેમ્પલ માઉન્ટ (અલ-અક્સા મસ્જિદ) પર પ્રાર્થનાની મંજૂરી આપે છે. ત્યાં યહૂદીઓ અને મુસ્લિમો માટે સમાન કાયદો છે. હું ત્યાં સિનાગોગ બનાવીશ.' અલ-અક્સા મસ્જિદની અંદર સિનાગોગ બનાવવા વિશે ઈઝરાયેલના મંત્રીએ ખુલ્લેઆમ વાત કરી હોય તેવું આ પ્રથમ વખત હતું. જો કે, તેણે તાજેતરના મહિનાઓમાં વારંવાર આ સ્થળ પર યહૂદી પ્રાર્થનાને મંજૂરી આપવાની માંગ કરી છે. તેનો કોલ ગેરકાયદેસર ઈઝરાયેલી વસાહતીઓ દ્વારા કમ્પાઉન્ડમાં વારંવાર યુક્ષ્ણપત્રી વચ્ચે આવે છે, જે ઈઝરાયેલની પોલીસની સંપૂર્ણ દેખરેખ હેઠળ છે, જે ઈઝરાયેલના સંરક્ષા મંત્રી ઓઆવ ગોલ્ડનના આદેશ હેઠળ આવે છે અક્સા મસ્જિદમાં યથાસ્થિતિ બદલવા માટે, અને બેન-



ગવિરના કોલને 'ખતરનાક, બિનજરૂરી અને બેજવાબદારીભર્યું કૃત્ય' તરીકે લેખલ કર્યું. તેમણે એમ પણ કહ્યું કે 'બેન-ગવિરની ક્રિયાઓ ઈઝરાયેલ રાજ્યની રાષ્ટ્રીય સુરક્ષા અને તેની આંતરરાષ્ટ્રીય સ્થિતિને જોખમમાં મૂકે છે. તેમણે જણાવ્યું કે, 'ગઈકાલે હિઝબુલ્લાહના હુમલાને રોકવા માટે IDF (ઈઝરાયેલી સેના) દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીએ ઈઝરાયેલ રાજ્યને મજબૂત બનાવ્યું છે, જ્યારે બેન-ગવિરના નિવેદનોએ અમને નબળા પાડ્યા છે.' ઈઝરાયેલી યુદ્ધ

ઊંઘવામાં ખૂબ ડર લાગે છે : ઈઝરાયેલના બોમ્બમારના કારણે ગાઝામાં પેલેસ્ટીનીઓની ઊંઘ ઊડી ગઈ

(એજન્સી) તા. ૨૭
ઓક્ટોબરમાં યુદ્ધ શરૂ થયું ત્યારથી ગાઝામાં પેલેસ્ટીનીઓને ભારે ઈઝરાયેલી બોમ્બમારો, ગ્રેનૅન સતત ડ્રોન અને વારંવાર દળાણયુક્ત વિસ્થાપનને કારણે ઊંઘ ઊડી ગઈ છે, જે નિષ્ણાતો ચેતવણી આપે છે કે લાંબા ગાળાની આરોગ્ય સમસ્યાઓ થઈ શકે છે. ઘેરાયેલા વિસ્તારમાં રહેતા પેલેસ્ટીનીઓ પોષ્ય ઊંઘ લઈ શકતા નથી, જેના કારણે તેઓ સતત થાકેલા અને નબળાઈ અનુભવે છે. કોના અભાવે પોરોડ અને પોષણની અછત અને ડિટોક્ષીની સહાયની મર્યાદિત પહોંચને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે અને નાગરિકોના આરોગ્ય પર પ્રતિકૂળ અસર થઈ છે. ગાઝા સિટીના ૪૦ વર્ષીય રિક્ક અબ્દુલ જવાદ હાલમાં દક્ષિણ ગાઝા પટ્ટીમાં પાન યુનિસમાં વિસ્થાપિત છે અને કહે છે કે હવાઈ અને જમીની બોમ્બમારોને કારણે તેમને છેલ્લા દસ મહિનાથી પૂરતી ઊંઘ મળી નથી. તેમણે જણાવ્યું કે 'એવો સમય આવે છે જ્યારે મને ઊંઘ આવે છે અને મને સુવાની જરૂર લાગે છે, પરંતુ જ્યારે પણ હું પથારીમાં જાઉં છું અને સુવા લાગ્યું છે, ત્યારે હું મારી જાતને પાન યુનિસના માવાસી વિસ્તારમાં સ્થાપિત તંબુઓમાંથી એકમાં જાઉં છું. નજીકના



વિસ્ફોટોના અવાજથી હું ગભરાઈને જાગી ગયો.' રિક્ક માટે, બોમ્બ વિસ્ફોટને કારણે થયેલા આઘાતને કારણે તેની ઊંઘવાની ક્ષમતામાં પણ દખલ થઈ છે અને તે કલ્પના કરવામાં ચાલુ રાખે છે કે બોમ્બ તેને અને તેના પરિવારના અન્ય આઠ સભ્યોને મારી નાખશે. તેમણે જણાવ્યું કે 'હું રાતને પિકાડું છું, કારણ કે તેનો અર્થ એ છે કે ઈઝરાયેલી સેના વધુ નાગરિકોને મારી નાખશે, આપણામાં જેઓ તંબુઓમાં રહે છે તેઓને પણ પેલેસ્ટિનિયનોની રાહિદ સાથે, લાંબા સમયથી ખલેલ પહોંચેલી ઊંઘ, હૃદય અને કિડનીની બિમારી અને માનસિક બીમારી જેવી વધુ ગંભીર પરિસ્થિતિઓના વધતા જોખમ વિશે ચેતવણીઓ પણ ઊભી કરી છે.

બ્રિટિશ ડોક્ટરોએ વડાપ્રધાનને શસ્ત્રોનું વેચાણ બંધ કરવા અને ગાઝામાં થઈ રહેલી 'અકલ્પનીય કૂરતા'નો અંત લાવવા આહ્વાન કર્યું

(એજન્સી) તા. ૨૭
ત્રીસ બ્રિટિશ તબીબી વ્યાવસાયિકોએ વડા પ્રધાન કીર સ્ટારમરને પત્ર લખીને ગાઝામાં થઈ રહેલી "અકલ્પનીય નિર્દયતા"માં બ્રિટનની ભૂમિકાને સમાપ્ત કરવા અને ઈઝરાયેલને શસ્ત્રોનું વેચાણ બંધ કરવા વિનંતી કરી છે. ડોક્ટરો, નર્સો, સર્જનો અને તબીબી વ્યાવસાયિકોએ ગાઝામાં સ્વયંસેવીના તેમના અનુભવોની રૂપરેખા આપી, અહેવાલ આપ્યો કે તેઓ "અકમાત્ર તટસ્થ નિરીક્ષકોમાંના છે જેમને ૭ ઓક્ટોબરથી ગાઝામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે અને ગાઝામાં પ્રવેશનો ઈન્કાર કરવામાં આવ્યો છે." પત્રકારત્વ અથવા તપાસના પાતાઓને બદલવું પડ્યું છે, "તેમણે જણાવ્યું કે, "ગાઝામાં મનુષ્યની સાચી સંખ્યા જાણવી અશક્ય છે," તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આરોગ્ય મંત્રાલયના ૪૦,૦૦૦ પેલેસ્ટીની મૃત્યુ પામ્યા હોવાને આંકડો માત્ર ઓળખાયેલા મૃતદેહોની સંખ્યા દર્શાવે છે, "પરંતુ ગાઝામાં કામ કરતી વખતે અમે અસંખ્ય અજાણ્યા મૃતદેહો જોયા છે. ઘણા જેમાંથી વાસ્તવમાં ઓળખવામાં આવી ન હતી કારણ કે નુકસાન પૂર્ણ વ્યાપક હતું." અસ્વચ્છ હોસ્પિટલોમાં તબીબી સારવાર આપવામાં આવી રહી છે જેમાં "એન્જિઓપ્લોસ્ટિસ સહિતનાં પૂરકો, પાણી અને દવાઓ"નો અભાવ હતો, તેમણે ઉમેર્યું કે ગાઝાના તમામ તબીબી કેન્દ્રો ગ્રીય હતા. આનો અર્થ એ થયો કે "સર્જિકલ ચેપ લગભગ નિશ્ચિત



કેટલીકવાર અકવારિયા કે મહિનાઓ સુધી. "લગભગ બધાએ શારીરિક અને મનોવૈજ્ઞાનિક દુર્ભવહાર, ત્રાસ અને લૈંગિક દુર્ભવહાર સહિતની દુર્ભવહારનો અનુભવ કર્યો, જેમાં નગ્ન થવું અને અન્ય કૂર અને અમાનવીય સજાઓ તેઓને માત્ર ડોક્ટર હોવાના કારણે સજા કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. "ગાઝામાં તેમને ગુમ કરવું "અઘરું" હતું, પરંતુ "અમે જે ઈજાઓ સારવાર આપી હતી તેમાંથી ઘણી બધી ઈજાઓ બ્રિટનમાંથી સહાય કરાયેલ શસ્ત્ર સિસ્ટમ અને ઘટકોના ઉપયોગને કારણે થઈ શકે છે" તે જાણીને તે વધુ મુશ્કેલ બન્યું. વડા પ્રધાન સ્ટારમર અને વિદેશ સચિવ ડેવિડ લેમી બંનેને સંબોધતા, તેમણે ભારપૂર્ક જણાવ્યું કે "જો તેમ અમારી પાસે જે જોયું, સાંભળ્યું અને અનુભવ્યું હોત, તો ઈઝરાયેલ પર શસ્ત્ર પ્રતિબંધ લાદવાનો કોઈ પ્રશ્ન જ ન હોત." ગાઝા પરના હુમલાઓ માટે યુક્રાઇન સેન્ય સર્વનને સમાપ્ત કરવા ઉપરાંત, તેમણે ગાઝામાં પ્રવેશના માર્ગોને "અવિરોધિત સહાય વિતરણ માટે" માર્ગ પોલવાનું આહ્વાન કર્યું છે, જ્યારે તબીબી અને સર્જિકલ વ્યાવસાયિકોને ગાઝા પટ્ટીમાં અને અપ્રતિબંધિત પ્રવેશ હોવો જોઈએ, રસીકરણ કાર્યક્રમોની ડિલિવરી હોવી જોઈએ સુનિશ્ચિત કરવામાં આવે અને દરરોજ દરેક સુનિશ્ચિત ઓછામાં ઓછું ૨૦ ટિલ્ટર પીલાનું પાણી પૂરું પાડવામાં આવે, એમ તેમણે સ્પષ્ટ કર્યું.

લેબેનોનના આકાશમાં હવામાં ઈંધણ ભરવું : કેવી રીતે ઈઝરાયેલી વાયુ સેનાએ દક્ષિણ લેબેનોન પર હવાઈ હુમલાની શ્રેણી શરૂ કરી

(એજન્સી) તા. ૨૭
ઈઝરાયેલી હવાઈ દળ (IAF)એ રવિવારે વહેલી સવારે દક્ષિણ લેબેનોનમાં શ્રેણીબદ્ધ હવાઈ હુમલાઓ શરૂ કર્યાં હતા, જે હિઝબુલ્લાહ દ્વારા મોટા હુમલાને રોકવા માટે આગોતરી હડતાલ હોવાનું માનવામાં આવતું હતું. તેહરાનમાં હમાસના વડા ઈસ્માઈલ હાનીયાહની હત્યા બાદ ઈરાન અને તેના સાથી દેશો બદલો લેવાની તૈયારી કરી રહ્યા હોવાની આશંકા વચ્ચે ઈઝરાયેલના હુમલા અને વેતવણીઓ આવી છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF)એ ઓપરેશન દર્શાવતો એક વીડિયો જાહેર કર્યો છે. 'લેબેનોનમાં અમારું ઓપરેશન આંતરવાદી ઈન્ફલ્ટ્રેક્ટરને લક્ષ્યાંકિત કરે છે જેનો ઉપયોગ હિઝબુલ્લાહ ઈઝરાયેલના પરિવારો અને ઘરોની સુરક્ષા માટે અમારી વિરૂદ્ધ કરવાની યોજના બનાવી રહ્યો હતો. ૨૫ ઓગસ્ટના રોજ સુરક્ષા કેમ્પનેટની બેઠકની શરૂઆતમાં, વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ જણાવ્યું કે, 'આજે સવારે અમે ઈઝરાયેલ પર હુમલો કરવા માટે હિઝબુલ્લાહની તૈયારીઓને ઓળખી શકી હતી. સંરક્ષણ મંત્રી અને IDF ચીફ ઓફ સ્ટાફ સાથે સહમતિથી, અમે IDF માટેના જોખમને ઓળખી કાઢ્યું હતું' ત્યારથી, IDF ધમકીઓને નિષ્ફળ બનાવવા માટે મજબૂત પગલાં લઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે તેણે ઉત્તર ઈઝરાયેલ પર લક્ષ્યાંકિત હજારો રોકેટોનો નાશ કર્યો છે. ઈઝરાયેલના વડાપ્રધાને લોકોને IDF હોમ ફ્રન્ટ કમાન્ડની સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી. નેતાન્યાહુએ જણાવ્યું કે, 'અમે આપણા દેશની રક્ષા કરવા, ઉત્તરના રહેવાસીઓને તેમના ઘરે સુરક્ષિત રીતે ધાંધા કરવા માટે અને એક સરળ નિયમને જાળવી રાખવા માટે શક્ય તેટલું બધું કરવા માટે કટિબદ્ધ છીએ : જે અમને નુકસાન પહોંચાડે છે-અમે તેને નુકસાન પહોંચાડીશું. 'દરમિયાન, લેબેનોનના હિઝબુલ્લાહ સમુહના નેતા હસન નસરાલ્લાએ



રવિવારે જણાવ્યું કે સમુહ પર ઈઝરાયેલની આગોતરી હડતાલની તેના કાઉન્ટર ઓપરેશન પર કોઈ અસર થઈ નથી. એક ટેલિવિઝન ભાષણમાં, આ ભેત્રમાં ઈઝરાયેલ અને અમેરિકન સૈન્ય એકત્રીકરણને કારણે આંતરક્રાંતી સમુહના પ્રતિ-આક્રમણમાં વિલંબ થયો હતો. નસરાલ્લાએ તેમના સંબોધનમાં જણાવ્યું કે, 'અમે ઈઝરાયેલ અને અમેરિકાની વધતી સંખ્યા વચ્ચે અમારું અભિયાન ચાલુ રાખ્યું છે. પ્રદર્શમાં દળોએ વિલંબ કર્યો, અમે નિષ્ફળતા પર વડી ન થકીએ, અમે સાથે મળીને અથવા અલગ-અલગ રીતે પ્રતિકાર કરવાની પણ ચર્ચા કરી, અમે યુદ્ધવિરામ મંત્રણાઓ માટે પણ પૂરતો સમય આપવા માંગીએ છીએ.' તેમણે વધુમાં જણાવ્યું કે હિઝબુલ્લાહ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ મંત્રણાઓના પરિણામની રાહ જોઈ રહ્યું છે. હિઝબુલ્લાહના નેતાએ જણાવ્યું કે ઈરાન અને તેના પ્રાદેશિક સહયોગીઓ પ્રતિક્રિયા આપશે કે કેમ તે જોવા માટે સમુહને સમયની જરૂર છે.

ઈરાન, સઉદી અરબે દ્વિપક્ષીય સંબંધો, ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી

(એજન્સી) તેહરાન, તા. ૨૭
ઈરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ આરઘચી અને તેમના સઉદી અરબિયાના સમકક્ષ ફેઝલ બિન ફરહાન અલ સઉદિ રવિવારે ફોન પર દ્વિપક્ષીય સંબંધો અને સામાન્ય હિતના ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ઈરાન સંસદમાં વિશ્વાસનો મત જતા બાદ ઈસ્લામિક રિપબ્લિકના વિદેશમંત્રી સમાવેશ મુજબ ઈરાનના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ટેલિકોન વાતચીત દરમિયાન બંને પક્ષોમાં ગાઝામાં ચાલી રહેલા ઈઝરાયેલના 'ગુનાઓ'



અને મધ્ય-પૂર્વ ક્ષેત્રમાં વધી રહેલા તણાવ અને ઈઝરાયેલના 'ગુનાઓ'ની નોંધ લીધી છે. ટેલિકોન વાતચીત દરમિયાન બંને પક્ષોમાં ગાઝામાં ચાલી રહેલા ઈઝરાયેલના 'ગુનાઓ'

તેની પાતરી કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, બંને પક્ષો સંમત થયા છે કે, દ્વિપક્ષીય સંબંધો યોગ્ય દિશામાં છે અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે આહવાન કર્યું છે. તેમણે બંને દેશો વચ્ચે સતત પરમર્શ માટે પણ વિનંતી કરી અને કહ્યું કે, આ પ્રકારની વાતચીત દ્વિપક્ષીય અને પ્રાદેશિક હિતોને અનુરૂપ છે. એપ્રિલ ૨૦૨૩માં ઈરાન અને સઉદી અરબિયાએ વર્ષોના વિખવાદ પછી બેઈજિંગમાં રાજદ્વારી સંબંધો ફરી શરૂ કરવાની જાહેરાત કરી.

અરબેઈન તીર્થયાત્રા પહેલા કરબલામાં ઈરાકી સુરક્ષા દળો અને PMF વચ્ચે અથડામણ

(એજન્સી) તા. ૨૭
ગુરૂવારે પવિત્ર શિયા શહેર કરબલામાં ઈરાકી સૈન્ય એકમો અને પોપ્યુલર મોબિલાઈટીઝેશન ફોર્સિસ ("હશદ અલ-શાબી" તરીકે પણ ઓળખાય છે)ના સભ્યો વચ્ચેની અથડામણ દરમિયાન ઈરાકી સુરક્ષા દળોએ હવામાં ઓગળીબાર કર્યો હતો. અર્બાઈન તીર્થયાત્રા માટે લાખો લોકો એકઠા થયા તેના દિવસો પહેલા અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટર જૂના શહેર કરબલાથી લગભગ પાંચ કિલોમીટર દૂર સવારે થયું હતું. આંતરિક મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે ચાર પીએમએફ વાહનોએ પગપાળા યાત્રાળુઓ માટે નિયુક્ત રસ્તા પર ઈરાકી સૈન્યની નાકાબંધીને બાયપાસ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં પશ્ચિમ ઈરાકના અન્બાર રાજ્યના કિશોર અલી અબ્બાસનું મોત થયું હતું. ન્યૂ અરબે ઈરાકના સુરક્ષા મીડિયા સેલના પ્રમુખ અને ઈરાકી સૈન્યના સંયુક્ત ઓપરેશન કમાન્ડના પ્રવક્તા મેજર જનરલ તાહસીન અલ-ખાફાજ અને ઈરાકી સરકારના પ્રવક્તા બસમ અલ-અવદીનો સંપર્ક કર્યો, પરંતુ

પ્રકાશનના સમય સુધીમાં કોઈએ જવાબ આપ્યો ન હતો. શિયા ઈસ્લામના અગ્રણી વ્યક્તિ અને પયગંબર મોહમ્મદના પૌત્ર મોહમ્મદ હુસેન માટે વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવામાંના એક અરબેન યાત્રાની તૈયારી કરતી વખતે આ ઘટના તણાવને વધારે છે. આ વાર્ષિક પ્રસંગ સમગ્ર વિશ્વમાંથી લાખો યાત્રાળુઓને આકર્ષે છે; ગયા વર્ષે તેમાં ૨.૨ કરોડ તીર્થયાત્રીઓએ ભાગ લીધો હતો, જેમાં

ઘણા પડોશી ઈરાનનો પણ સમાવેશ થાય છે. ૬ ઓગસ્ટથી લગભગ ૨૮ લાખ યાત્રાળુઓ ઈરાકમાં પ્રવેશ્યા છે અને રવિવારે એ સ્મારકની ટોચ હશે. સંબંધિત વિકાસમાં ઈરાકના આંતરિક મંત્રી અબ્દુલ અનીર અલ-શમરીએ મંગળવારે કરબલામાં સંરક્ષણ મંત્રી યાબેત અલ-અબ્બાસી સાથે સંયુક્ત પરિષદ દરમિયાન જાહેરાત કરી હતી કે ઈરાકમાં આગમનની સંખ્યા ૨.૭૫ મિલિયન સુધી પહોંચી ગઈ છે.



ગાઝા પરિવારે ઈઝરાયેલ પર આક્રમણ દરમિયાન ડાઉન સિન્ડ્રોમથી પીડિત પેલેસ્ટીનીની હત્યા કરવાનો આરોપ લગાવ્યો

(એજન્સી) તા. ૨૭
તેમના ભાઈને ઠંકનાવ્યાના એક દિવસ પછી, અલ-અબદાલા ભાઈ-બહેનોએ જ્યાં તેનું મૃત્યુ થયું હતું તે સ્થળથી લગભગ ૨૦૦ મીટર દૂર તેમનો પગ મળ્યો. તેઓ માને છે કે આ હુમલામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે સર્વેક્ષણ કરાયેલા અડધાથી વધુ પેલેસ્ટીની પુખ્ત વયના લોકોની ઊંઘની ગુણવત્તા નબળી હતી.



અસાધારણ હતી, કારણ કે તે તેના રોગથી પીડાતો હતો. જ્યારે તે બાળપણમાં રાઈટ ટ લાઈફ દક્ષિણ ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલના આક્રમણને કારણે થયેલા નુકસાનનું નિરીક્ષણ કરવા કરારમાં જણાવ્યું કે 'અહમદની જ્ઞાનાત્મક ક્ષમતાઓ

જ્યાં તેઓએ યુદ્ધ દરમિયાન વિસ્થાપિત થયા પછી આશ્રય લીધો હતો. તેણે જણાવ્યું કે, 'અમે અલ-કરારહની સ્ટ્રીટ ૨ માં રહેતા હતા, પરંતુ યુદ્ધની શરૂઆતથી અમારે રહેવું પડ્યું હતું. મારા ઘરેથી વિસ્થાપિત. ' ૧૦ ઓક્ટોબરના રોજ દુરુમનાવટ દરમિયાન અલ-અબદાલા પરિવારને તેમનું ઘર છોડવાની ફરજ પડી હતી, ત્યારબાદ નવેમ્બરમાં યુદ્ધવિરામ દરમિયાન પાછા ફર્યા હતા, ત્યારબાદ તેઓ બે વાર વધુ વિસ્થાપિત થયા હતા, આખરે તેઓ કરારહના માવાસી વિસ્તારમાં પહોંચ્યા હતા. ૨ જુલાઈના રોજ, ઈઝરાયેલી દળોએ પાન યુનિસ પર આક્રમણ શરૂ કર્યું, સામૂહિક સ્થળાંતરનો આંદોશ આપવામાં આવ્યા પછી તેમના હુમલાઓને વધુ તીવ્ર બનાવ્યા. આક્રમણનો પ્રારંભિક તબક્કો લગભગ એક અઠવાડિયા સુધી ચાલ્યો હતો, જે ૧૦ જુલાઈના રોજ સમાપ્ત થયો હતો.

ઈઝરાયેલના નવા સ્થળાંતર આદેશોના કારણે ગાઝામાં ૨,૫૦,૦૦૦થી વધુ લોકોને ફરીથી પલાયન કરવું પડ્યું

(એજન્સી) તા. ૨૭
ઈઝરાયેલે રવિવારે મોડી રાત્રે મધ્ય ગાઝાના દેર અલ-બાલાહ માટે નવા સ્થળાંતર આદેશો જારી કર્યા, જેનાથી વધુ પરિવારોને ભાગી જવાની ફરજ પડી. ઈઝરાયેલે જણાવ્યું કે, તેના દળો હમાસ અને આ વિસ્તારમાં કાર્યરત અન્ય લોકો સામે કાર્યવાહી કરવાનો ઈરાદો ધરાવે છે. તાજેતરના દિવસોમાં ઈઝરાયેલે ગાઝામાં બહુવિધ સ્થળાંતર આદેશો જારી કર્યા છે, જે ૧૦-મહિનાના યુદ્ધની શરૂઆત પછીના સૌથી વધુ છે, અગ્રણી પેલેસ્ટીની યુએન અને રાહત વિસ્તારકો દ્વારા રહેવાસીઓને તાત્કાલિક પશ્ચિમ તરફ જવા વિનંતી કરી, કારણ કે તેઓ જે વિસ્તારમાં છે તેને 'ખતરનાક યુદ્ધ ક્ષેત્ર' ગણવામાં આવે છે. સોમવારે ઈઝરાયેલી સૈન્ય હુમલામાં ઓછામાં ઓછા સાત પેલેસ્ટીની મૃત્યુ પામ્યા હતા, એમ તબીબોએ જણાવ્યું હતું. દેર અલ-બાલાહમાં બે લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યાં



નિવેદનમાં ઈઝરાયેલી દળોએ કેટલાક વિસ્તારોના રહેવાસીઓને તાત્કાલિક પશ્ચિમ તરફ જવા વિનંતી કરી, કારણ કે તેઓ જે વિસ્તારમાં છે તેને 'ખતરનાક યુદ્ધ ક્ષેત્ર' ગણવામાં આવે છે. સોમવારે ઈઝરાયેલી સૈન્ય હુમલામાં ઓછામાં ઓછા સાત પેલેસ્ટીની મૃત્યુ પામ્યા હતા, એમ તબીબોએ જણાવ્યું હતું. દેર અલ-બાલાહમાં બે લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યાં

લગભગ એક મિલિયન લોકો આશ્રય લઈ રહ્યા છે, બે નુસરત કેમ્પની એક શાળામાં મૃત્યુ પામ્યા છે અને ઈજિપ્તની સરહદ નજીક દક્ષિણી શહેર રાફાહમાં ત્રણ મૃત્યુ પામ્યા હતા. ડોક્ટરોએ જણાવ્યું કે, બે અલગ-અલગ ઈઝરાયેલી હુમલામાં સાત અન્ય લોકો મૃત્યુ પામ્યા છે, જેમાં પાન યુનિસમાં એક કારમાં પાંચ અને ગાઝા સિટીની એક શાળામાં બેનો સમાવેશ થાય છે. આદેશોએ ઘણા પરિવારો અને દર્દીઓને અલ-અક્સા શહેર હોસ્પિટલ, દેર અલ-બાલાહ અને મુસ્લિમ તબીબી કેન્દ્ર, જ્યાં લાખો રહેવાસીઓ અને વિસ્થાપિત લોકોએ આશ્રય લીધો છે, બોમ્બ વિસ્ફોટના ભયથી છોડી દેવાની ફરજ પડી છે.

તંત્રીલેખ

ગુજરાતભરમાં વરસાદી તબાહી

વર્તમાન ચોમાસાની ઋતુમાં પ્રથમવાર એવું થયું છે કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે, એક પણ જિલ્લો કોરો રહ્યો નથી. આમ તો ચોમાસાની સીઝનનો વરસાદ છેલ્લા કેટલાંકે સમયથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ધમરોળી રહ્યો છે એ પૈકી અમુક જિલ્લાઓમાં તો અતિવૃષ્ટિ જેવી સ્થિતિ છે. પરંતુ અમદાવાદ તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો વરસાદી અછત ભોગવી રહ્યા હતા. તેવામાં છેલ્લા બે દિવસથી મેઘાએ ધમાકેદાર ઈનિંગ ખેલતા સર્વત્ર સારો એવો વરસાદ વરસાવ્યો છે. ૫-૭થી માંડીને ૧૨-૧૪ ઈંચ સુધી વરસાદ રાજ્યના વિવિધ વિસ્તારોમાં નોંધાઈ રહ્યો છે અને આ લખાય છે ત્યારે વત્તા ઓછા પ્રમાણમાં વરસાદ ચાલુ છે. રાજ્યની મોટાભાગની નદીઓમાં પૂર આવ્યાં છે. નર્મદા, ઉકાઈ સહિતના અનેક મોટા ઝેમોના પણ દરવાજા ખોલવા પડ્યા છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોના લાખો લોકોને ઠેર ઠેર સ્થળાંતર કરવું પડ્યું છે. પરંતુ આ નદીઓના પૂર કે ભારે વરસાદે જે તકલીફો તેમજ તબાહી સર્જી છે તેના કરતા વધારે નુકસાન ઘણે ઠેકાણે તંત્રની અણધર નીતિઓ અથવા તો અણઆવડતને કારણે થઈ છે.

રાજ્યમાં ગમે ત્યાં થોડા ઈંચ વરસાદ જો એક યારો પડે તો સર્વત્ર જળબંબાકાર થઈ જાય છે પછી તે મોટું શહેર હોય કે નાનું ગામ હોય. વરસાદી પાણીના નિકાલ માટે કોઈ અસરકારક કે કાયમી વ્યવસ્થા જ સરકારી તંત્ર કરતી નથી. વરસાદ આવે એટલે ગમે તેટલા કરોડોના ખર્ચે બનેલો રસ્તો હોય કે પુલ હોય મોટાભાગે ધોવાઈ જ જાય છે. ખેતીના ઊભા પાક કે ખેતરો તો ઉપરવાળાના ભરોસે જ છોડી દેવાય છે. દર ચોમાસામાં સર્જાતી તકલીફો એક સરખી જ હોવા છતાં વહીવટી તંત્ર એ જ જૂની ઘરેડોમાં માંદલાની જેમ ચાલ્યા કરે છે... વરસાદની આગાહી હોય ત્યારે તંત્ર સમાચાર

માધ્યમો દ્વારા તેની ઘોષણા કરે અને સાવચેતીના પગલાં લઈ રહ્યાની આમભારી યાદીઓ બહાર પાડે પણ જ્યારે ખરેખર ભારે વરસાદ પડે અને પ્રજાને તંત્રની જરૂર હોય ત્યારે તે દેખાય જ નહીં. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ના રૂપકડાં નામે એક અલાયદું તંત્ર બનાવ્યાની સરકાર ઘોષણા કરે પરંતુ આ એનડીઆરએફમાં એ જ સરકારી કર્મચારીઓએ અધિકારીઓ હોય છે જે રાખેતા મુજબના કામો કરતા હોય છે. મામલતદારો, કારકુનો વગેરે આ એનડીઆરએફનો ભાગ હોય છે.

આજે ગુજરાતનું મોટાભાગનું જનજીવન ઠપ છે તેની પાછળનું મુખ્ય પરિબળ ભારે વરસાદ તો છે જ પરંતુ વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ ન હોવાથી સર્વત્ર પાણી ભરાઈ ગયા છે. આ જલભરાવને કારણે સડકો બંધ છે કે ધોવાઈ ગઈ છે. માર્ગ વ્યવહાર ભયંકર રીતે ખોરવાયો છે. રેલવે વ્યવહાર પણ અસ્તવ્યસ્ત છે, અરે એક જ ગામ કે શહેરમાં એક સ્થળેથી બીજે સ્થળે જવું દુષ્કર થઈ ગયું છે. એટલે જ રાજ્યની શાળા-કોલેજો બંધ કરવી પડી છે, પરીક્ષાઓ પણ રદ કરવી પડી છે. પરિવહન જ ઠપ હોવાથી લાખો લોકો નોકરી ધંધે જઈ શક્યા નથી... આ બાબતે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની તકલીફો લગભગ સરખી જ છે. ખેડૂતો કે ખેત મજૂરો ખેતરોમાં જઈ શકતાં નથી. કર્મચારીઓ પછી તે સરકારી હોય કે ખાનગી દરેકને પોતપોતાના નોકરીના સ્થળે પહોંચવામાં ભારે તકલીફ પડી રહી છે અને મોટાભાગના તો પછીની પણ શક્યા નથી... આ બધાની વચ્ચે પાછું જાનમાલનું નુકસાન તો ખરું જ... ગામડાઓમાં ખેતીના પાકને નુકસાન થાય છે તો શહેરો અને નગરોમાં દુકાનો-વ્યાપારી સંકુલો માર્કેટ યાર્ડમાં દરેક પ્રકારની ચીજવસ્તુઓને પાણી ભરાવાથી નુકસાન થયું છે. દૂધ જેવી જીવન જરૂરી ચીજોના પુરવઠામાં પણ તકલીફો પડે છે.

ગુજરાતના ૩૩ જિલ્લાઓ પૈકી સૌથી મોટા શહેરો અમદાવાદ અને સુરતની વાત કરીએ તો એ અન્યો કરતા પ્રમાણમાં સૌથી વિકસીત કહેવાય છે પરંતુ આજે આ શહેરોની

હાલત જુઓ... ભાગ્યે જ કોઈ વિસ્તાર હશે જે પાણી ભરાવાની સમસ્યાથી, માર્ગો તૂટવાની કે ખાડા, ભૂવા પડવાની તકલીફથી બચ્યો હોય હવે જો ચૂંટણી ટાણે પ્રચારિત કરાયેલા સ્માર્ટ સિટી કે મેગા સિટીઓની આવી કફોડી હાલત હોય તો ગ્રામ્ય વિસ્તારોનું તો પૂછવું જ શું... સરકારી હોસ્પિટલો કે કોર્પોરેશનોના દવાખાના પોતે જ પાણી ભરાવાથી કે પાણી ટપકવાથી બીમાર પડી જાય છે ત્યાં દર્દીઓની સારવાર શું કરી શકે? એમાં જે નાગરિકો જીવલેણ આરોગ્ય સમસ્યાનો ભોગ બની એ તો નસીબ હોય તો જ દવાખાને સમયસર પહોંચી શકે બાકી ઠેર ઠેર ઘણી એમ્બ્યુલન્સો માર્ગો પર પાણી ભરાવાની કે રસ્તા જ બંધ હોવાથી અટવાયાના સમાચારો છે. તો ટ્રાફિકજામમાં ફસાયેલી એમ્બ્યુલન્સની તો વાત જ ક્યાં કરવી? વળી તંત્ર દ્વારા રાહત કે બચાવ માટે જે સરકારી નંબરો આપવામાં આવે છે તે મોટાભાગના બંધ હોય છે. વીજળી પણ હોતી નથી ત્યાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકો મોબાઈલ ક્યાંથી ચાર્જ કરે અને બંધો વગર મોબાઈલ ટાવરો પણ ઠાલાં થાંભલા બની જાય છે. હવે તંત્ર યારો કે ગ્રામ્ય લોકોને કોઈ સંદેશો આપે તો તે પહોંચે કઈ રીતે? લાઈટ ન હોવાથી ટીવી ચાલતા નથી, મોબાઈલમાં નેટવર્ક ચાલતા નથી અને સડકો જ ધોવાઈ ગઈ હોય તો અખબારો પણ ઘણે ઠેકાણે પહોંચતા નથી... અર્થાત જે લોકોને સંદેશો આપવાની જરૂર હોય છે તેમના સુધી જ મેસેજ પહોંચતા નથી, કેમ કે તેઓ તો અસરગ્રસ્ત હોય છે અને માર્ગ તેમજ સંદેશ વ્યવહારથી કપાયેલા હોય છે.

જાન-માલના રક્ષણનો પ્રશ્ન તો સૌથી મોટો છે જ પરંતુ આ રાખેતા મુજબના જીવન વ્યવહારને સંભાળવામાં પણ તંત્રની નબળાઈઓ દર વખતે દેખાઈ આવે છે ત્યારે આટલા આધુનિક સમયમાં પણ જો તંત્ર એ જ વરસો જૂના રગશિયા ગાડાની જેમ જ વર્તે તો પછી પ્રજા કરે શું?

ગાંધીપુરથી શ્રીનગર : આરએસએસ પ્રોડક્ટ મનોજ સિંહાનું જીવન

ભાગ-૪

ઉત્તર પ્રદેશના રાજકારણમાં બદલાવ

જાન્યુઆરી ૨૦૨૧માં, જ્યારે મોદીના નજીકના ગણતંત્ર અમલદાર એ. કે. શર્માએ સ્વેચ્છિક નિવૃત્તિ લીધી અને ઉત્તર પ્રદેશના રાજકારણમાં પ્રવેશવા માટે ભાજપમાં જોડાયા, તે “સ્પષ્ટ થઈ ગયું કે સંદેશો મોકલવામાં આવ્યો હતો” કે કેન્દ્રીય નેતૃત્વ હવે સિંહાને ભૂમિકાર નેતાની ભૂમિકા ભજવવા દેવા માંગતું નથી, ભૂતપૂર્વ પત્રકારે જણાવ્યું હતું. સિંહાને રાજ્યની બહાર ખસેડવાથી નેતૃત્વના પ્રશ્ન પર સંભવિત તણાવ પણ ઘટ્યો છે, તે ઉમેરે છે.

શર્મા, મએના ભૂમિકાર, જે ગાંધીપુરથી દૂર છે, આજે આદિત્યનાથ કેમિનેટમાં મંત્રી છે.

મોદી સિંહાને ખૂબ માન આપે છે અને ૨૦૧૫માં તેમને દર મહિને એક દિવસ વારાણસીમાં એમપી ઓફિસમાં વિતાવવા માટે પણ નિયુક્ત કર્યા હતા જેથી લોકોની ફરિયાદો ધ્યાને લેવામાં આવે. એક સૂત્રએ જણાવ્યું કે, તેઓ મોદીને ત્યારથી ઓળખે છે જ્યારે મોદી ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ હતા. આ પરસ્પર પ્રશંસા ઘણા પ્રસંગોએ જાહેરમાં જોવા મળી છે, જેમાં મોદીએ સિંહાને “છોટા ભાઈ (નાનો ભાઈ)” તરીકે ઉલ્લેખ કર્યો હતો.

૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં, ઉત્તર પ્રદેશમાં પ્રચાર કરતી વખતે, મોદીએ કહ્યું હતું કે ગાંધીપુરે એક રત્ન (રત્ન) ઉત્પન્ન કર્યું છે જે દેશ, જમ્મુ અને કાશ્મીરના મુક્ટ મણિ (તાજ દેશ)ને સંભાળી રહ્યું છે. ૨૦૨૪ની સંસદીય ચૂંટણીમાં જ્યારે મોદીએ પારસનાથ માટે પ્રચાર કર્યો ત્યારે તેઓ સિંહાના ઉલ્લેખને ટાળી શક્યા ન હતા. “ગાંધીપુર કા બેટા અજ જમ્મુ અને કાશ્મીર કી કમાન સંભાળ રહ્યા હોઈ ગાંધીપુરનો પુત્ર જમ્મુ અને કાશ્મીરમાં મામલો સંભાળી રહ્યો છે.” મોદીએ એક રેલીમાં કહ્યું. એ વાત પર ભાર મૂકવો જોઈએ કે ગાંધીપુર એવા જિલ્લાઓમાંનો એક છે જે સશસ્ત્ર દળોમાં સેવા આપવા માટે મોટી સંખ્યામાં યુવાનોને મોકલે છે.

રામ બહાદુર રાય પરિભળ

વરિષ્ઠ પત્રકાર અને આરએસએસના વિચારક રામ બહાદુર રાય (૭૮), જે ગાંધીપુરના વતની છે, તેમના સહયોગીઓ કહે છે કે સિન્હાની રાજકીય કારકિર્દીને માર્ગદર્શન આપવામાં પણ તેમની ભૂમિકા હતી. તેમના સંબંધો ૧૯૮૦ના દાયકાના છે અને એવું માનવામાં આવે છે કે રામ બહાદુર તેમને આટલા વર્ષો દરમિયાન ભાજપ નેતૃત્વની નજીક લાવ્યા હતા. રામ બહાદુરને પ્રતિષ્ઠિત ઈન્ડિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર પ આર્ટ્સ (IGNCA) ના અધ્યક્ષ તરીકે

નિયુક્ત કરવામાં આવ્યા હતા અને મોદીના સત્તામાં આવ્યા બાદ તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. IGNCAમાં તેમના કાર્યકાળ દરમિયાન તેમના પર સંસ્થાને RSS પ્રવૃત્તિઓના કેન્દ્રમાં ફેરવવાનો આરોપ હતો. ૨૦૧૬માં, રામ બહાદુરે બંધારણ ઘડવામાં બી.આર.આંબેડકરની ભૂમિકાને “દત્તકથા” તરીકે વર્ણવતા વિવાદ ઊભો કર્યો હતો. “રામ બહાદુર સિંહાજી અને અન્ય કાર્યકર્તાઓ માટે માર્ગદર્શક (માર્ગદર્શક) રહ્યા છે.” પારસ નાથે કહ્યું. યોગેન્દ્ર નાથે પણ પુષ્ટિ આપી હતી કે સિન્હાએ રામ બહાદુરના “આશીર્વાદ (આશીર્વાદ)”નો આનંદ માણ્યો હતો કારણ કે તે રાષ્ટ્રીય દ્રશ્ય પર ઉભરી આવ્યા હતા. એલજી બન્યા બાદ સિંહાએ રામ બહાદુર સાથે અનેક કાર્યક્રમોમાં હાજરી આપી છે. ૨૦૨૧માં, સિંહાએ રામ બહાદુરની હાજરીમાં જવાહરલાલ કોલની જન્મ કાશ્મીર: ધનુન્ડેડ પેરેડાઈઝ રિલીઝ કરી. જૂન ૨૦૨૨માં, તેમણે રામ બહાદુર દ્વારા લખાયેલ પુસ્તક ઈન્ડિયન કોન્સ્ટીટ્યુશન — અનટોલ ટેરીટોરિયલ વિભોચનમાં હાજરી આપી હતી. સિંહાએ બંધારણના નિર્માણ વિશે “ઘણા અજણ્યા અને રસપ્રદ તથ્યોને પ્રકાશમાં લાવવા” માટે તેમને અભિનંદન આપ્યા હતા.

મુખ્યપ્રવાહના મીડિયામાં, સિંહાને ઘણીવાર વિકાસ માણસ તરીકે દર્શાવવામાં આવ્યા છે, જે જાતિના સમીકરણોને અવગણ્યો અને તેમની સિદ્ધિઓના નામે મત માંગ્યો. આનો એક ભાગ સાચો છે, ગાંધીપુરમાં ભૂમિકારોની મોટી વસ્તી નથી, તેમ છતાં તેઓ તેમની વસ્તી પર પ્રભુત્વ ધરાવે છે. રેલવે મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, ગાંધીપુરથી નવી ટ્રેનો શરૂ કરવામાં આવી હતી અથવા ત્યાંથી મુસાફરી કરાવવામાં આવી હતી અને પ્રદેશના રેલવે સ્ટેશનોને નવનિર્માણ આપવામાં આવ્યું હતું. સ્થાનિક વિકાસ માટે તેમની સિદ્ધિઓમાં ગંગા અને રેલવે ડેપોના પુરવઠાના પર રેલવે પુલ અને રોડ પુલ બનાવવાનો યશ આપવામાં આવે છે.

યોગેન્દ્ર નાથે કહ્યું, “તેમણે એકવાર મને કહ્યું હતું કે જ્યારે પણ તે ગાંધીપુરની મુલાકાત લે છે, ત્યારે તે મંત્રાલયમાંથી ૧૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પોતાની સાથે લાવે છે.”

વર્ષથી, સિંહાએ હાંસિયામાં પહેલાઈ ગયેલા હિંદુ સમુદાયોમાં વોટ બેઝ કેળવવાનો પણ પ્રયાસ કર્યો છે, જેઓ ગાંધીપુરમાં મોટા ભાગના મતદારો બનાવે છે. ૨૦૧૬માં, તેમણે રાજકીય રેલવે પરંપરાને ગમા કરી. સુહલદેવ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનનું નામ બિહારના પૌરાણિક સરદારના નામ પરથી રાખવામાં આવ્યું હતું, જેને હિન્દુઓએ દાયકાઓથી મુસ્લિમ

વિરોધી યોદ્ધા તરીકે પ્રમોટ કરવાનો પ્રયાસ કર્યો હતો અને મુસ્લિમો વિરુદ્ધ OBCને ઉભા કર્યા હતા. આ ટ્રેન ગાંધીપુરથી દિલ્હીને જોડે છે.

રાજભર ગાંધીપુર પ્રદેશ અને તેની આસપાસનો મુખ્ય જાતિ મતવિસ્તાર છે. ધી ટેલિગ્રાફ સુત્રોને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે જ્યારે સિંહાએ ૨૦૧૫માં ટ્રેનનું નામ સુહલદેવના નામ પર રાખવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે અધિકારીઓએ વિરોધ કર્યો હતો. પરંતુ સિન્હાને “વડાપ્રધાન કાર્યાલય વરદથી સમર્થન મળ્યું પછી,” અધિકારીઓ પાસે “કોઈ વિકલ્પ નહોતો.” અખબારે અહેવાલ આપ્યો. સિંહાના વિરોધીઓને લાગે છે કે તેમણે સત્તા ભોગવવા છતાં લોકોના સામાજિક-આર્થિક કલ્યાણ માટે પુરતું કામ કર્યું નથી. “રેલવે એક દેખને વાલે (દિશ્યમાન) પ્રોજેક્ટ છે. જ્યારે ટ્રેન ચાલે છે, ત્યારે તે દૂરથી જોવા મળે છે. વિકાસ દેખાઈ રહ્યો છે. પરંતુ તેમણે ગાંધીપુર માટે કદાચ ગંગા રેલવે બ્રિજ બનાવવા સિવાય કંઈ કર્યું નહીં. રોજગાર અને શિક્ષણનું શું? આજ સુધી ગાંધીપુરમાં એનિજનિયરિંગ કોલેજ નથી,” સમાજવાદી પાર્ટીએ એક નેતાએ કહ્યું. સિંહા જ્યારે મંત્રી હતા ત્યારે દિલ્હીમાં રેલવેને ક્વર કરતા ભૂતપૂર્વ પત્રકારે જણાવ્યું હતું કે તેમણે પ્રથમ બે વર્ષમાં યોગ્ય કામ કર્યું હતું પરંતુ તેમણે પછી ટૂંક સમયમાં નોકરીની ટર્કેશન વખતે તેમણે તેમના સમુદાયના લોકોની ટર્કેશન કરી હતી. દિલ્હીએ આરોપ લગાવ્યો કે જ્યારે

સાંસદ અને મુન્સુફર અંસારીના મોટા ભાઈ અફઝલ સાથેની પ્રખ્યાત ચૂંટણી દુશ્મનાવટ શરૂ થઈ હતી, જે ગુનાહિત આરોપોથી ઘેરાયેલી વિવાદાસ્પદ વ્યક્તિ હતી. સિંહા ૨.૨૭ લાખ મતોના જંગી માર્જિનથી હારી ગયા, જે તે વર્ષે રાજ્યમાં સૌથી વધુ અને ગાંધીપુરમાં અત્યાર સુધીના સૌથી વધુ માર્જિનવાળી હાર હતી.

એક વર્ષ પછી, સિંહાને મોટો આંચકો લાગ્યો જ્યારે બીજેપી ધારાસભ્ય કૃષ્ણાનંદ રાય, નજીકના મિત્ર અને સાથી ભૂમિકારની હત્યા કરવામાં આવી. તે ઘટનાએ આજ સુધી પુલવેલાના રાજકારણ પર પડછાયા પાડ્યો છે. કૃષ્ણાનંદે ગાંધીપુરની મોહમ્મદાબાદ બેઠક માટે ૨૦૦૨ની વિધાનસભાની ચૂંટણીમાં અફઝલને હરાવ્યો હતો, જે અફઝલ દ્વારા ચંપ વખત, જેમાં CPIના ઉમેદવાર તરીકે ચાર વખત હાંસલ કરી હતી. કૃષ્ણાનંદની વિધવા અલકા રાય, જે ૨૦૧૭માં અફઝલના મોટા ભાઈ ભિખાનુલ્લા અંસારીને હરાવીને ધારાસભ્ય બન્યાની હતી, તેણે અંસારી ભાઈઓ, મુશ્કાર અને અફઝલ પર હત્યાની સ્કિપ્ટનો આરોપ મૂક્યો. ૨૦૧૯માં, દિલ્હીની વિધેય સંબોધાઈ કોર્ટે મુશ્કાર, અફઝલ અને અન્ય પાંચ લોકોને રાજ્યના કેસમાં નિર્દોષ જાહેર કર્યા હોવા છતાં, સત્તામાં રહેલી ભાજપ સરકારે તેમને લોકોની નજરમાં દોષી ઠેરવવાનું ચાલુ રાખ્યું. માર્ચમાં, અન્ય કેસમાં દોષિત મુશ્કારનું બાદા જેલમાં રહેલ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. જ્યારે તેમના પરિવારે આરોપ ચલાવ્યા હતાં કે તેમને શાસક વહીવટ દ્વારા રૂંદ આપવામાં આવ્યું હતું, ત્યારે સરકારે તેને હૃદયરોગના હુમલાથી મૃત્યુ તરીકે વર્ણવ્યું હતું. સિન્હાએ ૨૦૦૯ની લોકસભાની ચૂંટણી બહિષ્યામાંથી હારી હતી, ત્યારબાદ મોહમ્મદાબાદ વિધાનસભા બેઠક, જ્યાં તે મૂળ ગામ સ્થિત હતું, સીમાંકના ભાગરૂપે તેને ગાંધીપુર લોકસભા મતવિસ્તારમાંથી ભાજપ ખસેડવામાં આવ્યું હતું.

તે ત્રીજા સ્થાને રહ્યા હતા. કૃષ્ણાનંદ સાથે સિન્હાનો સંબંધ પણ તેમના BHU અને વારાણસીના સમયનો છે. યોગેન્દ્ર નાથ તેમને “મજબૂત મિત્રો” તરીકે વર્ણવે છે જેઓ વારંવાર વારાણસીમાં સ્ટુડન્ટ પર કરતા હતા. જ્યારે સિન્હા નેતા હતા, કૃષ્ણાનંદ ડેકેડર (કોન્ટ્રાક્ટર) હતા, નાથે ઉમેર્યું. પરંતુ કૃષ્ણાનંદના ૧૯૯૬માં, કૃષ્ણાનંદે પણ સિન્હાના પ્રખ્યાતથી ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ કર્યો. પરંતુ ૨૦૦૨માં ચોક્કસ બદલો લેતા પહેલા તે મોહમ્મદાબાદમાં અફઝલ સામે પ્રથમ ચૂંટણી હારી હતી. ૨૦૦૫માં કૃષ્ણાનંદની હત્યાએ બીજેપીના ભૂમિકારને નેતૃત્વ અને અંસારીઓ વચ્ચે વેમનસ્યની નવી લહેર ઉભી કરી હતી, જેમણે આ પ્રદેશમાં જમીની શ્રાંતિના નેતાઓ

સાથે લાંબા સમયથી વેપાર અને રાજકીય દુશ્મનાવટ વિકસાવી હતી. આ હત્યા સિંહા માટે પણ અંગત કટકો હતી. જ્યારે એક સ્પોટ દાવો કરે છે કે તેઓ તેમના પુત્રોની પત્નીઓ દ્વારા સંબંધિત છે, ગાંધીપુરના એક નેતા, જો કે પારિવારિક જોડાણ વિશે અચોક્કસ છે, તેમણે કટાક્ષ કર્યો: “મને ખબર નથી કે તેઓ સંબંધિત છે કે કેમ. તેઓ ચોક્કસપણે નજીક હતા. પણ જાતિ (જાતિ)થી મોટો રિશ્તા (સંબંધ) ક્યો હોઈ શકે? વર્ષથી, સિંહાએ કૃષ્ણાનંદની હત્યાને યાદ કરવા માટે યોજાયેલા કાર્યક્રમોમાં હાજરી આપવાનું ચાલુ રાખ્યું છે. ૨૮ નવેમ્બર, ૨૦૧૭ના રોજ, ગાંધીપુરમાં “શહાદત દિવસ” અથવા શહીદ દિવસના કાર્યક્રમમાં બોલતા સિન્હાએ કહ્યું કે કૃષ્ણાનંદનું મૃત્યુ “વ્યર્થ નહીં જાય” અને વચન આપ્યું કે હત્યારાઓને સજા થશે, કારણ કે ભાજપ હવે સત્તામાં છે.

પારસ નાથે વધુમાં કહ્યું કે સિંહાએ કૃષ્ણાનંદના પરિવારને તેની લાંબી કાનૂની લડાઈમાં પણ શાય આપ્યો, જે આજ સુધી ચાલુ છે. “તેમણે તેમને મદદ કરી, તે પણ પુલ્વેલામાં. તે કહેતા, જ્યાં સુધી તેમને મારા મિત્ર પાસે નહીં મોકલવા ત્યાં સુધી હું શાંતિથી બેસીશ નહીં.” પારસ નાથે કહ્યું. ઉત્તર પ્રદેશમાં ભાજપ સત્તામાં આવ્યું ત્યારથી, મુશ્કાર અને તેમના પરિવારે જાહેરમાં અનેક પ્રસંગોએ આરોપ લગાવ્યો છે કે સિંહા રાજકારણીઓ અને અધિકારીઓના જૂથનો ભાગ હતો જેઓ તેમને તેમના પરિવારે આરોપ ચલાવ્યા હતાં કે તેમને શાસક વહીવટ દ્વારા રૂંદ આપવામાં આવ્યું હતું, ત્યારે સરકારે તેને હૃદયરોગના હુમલાથી મૃત્યુ તરીકે વર્ણવ્યું હતું. સિન્હાએ ૨૦૦૯ની લોકસભાની ચૂંટણી બહિષ્યામાંથી હારી હતી, ત્યારબાદ મોહમ્મદાબાદ વિધાનસભા બેઠક, જ્યાં તે મૂળ ગામ સ્થિત હતું, સીમાંકના ભાગરૂપે તેને ગાંધીપુર લોકસભા મતવિસ્તારમાંથી ભાજપ ખસેડવામાં આવ્યું હતું.

તે ત્રીજા સ્થાને રહ્યા હતા. કૃષ્ણાનંદ સાથે સિન્હાનો સંબંધ પણ તેમના BHU અને વારાણસીના સમયનો છે. યોગેન્દ્ર નાથ તેમને “મજબૂત મિત્રો” તરીકે વર્ણવે છે જેઓ વારંવાર વારાણસીમાં સ્ટુડન્ટ પર કરતા હતા. જ્યારે સિન્હા નેતા હતા, કૃષ્ણાનંદ ડેકેડર (કોન્ટ્રાક્ટર) હતા, નાથે ઉમેર્યું. પરંતુ કૃષ્ણાનંદના ૧૯૯૬માં, કૃષ્ણાનંદે પણ સિન્હાના પ્રખ્યાતથી ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ કર્યો. પરંતુ ૨૦૦૨માં ચોક્કસ બદલો લેતા પહેલા તે મોહમ્મદાબાદમાં અફઝલ સામે પ્રથમ ચૂંટણી હારી હતી. ૨૦૦૫માં કૃષ્ણાનંદની હત્યાએ બીજેપીના ભૂમિકારને નેતૃત્વ અને અંસારીઓ વચ્ચે વેમનસ્યની નવી લહેર ઉભી કરી હતી, જેમણે આ પ્રદેશમાં જમીની શ્રાંતિના નેતાઓ

લગભગ ૧.૨૫ લાખ મતોથી હરાવ્યા. બીજેપી કદાચ એ હકીકત પર આધાર રાખે છે કે અલ્લાબાદ હાઈકોર્ટે અફઝલની અપીલને ફગવી દેશે અને ગયા વર્ષે કુશાબદીન હત્યા સાથે જોડાયેલા ગેંગસ્ટર કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા પછી તેને ચૂંટણીમાંથી ગેરલાયક ઠેરવશે. એવું ન થયું. અદાલતે યુક્ટાદ અનામત રાખ્યો હતો અને જ્યારે તેણે આખરે ૨૭ જુલાઈએ તેને સંભળવાનો હતો, પરિણામો અને શાથવિધિ પછી, તેણે અફઝલને નિર્દોષ જાહેર કર્યો હતો, તેણે ચૂંટણી જીતવા લગભગ બે મહિના પછી. તેનો અર્થ એ થયો કે અફઝલ સાંસદ તરીકે ચાલુ રહેશે. બીજેપીએ બલિયાની પડોશી રીટ પણ હારી છે, જ્યાં સિંહાનું ગામ મોહનપુરા આવેલું છે. એક સૂત્રએ જણાવ્યું કે, પાર્ટીએ ગામમાં બેમાંથી એક બ્રજ ગુમાવ્યો છે. પારસ નાથે કહ્યું કે તેઓ આશ્ચર્યચકિત છે કે તેમને ગાંધીપુરમાંથી ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા કારણ કે તેમને સિન્હાના પુત્ર અભિનવની અપેક્ષા હતી, જે લોખિંદ કરી રહ્યો હતો. તેમણે કહ્યું કે આરએસએસએ નક્કી કર્યું હતું કે તેઓ ઉમેદવાર હશે અને એક સંકલન બેઠકમાં તેમને જાણ કરવામાં આવી હતી કે તેઓ ગાંધીપુર અને જોનપુરમાં ચૂંટણી યુદ્ધમાં પ્રવેશવા માટે તેમની સંઘની ફરજોમાંથી મુક્ત થશે. “તે સંપૂર્ણપણે સંસ્થાની ભૂમિકા હતી. મેં ટિકિટ માંગી ન હતી. મને કોઈ રૂકાવ ન હતો. હું સિંહાજીને નજીક હતો અને તેમની ચૂંટણી જોતો હતો. તેથી, લોકોએ આ નિષ્કર્ષ કાઢવાનું શરૂ કર્યું.” પારસ નાથે કહ્યું. તેમણે કહ્યું કે જો ભાજપ ઈંચોથી વધુ બેઠકો જીતશે તો બંધારણ બદલશે તેવી ધારણાએ તેમની તેમજ અન્ય ભાજપના ઉમેદવારોની સંભાવનાઓને નુકસાન પહોંચાવ્યું છે. એકલા જોગીપુર વિધાનસભા બેઠકમાં, પારસ નાથે કહ્યું કે ૭૦ બુધમાં બહુજન સમાજ પાર્ટીને સિંગલ ઊંચા વોટ મળ્યા છે, જે તેના મુખ્ય જીવંત મતદારોનું મોટા પાયે સમાજવાદી પાર્ટીમાં પરિવર્તન દર્શાવે છે. હાલથી ગાંધીપુરમાં બીજેપી માટે નેતૃત્વમાં ચૂંટણી સર્જણો છે કારણ કે તેના સૌથી ઊંચા નેતા સિંહા શ્રીનગરમાં સંકેતો મોઠલ દૂર સેવા આપવાનું ચાલુ રાખે છે. ૨૦૧૬માં પાછા આવતાં, ભાજપના યુવા કાર્યકરો સાથેના તેમના ભાષણમાં, સિંહાએ કહ્યું હતું કે પાર્ટીનું મહત્વ તેના સંગઠનનું કેટલું મોટું છે તેના કારણે નથી પરંતુ ચૂંટણીમાં જીત કે હારના આધારે છે. ૨૦૨૪ની ચૂંટણીએ તેમને વિચારવા માટે પુષ્કળ અવકાશ આપ્યો છે.

(સમાપ્ત)
(સૌ : ધ ક્વિન્ટ-ટુ.કોમ)

ભારતીય મુસ્લિમોના અપમાન અને તેમના ઘરો તોડી પાડવા અંગે સુપ્રીમ કોર્ટનું રહસ્યમય મૌન

ભારતમાં મુસ્લિમ ઘરોને આયોજિત રીતે તોડી પાડવા એ માત્ર શહેરી આયોજન કે કાયદાના અમલીકરણની બાબત જ નથી પણ તે રાજ્ય દ્વારા હિંસાનું એક સ્વરૂપ છે જે દેશમાં ન્યાયના માળખાને ખતમ કરી રહી છે. કાયદાના અમલીકરણના બહાને હેઠળ મુસ્લિમ મિલકતોને નિશાન બનાવવાના ભયજનક વલણે ન્યાયતંત્રની ભૂમિકા અને ખાસ કરીને ભારતની સર્વોચ્ચ અદાલત કે જે બંધારણની રક્ષક છે તેની ભૂમિકા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સપ્ટેમ્બર ૨૦૧૭માં આ વલણ વધુ સ્પષ્ટ બન્યું, જ્યારે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જાહેર કર્યું કે તેમની સરકાર મહિલાઓ અને સમાજના નબળા વર્ગો સામેના ગુનાઓમાં સામેલ લોકોની મિલકતોને ભુલડોડ કરશે. આ નિવેદન એ સંકેત છે કે, ઉત્તરપ્રદેશની ભાજપ સરકાર કાનૂની પ્રક્રિયાઓને બાયપાસ કરવા અને તેને ન્યાયને બદલે પોતાના ન્યાયિક પગલાંનો આશરો લઈ શકે છે. જો કે, આ ‘ભુલડોડર ન્યાય’ દ્વારા અપમાણસર રીતે મુસ્લિમ સમુદાયને નિશાન બનાવવામાં આવેલ છે.

બંધારણીય અધિકારોના આ પુલ્વેઆમ ઉલ્લંઘન સામે સુપ્રીમ કોર્ટનું મૌન ખૂબ જ ચિંતાજનક છે. તમામ નાગરિકોના અધિકારોનું રક્ષણ કરનાર આ કોર્ટ મોટાભાગે ઉદાસીન રહી છે અને અસંખ્ય ભુલડોડરોએ દેશભરમાં હજારો મુસ્લિમોના ઘરોને તોડી પાડ્યા છે. આ માત્ર ન્યાયિક નિષ્ક્રિયતાનો મામલો નથી પરંતુ મુસ્લિમોના અમાનવીયકરણને અવગણવાનો ઈરાદાપૂર્વકનો નિર્ણય હોવાનું જણાય છે, તે ફાસીવાદને સામાન્ય બનાવે છે અને ન્યાય અને સમાનતાના સિદ્ધાંતોને નબળા પાડે છે.

શું સુપ્રીમ કોર્ટે ભીંડાના કલેક્ટરનો ઓડિયો સાંભળ્યો ન હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, જો કોઈ મુસ્લિમ ગુનો કરે છે તો તેમના ઘર તોડી પાડવામાં આવશે. આ ‘ભુલડોડર ન્યાય’નું સૌથી વિકરાળ ઉદાહરણ અલ્લાબાદમાં બન્યું હતું,

હદીસ બોધ	આજની આરસી	અગત્યની સૂચના
બેદરકારી-બેકાળજી સોધી મોટી ગરીબી છે. - હદીસ બોધ	૨૮ ઓગસ્ટ બુધવાર ૨૦૨૪ ૨૨ સફર હિજરી ૧૪૪૬ શ્રાવણ વદ દસમ સંવત ૨૦૮૦ સુબ સાદિક ૪-૫૯ ભત્તે જવાલ ૧૨-૪૧ તુલુએ આકતાબ (સૂર્યોદય) ૬-૨૧ ગુરુએ આકતાબ (સૂર્યાસ્ત) ૭-૦૨	આ અખબારમાં જરૂરિયાતને અનુલક્ષીને ધાર્મિક શબ્દોનો ઉલ્લેખ, ફોટો કેટલીકવાર છાપવા પડે છે, જે વાચકમિત્રોના ધ્યાને આવે તો તેની તેમણે ખાસ હિકાજત કરવી. - વ્યવસ્થાપક
બોધ વચન		
દયા એવી ભાષા છે, જેને બહેરો સાંભરી શકે અને આંધળો વાંચી શકે. - માર્કટવેન		

કોન્સ્ટેબલની આત્મહત્યા અંગે દલિતોનો વિરોધ; ત્રણ પોલીસકર્મીઓ અને પત્રકાર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો



(એજન્સી)

નવી દિલ્હી, તા. ૨૭
મુલક કોન્સ્ટેબલ બાબુ લાલ ભૈરવના પુત્રને શુક્રવારના રોજ એફઆઈઆર દાખલ કર્યા પછી અને મોટી સંખ્યામાં દલિત સમુદાયના લોકોએ વિરોધ કર્યો, વધારાના પોલીસ અધિકારી જગદીશ વ્યાસ, સહાયક પોલીસ કમિશનર (સદર) અનિલ કુમાર શર્મા, એસઆઈ (મુરલીપુરા) આશુતોષ સિંહ, અને પત્રકાર કમલ દેગડા, બિનદરમિયાન સિનવર મોડના રહેવાસી સામે આત્મહત્યા માટે ઉચ્ચકોર્ટમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

ભૈરવે ગુરૂવારે ભાંકરોટા પોલીસ સ્ટેશનની મુકુદપુરા ચોકીની અંદર ફાંસી ખાધો હતો, છ પાનાની હસ્તલિખિત સુસાઈડ નોટ પાછળ છોડી હતી જેમાં તેણે ત્રણ પોલીસ અધિકારીઓ અને લેખકને આત્યંતિક પગલું ભરવા માટે તેને જવાબદાર કરવા હતા.

આરોપીઓ સામે IPC કલમ ૧૦૮ (આત્મહત્યા માટે ઉચ્ચકોર્ટ), ૧૯૮(અ) (જાણતા કાયદાની કોઈપણ ઢિશાનો અનાદર કરવો), ૨૦૧ (જાહેર સેવક ઈજા પહોંચાડવાના ઈરાદાથી મોટો

પોલીસ અધિકારીને સોંપવામાં આવી છે. અમે હેડ કોન્સ્ટેબલ દ્વારા છોડવામાં આવેલા સુસાઈડ નોટની તપાસ કરી રહ્યા છીએ ભૈરવ અને ભાંકરોટાના તલાકાલિન સ્ટેશન હાઉસ ઓફિસર (SHO)ને મિલકત વિવાદ કેસના સંબંધમાં ગયા વર્ષે સરખેન્ડ કરવામાં આવી હતી. તેમના પત્રમાં, ભૈરવ એ દાવો કર્યો હતો કે, આ મામલે તેની સાથે અન્યાયી વર્તન કરવામાં આવ્યું હતું અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ભૂમિકાની પણ તપાસ કરવા આગ્રહ કર્યો હતો. તેણે લખ્યું કે, તપાસ ખોટા તથ્યોના આધારે હાથ ધરવામાં આવી હતી અને આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી હતી. ભૈરવ એ એવો પણ આરોપ લગાવ્યો હતો કે આરોપીઓએ તેનું અપમાન કરવા માટે જાતિ આધારિત અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે તે માનસિક યાતનામાં હતો. તેણે દાવો કર્યો કે, તે લગભગ એક વર્ષથી ડિપ્રેશનથી પીડિત હતો.

અનુસૂચિત જાતિ-સંયુક્ત સંઘર્ષ સમિતિના કન્વીનર અનિલ ગોશવાલે જણાવ્યું હતું કે, વિરોધીઓએ મુલકના પરિજનો માટે નોકરી અને તમામ આરોપીઓની ધરપકડની માંગ સાથે સરકારને મેમોરેન્ડમ સુપરત કર્યું છે. તેમણે કહ્યું, અમે મેમોરેન્ડમમાં સુચિબદ્ધ માંગણીઓ વિશે વહીવટીતંત્ર સાથે વાત કરી રહ્યા છીએ. મોડી સાથે સુધી પ્રદર્શનકારીઓ એસએમએસ હોસ્પિટલના શબઘર બહાર બેઠા હતા અને પોસ્ટમોર્ટમ કરવાનું બાકી છે.

દલિત, પછાત વર્ગના સમુદાયના લોકોએ સિદ્ધારમૈયાને બિનશરતી નૈતિક સમર્થન જાહેર કર્યું

(એજન્સી) બેંગલુરુ, તા. ૨૭



રાજભવન દ્વારા કાર્યવાહીની પરવાનગી આપવા સામે સખત વિરોધ દર્શાવતા, કાગિનેલે મધ્ય નિરંજનાનંદની આગેવાની હેઠળ દલિત-પછાત વર્ગના સંતોનો સંઘ રવિવારે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને મળ્યું અને તેમને બિનશરતી સમર્થન આપ્યું. મુખ્ય મંત્રી સાથે સંતોની આ બેઠક મહત્વની છે કારણ કે ક્યારેક ડિપ્રેસ ક્લાસીસ કેરેશનને કથિત મૈસુર સાઈટ ફાળવણી કોલોમના સંબંધમાં કાર્યવાહીની મંજૂરી આપવા સામે વિરોધ દર્શાવતા ૨૭ ઓગસ્ટે રાજભવનનો ઘેરાવ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સંતોએ કેન્દ્ર સરકાર પર સરકારને બનાવટી રીતે અસ્થિર કરવાનો આરોપ

લાગાવ્યો છે. અને રાજભવનના પહોંચાણની સખત શબ્દોમાં નિંદા કરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સંતોએ જાહેરાત કરી છે કે તેઓ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની તરફેણમાં અહિંસા સામે એક થઈને લડશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રીને મળવા સંતોના પ્રતિનિધિ મંડળમાં કાંગોનેલે કનક ગુરુપીઠના નિરંજનાનંદપુરી સ્વામી, હોસાદુર્ગમાં કુંચિતિગા મઠના

દલિત મહિલાની લાશ મળી; બળાકાર અને હત્યાની આશંકા

(એજન્સી)

મૈસુર, તા. ૨૭
એક આશ્ચર્યજનક ઘટનામાં શુક્રવારની રાત્રે ગઢાવાડી ગામમાં એક દલિત મહિલાનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો, જેના પગલે શનિવારના દિવસે ગામમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. પીડિતના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, તેના પરિચિત સ્થાનિક રહેવાસી દ્વારા તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું અને તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના કોવલાંદે પોલીસ સ્ટેશનની હદમાંથી નોંધાઈ હતી. ગઢાવાડી ગામ નંજનગુડ્ડી ૨૨ કિ.મી. દૂર આવેલું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ૩૮ વર્ષીય મહિલા સ્થાનિક રહેવાસીના કેળાના બગીચામાં મૃત હાલતમાં મળી આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મુલક વિધવા હતી અને નંજનગુડ્ડામાં એક પાનની કંપનીમાં કામ કરતી હતી. તે ગામમાં તેના પિતા સાથે રહેતી હતી. તે સામાન્ય રીતે સવારે ૯ વાગ્યે ઓફિસ માટે નીકળી જતી અને રોજ સાંજે ૮:૩૦ વાગ્યે ઘરે પરત આવતી. શુક્રવારની રાત્રે ૯ વાગ્યા પછી પણ મહિલા

ઘરે પરત ન ફરતાં તેના પરિવારજનો ચિંતામાં પડી ગયા હતા અને તેની શોધખોળ શરૂ કરી હતી. મોડી રાત્રે તેનો મૃતદેહ પ્લાસ્ટીકમાંથી મળી આવ્યો હતો. મુલકના ભાઈ મહાદેવેયાએ પોતાની ફરિયાદમાં સ્થાનિક રહેવાસી, રિશ્યાલાલકનું નામ આરોપી તરીકે આપ્યું છે. મહાદેવેયાએ જણાવ્યું કે, તે દરરોજ તેની રિશ્યામાં મુસાફરી કરતી હતી. શુક્રવારની રાત્રે તે તેને તેની વાડીમાં લઈ ગયો અને તેના પર જાતીલ હુમલો કર્યા પછી તેની હત્યા કરી. તેણે તેની ફરિયાદમાં આરોપ મૂક્યો હતો કે, ડ્રાઈવરે દાવો કર્યો હતો કે, મારી બહેનનું કેળાની વાડીમાં આત્મહત્યાથી મૃત્યુ થયું હતું, અહીંની કે.આર. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. ગામમાં તંગદિલીનો માહોલ છે. મૈસુરના એસપી અને. વિષ્ણુવર્ધને કહ્યું કે, આ ઘટનાના સંબંધમાં બળાકાર અને હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. અમે વિધવા પાસાંઓથી લેબર સરકારને તપાસ કરી રહ્યા છીએ. પરિવારે એક વ્યક્તિ પર આરોપ લગાવ્યા છે. અમે તમામ શક્યતાઓ તપાસીશું.

ફૂટબોલ બાદ ક્રિકેટમાં પણ સ્પેને ધમાલ મચાવી સ્પેને ઇતિહાસ રચ્યો, ટી-૨૦માં સતત ૧૪ મેચ જીતી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમો પણ આજ સુધી આવું કરી શકી નથી

નવી દિલ્હી, તા. ૨૭
સ્પેનની ફૂટબોલ ટીમ ગજબની છે. તે વિશ્વની સૌથી શાનદાર ફૂટબોલ ટીમોમાંથી એક છે. જો કે, ક્રિકેટમાં સ્પેનની ટીમ ઘણી માનવામાં આવે છે પણ હવે તે ધીરે-ધીરે મજબૂત બની રહી છે. સ્પેને ક્રિકેટમાં વર્લ્ડ રેકોર્ડ બનાવી ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમોને પાછળ પાડી દીધી છે. સ્પેનની ક્રિકેટ ટીમે એક એવો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે, જેનાથી બધા હતાશ્ચર્યમાં. સ્પેને યુરોપ ટી-૨૦ વર્લ્ડકપ સભ રીજનલ ક્વોલિફાયરમાં બ્રિસને હરાવી ઇતિહાસ રચી દીધો છે. તે ટી-૨૦માં સતત સૌથી વધારે મેચ જીતનારી ટીમ બની ગઈ છે. સ્પેને સતત ૧૪ ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચ જીતી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ કમાલ આજ સુધી ભારત અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમો કરી શકી નથી. જો કે, ટીમ ઈન્ડિયા સંયુક્ત રૂપથી ટોચના ૧૨ દેશોમાં સતત સૌથી વધારે ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચ જીતનારી ટીમ છે. તેણે અફઘાનિસ્તાન સાથે ટી-૨૦માં સતત ૧૨ મેચ જીતી છે. આજ સુધી ટોચની ૧૨ ટીમોમાં સતત આવવું ભારત અને અફઘાનિસ્તાન સિવાય કોઈ કરી શક્યું નથી. સ્પેનના કોચ ફરી રટગર્સે કહ્યું કે, આ એક ગર્વનો રેકોર્ડ છે. અમે ચોક્કસ રેકોર્ડ માટે નથી રમતા પણ આ ગ્રુપ માટે ખાસ છે. સ્પેનમાં અમુક વર્ષ પરિવર્તન કરી રહ્યા છે. ભારતીય ટીમ સતત સૌથી વધુ ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચ જીતવાના મામલે છલ્લ સ્થાન પર છે. તેના ઉપર સ્પેન (૧૪), મલેશિયા (૧૩), ભરૂડા (૧૩), અફઘાનિસ્તાન (૧૨) અને રોમાનિયા (૧૨) છે. ભારતીય ટીમે નવેમ્બર ૨૦૨૨ થી ફેબ્રુઆરી ૨૦૨૨ સુધી આ ૧૨ મેચ જીતી હતી. ટોપ-૧૦ આઈસીસી ટી-૨૦ રેકોર્ડમાં ભારત અને અફઘાનિસ્તાન એકમાત્ર બે ટીમો છે, જેમણે સતત ૧૦ કે તેથી વધુ ટી-૨૦ મેચ જીતી છે. તેમના પછી પાકિસ્તાનની ટીમ છે, જેણે સતત ૯ મેચ જીતી છે.

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક ઓવરમાં ૬ ચોગ્ગા ફટકારનાર પાંચ બેટ્સમેન

નવી દિલ્હી, તા. ૨૭
એક ઓવરમાં ૬ સિક્સર ફટકારવી જેટલી મુશ્કેલ હોય છે તેટલું જ મુશ્કેલ એક ઓવરમાં ૬ ચોગ્ગા ફટકારવાનું પણ છે. અત્યાર સુધી પાંચ બેટ્સમેનોએ એક ઓવરમાં ૬ સિક્સર ફટકારી છે. જ્યારે એક ઓવરમાં ૬ ચોગ્ગા પાંચ બેટ્સમેનોની સંખ્યા પાંચ છે.

- સંદીપ પાટિલ-ટેસ્ટ: પૂર્વ ભારતીય બેટ્સમેન સંદીપ પાટિલે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ૧૯૮૨માં બોમ્બે વિલિસની ઓવરમાં ૬ ચોગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ તે ઈન્ટરનેશનલ ક્રિકેટની એક ઓવરમાં ૬ ચોગ્ગા ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યા હતા. સંદીપ પાટિલ આ ઓવરમાં એક ડોટ બોલ પણ રમ્યા હતા જે નો બોલ હતો.
- ક્રિસ ગેલ-ટેસ્ટ: વેસ્ટઈન્ડિઝના ક્રિસ ગેલે પણ એક ઓવરમાં ૬ ચોગ્ગા ફટકાર્યા હતા. તેમણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ મેચમાં મેચ્યુ હોર્ગાઉ વિરુદ્ધ ૨૦૦૪માં બધા બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા.
- રામનરેશ સરવન-ટેસ્ટ: વેસ્ટઈન્ડિઝના જ રામનરેશ સરવન પણ એક ઓવરમાં ૬ ચોગ્ગા ફટકારી ચુક્યા છે. ભારતના ઝડપી બોલર મુનાફ પટેલ વિરુદ્ધ સરવને આ સિદ્ધિ મેળવી હતી. જો કે, સંદીપ પાટિલની જેમ જ નો બોલના કારણે આ ઓવરમાં સાત બોલ ફેંકાયા હતા.
- સામ જયસૂર્યા-ટેસ્ટ: શ્રીલંકાના વિસ્ફોટક ઓપનર સામ જયસૂર્યાના નામ પણ એક ઓવરમાં ૬ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ છે. તેમણે કેનીયા સામેથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના ઝડપી બોલર એન્ડરસનેને ૬ ચોગ્ગા ફટકાર્યા હતા. આ મેચ ૨૦૦૭માં રમાઈ હતી.
- તિલકનેને દિલ્લિયાન-વન-૩: લિમિટેડ ઓવર ક્રિકેટમાં એક ઓવરમાં ૬ ચોગ્ગા મારવાનો રેકોર્ડ ફક્ત શ્રીલંકાના તિલકનેને દિલ્લિયાના નામે છે. તેમણે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ જોન્સને વિરુદ્ધ ૨૦૧૫ વર્લ્ડકપમાં આ કમાલ કર્યો હતો. જો કે, તેમ છતાં શ્રીલંકા આ મેચ હારી ગયું હતું.

વધતા જતા સ્થળાંતરને લીધે ઓસ્ટ્રેલિયાએ વિદેશી વિદ્યાર્થીઓના આગમન પર મર્યાદા નક્કી કરી અને કેનેડા કામચલાઉ કામદારોની સંખ્યામાં ઘટાડો કરશે

કોવિડ પછી મજૂરની અછતને પગલે આ બંને દેશોએ સ્થળાંતર નિયમો હળવા કર્યા હતા, પરંતુ આવતા વર્ષે યૂંટીઓ હોવાથી સ્થળાંતરનું રેકોર્ડ સ્તર અને મકાન ભાડામાં વધારો અને બેરોજગારીના દરમાં વધારો થયો છે

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
ઓસ્ટ્રેલિયાએ મંગળવારે જાહેરાત કરી હતી કે, તે ૨૦૨૫ માટે તેના વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ૨,૭૦,૦૦૦ સુધી મર્યાદિત કરવાની યોજના ધરાવે છે. અહીં ઘરના ભાડાના ભાવમાં વધારો થયો હોવાથી સ્થળાંતરના રેકોર્ડ સ્તર પર લગભગ લગાવવામાં આવશે. આ પગલાની ઉચ્ચ શિક્ષણ માટે વિદેશમાં જતા ભારતીય વિદ્યાર્થીઓ પર ખાસ કરીને પંજાબના વિદ્યાર્થીઓ પર નોંધપાત્ર અસર પડશે. એક દિવસ અગાઉ કેનેડિયન સરકારે દેશમાં બેરોજગારી અને અવાસ કટોકટીને લીધે રેકોર્ડ સ્તરે સ્થળાંતર કરીને કારણે દેશમાં અસ્થાયી વિદેશી કામદારો (TFW) ની સંખ્યામાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. ઓસ્ટ્રેલિયન શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, આજ સરકારે જાહેરાત કરી છે કે, સંસદ સમક્ષ કાયદો પસાર થવાને આધિન, તે કેલેન્ડર વર્ષ ૨૦૨૫ માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ૨,૭૦,૦૦૦નું રાષ્ટ્રીય આધોજન સ્તર (NPL) નક્કી કરશે. સાર્વજનિક રૂપે મંડોળ ધરાવતી યુનિવર્સિટીઓ માટે, મેનેજડ પ્રોથા અભિગમ, એક દરે ૨૦૨૫માં લગભગ ૧,૪૫,૦૦૦ નવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સાથે થશે. અન્ય યુનિવર્સિટીઓ લગભગ ૩૦,૦૦૦ નવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સુધી મર્યાદિત રહેશે, જ્યારે બાકીના ૯૫,૦૦૦ વિદ્યાર્થીઓને વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશના લગભગ ૧.૨૨ લાખ વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરે છે. કેનેડા, યુએસ અને યુકે પછી વિદેશમાં અભ્યાસ કરના ભારતીય વિદ્યાર્થીઓ માટે ભારતનું ક્વાડ પાર્ટનર યોથું સૌથી લોકપ્રિય સ્થળ છે. છેલ્લા દાયકામાં ઓસ્ટ્રેલિયન અર્થતંત્રમાં આંતરરાષ્ટ્રીય શિક્ષણ ક્ષેત્રનું યોગદાન વધીને ૨૦૨૨-૨૦૨૩માં ૩૬૪૦ કરોડ ડોલર થયું છે જે ૨૦૧૪-૨૦૧૫માં ૧૬૯૦ કરોડ ડોલર હતું. આ વર્ષે જુલાઈમાં ઓસ્ટ્રેલિયન સરકારે વિદેશી વિદ્યાર્થીઓ માટે બિન-રિફંડ ઇમ્પાટ વિઝા કી બમણી કરતાં વધુ ૭૧૦ ડોલરથી ૧૬૦૦ ડોલર કરી હતી, નેટ સ્થળાંતર સ્તર ૨૦૨૨-૨૦૨૩માં ૫.૨, ૦૦૦થી ઘટાડીને ૨૦૨૪-૨૦૨૪ સુધીમાં ૨,૬૦,૦૦૦ કરી દીધું છે.

૨૦૨૫ સુધીમાં સ્ટુડન્ટ વિઝા નિયમો અને ઓછા કુશળ કામદારોની સંખ્યા અડધી કરવા માટે ડિસેમ્બર ૨૦૨૩માં પહેલીવાર જાહેરાત કરવામાં આવી હતી, જેમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના યુનિવર્સિટી ઈન્ટેક પર કેસ ઓસ્ટ્રેલિયામાં લેબર સરકારનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. પંજાબ, ગુજરાત અને હરિયાણાના વિઝા અરજદારો કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ઉચ્ચ અભ્યાસ કરવા માંગે છે તેઓ કડક નિયમો વચ્ચે

ભારતીય ક્રિકેટરો પર પૈસાનો વરસાદ કરશે BCCI

નવી દિલ્હી, તા. ૨૭
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ઘરેલુ સ્તરે બધી મહિલા અને જૂનિયર ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ માટે ઈનામી રકમની શરૂઆત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આના ઉપરાંત સિનિયર પુરૂષો માટે વિજય હજારે અને સંયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ માટે ઈનામી રકમ આપવામાં આવશે. આ પહેલનો ઉદ્દેશ ઘરેલુ સર્કિટમાં શાનદાર પ્રદર્શન કરનારને પુરસ્કૃત કરવાનો છે. જય શાહે કહ્યું કે, આ પ્રયાસ અતૂટ સમર્થન માટે ટોચની પરિષદનો આભાર સાથે મળીને અમે પોતાના એકાઉન્ટથી ડ્રિવટ કરીને કહ્યું કે, અમે પોતાના ઘરેલુ ક્રિકેટ

કાર્યક્રમ મુજબ બધી મહિલા અને જૂનિયર ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ માટે ઈનામી રકમ આપવામાં આવશે. આ પહેલનો ઉદ્દેશ ઘરેલુ સર્કિટમાં શાનદાર પ્રદર્શન કરનારને પુરસ્કૃત કરવાનો છે. જય શાહે કહ્યું કે, આ પ્રયાસ અતૂટ સમર્થન માટે ટોચની પરિષદનો આભાર સાથે મળીને અમે પોતાના એકાઉન્ટથી ડ્રિવટ કરીને કહ્યું કે, અમે પોતાના ઘરેલુ ક્રિકેટ

ગત વર્ષે બીસીસીઆઈએ ઘરેલુ ટુર્નામેન્ટ માટે ઈનામી રકમમાં વધારો કર્યો હતો અને રણજી ટ્રોફી વિજેતાને પાંચ કરોડ રૂપિયાનું રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું. ઈનામ કપ માટે રોકડ ઈનામ પણ બેવડું કરી દેવાયું હતું, જેમાં વિજેતાને ૨૫ લાખ રૂપિયાના બદલે ૫૦ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા અને રનર્સઅપને ૨૫ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. દુલીપ ટ્રોફીમાં હવે ચેમ્પિયનને એક કરોડ રૂપિયા અને રનર્સઅપને ૫૦ લાખ રૂપિયા મળે છે. જ્યારે વિજય હજારે ટ્રોફીના વિજેતાને એક કરોડ રૂપિયા અને બીજા સ્થાને રહેનારી ટીમને ૫૦ લાખ રૂપિયા મળે છે.

મહિલા ટી-૨૦ વર્લ્ડકપ માટે ભારતીય ટીમ બહેર, હરમનપ્રીત કૌર કપ્તાન

નવી દિલ્હી, તા. ૨૭
૩ ઓક્ટોબરથી ૨૦ ઓક્ટોબર દરમિયાન રમાનાર મહિલા ટી-૨૦ વર્લ્ડકપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવાઈ છે. મહિલા પસંદગી સમિતિએ મંગળવારે ભારતની ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી છે. હરમનપ્રીત કૌર ટીમનું નેતૃત્વ કરશે. જ્યારે સ્મૃતિ મંધાના ઉપકપ્તાન છે. પહેલાં આનું આયોજન બાંગ્લાદેશમાં થવાનું હતું પણ ત્યાં અશાંતિના કારણે હવે મહિલા ટી-૨૦ વર્લ્ડકપ દુબઈ અને શારજહમાં

રમાશે. આ બંને સ્થળે કુલ ૨૩ મેચ રમાશે. ક્રિકેટિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની નજર સતત થોથા ટી-૨૦ ટાઈટલ પર હશે. ગત ટુર્નામેન્ટ કાંગાડુ ટીમે ૫૬ કપ્તાન મેગ લેનિંગના નેતૃત્વમાં જીતી હતી. ભારતીય મહિલા ટીમ ફક્ત એક જ વાર ૨૦૨૦માં ફાઈનલ સુધી પહોંચી છે. ટુર્નામેન્ટના ચુપ-ચપમાં ઓસ્ટ્રેલિયા, ભારત, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા છે. જ્યારે ચુપ-ચપમાં દ.આફ્રિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટઈન્ડિઝ, બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ સામેલ છે. ટુર્નામેન્ટમાં

દરેક ટીમ ચાર ગ્રુપ મેચ રમશે. પ્રત્યેક ગ્રુપમાંથી બે ટોચની ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. ભારતીય મહિલા ટીમ ફે બે ઓક્ટોબરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. ભારતીય ટીમ :- હરમનપ્રીત કૌર (કપ્તાન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, દિપ્તિ શર્મા, જેમિમા રોય્સિય, જ્ઞાપા ધોપા, યાસ્તિકા ભાટિયા, પૂજા વસ્ત્રાકર, અરૂંપતિ રેડ્ડી, રેણુકાસિંહ ઠાકુર, દયાલન હેમલતા, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટિલ, સજના સજ્જવન.

દુલીપ ટ્રોફીના પ્રથમ રાઉન્ડમાંથી મો.સિરાજ, ઉમરાન અને જાડેજા બહાર

નવી દિલ્હી, તા. ૨૭
બી સી સી આ ઈ ની સિલેક્શન કમિટીએ દુલીપ ટ્રોફી ૨૦૨૪-૨૫ના પ્રથમ રાઉન્ડ માટે સ્કોર્ડમાં અમુક ફેરફાર કર્યા છે. અમુક ખેલાડીઓના બહાર થયા બાદ તેમને રિપ્લેસ કરનાર પ્રથમ રાઉન્ડ પાંચ સાટેમ્બરથી આંધ્રપ્રદેશના અનંતપુર અને બેંગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ટીમ સીમાં

ઉમરાન મલિકને ગૌરવ યાદવ રિપ્લેસ કરશે. સિરાજ અને ઉમરાન બંને ભીમાર છે અને ટુર્નામેન્ટની શરૂઆત સુધી પૂરી રીતે ફિટ થઈ શકશે નહીં. ટીમ-બીમાંથી રવિન્દ્ર જાડેજાને પણ રિલીઝ કરી દેવાયો છે. દુલીપ ટ્રોફી ૨૦૨૪-૨૫નો પ્રથમ રાઉન્ડ પાંચ સાટેમ્બરથી આંધ્રપ્રદેશના અનંતપુર અને બેંગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ટીમ સીમાં

ફિટ રહેશે તો જ દુલીપ ટ્રોફીનો પ્રથમ રાઉન્ડ રમશે. ડોમેસ્ટિક ક્રિકેટને લઈ બીસીસીઆઈએ કડક વલણ અપનાવવાનું શરૂ કરી દીધું છે અને ભારતીય ક્રિકેટ ટીમમાં બની રહેવા માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવું મોટાભાગના ખેલાડીઓ માટે અનિવાર્ય થઈ ચૂક્યું છે. રોહિત શર્મા, વિરાટ અને ભુમરાહને આ મામલામાં છૂટ મળી છે પણ બાકી ખેલાડીઓને હવે ડોમેસ્ટિક ક્રિકેટને ગંભીરતાથી લેવું પડશે.

ગુજરાત ટુડે ટ્યુકડી બહેર બહાર

જોઈએ છે

જોઈએ છે
અનુભવી સ્ટાફ દુર પેકેજ ભુકિંગ કરવા માટે ઓફિસ ઝકરિયા મલ્હિદ, રિલીફ રોડ
9974744698

ગોપાલ નમકીનીની રિલિવરી માટે ડ્રાઈવર અને ઓર્ડર માટે સેલ્સમેન જોઈએ છે. જેણે નમકીનીની કંપનીમાં રિલવરીનો કામ કર્યું હોય તેને પ્રથમ પસંદગી આપવામાં આવશે. (સરખેજ વિસ્તાર માટે)
ફોન નં.: 9825776796

મકાન અને જમીન ભાડે-વેચાણ

ફલેટ વેચાણ
2 BHK હવા ઉજાસવાળો કાલુપુર પાંચપટ્ટી, ટાવર પાસે
8490967466

પ્લોટ વેચાણને છે
228 વાર NANOC ટાઈટલ ક્લિયર પ્રાઈમ લોકેશન, અરેબિયાન-51 લોખંડવાલા પાર્ટી પ્લોટની પાસે
9825752535</

તેલંગાણા વક્ક બોર્ડનો વક્ક સુધારા બિલ વિરુદ્ધ ઠરાવ

(એજન્સી) તેલંગાણા વક્ક બોર્ડે સર્વસંમતિથી વક્ક સુધારા બિલ ૨૦૨૪નો વિરોધ કર્યો હતો અને તેને મુસ્લિમ સમુદાય અને વક્ક સંસ્થાઓને નિશાન બનાવવાનું એક પૂર્વવર્તી પગલું ગણાયું હતું. તેલંગાણા વક્ક બોર્ડના સભ્યોમાંના એક એવા હેદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, "તેલંગાણા રાજ્ય વક્ક બોર્ડે ગેરબંધારણીય વક્ક સુધારા બિલ ૨૦૨૪નો વિરોધ કરનાર દેશનું પ્રથમ વક્ક બોર્ડ બન્યું છે. તેલંગાણાના મુખ્યમંત્રીને તેમના સમર્થન માટે આભાર માનવો જોઈએ." રાજ્ય વક્ક બોર્ડની બેઠક અધ્યક્ષ સૈયદ અઝમતુલ્લાહ હુસેનીની અધ્યક્ષતામાં મળી હતી અને ઓવૈસી સહિત સાત સભ્યોએ હાજરી આપી, વક્ક કાયદામાં સુધારાઓને નકારી કાઢવાનો ઠરાવ કર્યો. રાજ્ય બોર્ડે મુસ્લિમ સમુદાય અને વક્ક સંસ્થાઓને લક્ષ્ય બનાવવા માટેના એક પૂર્વવર્તી પગલા તરીકે બિલને નકારી કાઢ્યું હતું અને વિવાદાસ્પદ બિલ દ્વારા વિભાજનકારી એજન્ડાને આગળ ધપાવવાની નિંદા કરી હતી. ઠરાવમાં જણાવ્યું હતું કે, "તે બોર્ડ માટે સ્પષ્ટ છે કે સુધારા બિલ ચોક્કસ માનસિકતા સાથે તૈયાર કરવામાં આવ્યું છે અને તેનો ઉદ્દેશ વક્ક બોર્ડ અને વક્કની સંસ્થાની સ્વાયત્તતાને નષ્ટ કરવાનો છે અને વક્કને કલેક્ટરના સંપૂર્ણ નિયંત્રણ હેઠળ લાવીને દાવો કરવા માટે સ્વતંત્ર હશે અને કોઈપણ વક્ક મિલકતને સરકારી મિલકત તરીકે નિર્ધારિત કરી અને મુતવલ્લી (રક્કો)ને નિર્દેશો આપવા અને તેનું પાલન કરવું મુતવલ્લી માટે બંધનકર્તા રહેશે." ઠરાવમાં લખવામાં આવ્યું હતું કે, "બિલ વક્ક કાઉન્સિલ અને વક્ક બોર્ડના માળખાને નામાંકિત કરીને, અનિવાર્યપણે બિન-



મુસ્લિમ સભ્યોની રજૂઆત કરીને અને કાઉન્સિલ અને બોર્ડ માટે અવકાશ છોડીને આખરે બિન-મુસ્લિમ પ્રભુત્વ ધરાવતું બની જાય છે." રાજ્ય વક્ક બોર્ડે એ પણ નોંધ્યું છે કે આ બિલ સંઘીય શાસનના સિદ્ધાંતની વિરુદ્ધ છે કારણ કે તેનો ઉદ્દેશ વક્કના વહીવટમાંથી રાજ્ય સરકારની ભૂમિકાને બાકાત રાખવાનો છે અને નિયમ-નિર્માણની સત્તા અને ફોર્મટના પ્રિસ્ક્રિપ્શનને પણ કેન્દ્ર સરકાર દ્વારા હડપ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ખરડો ભારતના બંધારણની કલમ ૧૪, ૧૯, ૨૧, ૨૫ અને ૩૦૦-Aનું સીધું ઉલ્લંઘન છે કારણ કે તે ધર્મની સ્વતંત્રતા અને મિલકતના અધિકારમાં દખલ કરે છે, કારણ કે તે મુસ્લિમને તેની તેની પોતાની મિલકતનો વહીવટ કરવાથી પ્રતિબંધિત કરે છે સિવાય કે તે પાંચ વર્ષ માટે પ્રેક્ટિસ કરનાર મુસ્લિમ હોવાનું પ્રમાણિત ન કરે.

આદિત્યનાથ વડાપ્રધાન બનવા માંગે છે પરંતુ તેઓએ વિદેશ બાબતોના નિર્ણયોમાં દખલ ન કરવી જોઈએ : યોગી આદિત્યનાથની બાંગ્લાદેશ પરની ટિપ્પણી પર અખિલેશ યાદવનું નિવેદન

આગ્રામાં એક કાર્યક્રમમાં આદિત્યનાથે બાંગ્લાદેશમાં બનેલી 'ભૂલો ટાળવા' અને એકતાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો હતો



(એજન્સી) તા.૨૭ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની બાંગ્લાદેશ પરની ટિપ્પણી પર કટાક્ષ કરતાં, સપાના વડા અખિલેશ યાદવે કહ્યું છે કે તેઓ વડાપ્રધાન બનવા માંગે છે પરંતુ નવી દિલ્હી દ્વારા લેવામાં આવતા વિદેશી બાબતોના નિર્ણયોમાં તેઓએ હાલમાં દખલ ન કરવી જોઈએ. આગ્રામાં

આદિત્યનાથે કહ્યું હતું કે, તમે જોઈ રહ્યા છો કે, બાંગ્લાદેશમાં શું થઈ રહ્યું છે, એવી જ ભૂલો આપણા દેશમાં ન થવી જોઈએ. બટ્ટેંગે તો કટ્ટેંગે ઓર એક રહેંગે તો નેક રહેંગે ઓર સમૃદ્ધિ કી પરાકાષ્ટા પર પહુચેંગે

એક કાર્યક્રમમાં આદિત્યનાથે બાંગ્લાદેશમાં બનેલી 'ભૂલો ટાળવા' અને એકતાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, "આપ દેખ રહે હો બાંગ્લાદેશ મેં ક્યા હો રહા હે? વો ગલતીયાં યહાં નહીં હોની ચાહિયે. બટ્ટેંગે તો કટ્ટેંગે! એક રહેંગે તો નેક રહેંગે, સુરક્ષિત રહેંગે ઓર સમૃદ્ધિ કી પરાકાષ્ટા પર પહુચેંગે. (તમે જોઈ રહ્યા છો કે બાંગ્લાદેશમાં શું થઈ રહ્યું છે? તે ભૂલો અહીં ન થવી જોઈએ, જો વિભાજિત થઈશું, તો આપણે કપાઈ જઈશું, જો આપણે એક થઈશું, તો આપણે સુરક્ષિત રહીશું અને સમૃદ્ધિના શિખરે પહોંચીશું). જન્માષ્ટમી પર મીડિયાકર્મીઓ સાથેની વાતચીત દરમિયાન, સંઘર્ષગ્રસ્ત બાંગ્લાદેશ પર મુખ્યપ્રધાનની ટિપ્પણી વિશે પૂછવામાં આવ્યું ત્યારે યાદવે કહ્યું કે, આદિત્યનાથ વડાપ્રધાન બનવા માંગે છે પરંતુ ઓછામાં ઓછું તેમણે હાલમાં વડાપ્રધાનની ભૂમિકા ભજવવી જોઈએ નહીં. ભારત વિશ્વના કયા દેશ સાથે સંબંધો ઈચ્છે છે તે નક્કી કરવાનું કામ વડાપ્રધાનનું છે, ભારત સરકારનું કામ છે. આ પહેલેથીયે નથી જ્યારે મુખ્યમંત્રીએ આવું કંઈક કર્યું હોય. તેઓ ભૂતકાળમાં પણ આવું કરી ચૂક્યા છે. મને આશા છે કે 'દિલ્હી-વાલે' તેમને સમજાવશે કે તેમણે દિલ્હી દ્વારા લેવામાં આવતા નિર્ણયોમાં દખલ ન કરવી જોઈએ. સમાજવાદી પાર્ટી (એસપી) પ્રમુખે કહ્યું કે રાજકારણ આજે એવા તબક્કે પહોંચી ગયું છે કે દરેક પક્ષ જાતિ ગણતરીની વાત કરી રહ્યો છે. મને યાદ છે કે લોકસભામાં દક્ષિણ ભારતના સમાજવાદી પાર્ટીના નેતાઓ, લાલુપ્રસાદ યાદવજી, શરદ યાદવજી અને દક્ષિણ ભારતના ઘણા નેતાઓ જાતિ ગણતરીની

માંગ કરી રહ્યા છે. અને આજે સ્થિતિ એવી બની ગઈ છે કે દરેક પક્ષ જાતિની વસ્તી ગણતરી કરવા માંગે છે વિપક્ષી ઈન્ડિયા જૂથના નેતાએ જૂની પેન્શન યોજના અને જાતિની વસ્તી ગણતરીના મુદ્દાઓ પર ભારતીય જનતા પાર્ટી પર કટાક્ષ કર્યો હતો, અને આગાહી કરી હતી કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં બંને મુદ્દાઓ પર યુ-ટર્ન લેશે, હું આ પહેલેથીયે નથી કહી રહ્યો. એક વર્ષ પહેલા, મેં કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી પણ સ્વીકારશે અને જાતિ ગણતરી માટે આગળ આવશે. અગાઉ પણ, જાતિની વસ્તી ગણતરી કરવામાં આવી હતી પરંતુ તેનો ડેટા શેર કરવામાં આવ્યો ન હતો. હવે અમે આશા રાખીએ છીએ કે જાતિની વસ્તી ગણતરી પણ કરવામાં આવશે અને તેનો ડેટા શેર કરવામાં આવશે. તેઓએ રાજ્યમાં આગામી પેટાચૂંટણીઓમાં તેમની પાર્ટીને લોકોના સમર્થન વિશે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, આરએસએસ, જે યુપચાપ વ્યૂહરચના તૈયાર કરી રહ્યું છે, પણ જ્યારે જનતા અમારી સાથે હશે ત્યારે તેઓ ચુંકશે. સપાના વડાએ આરોપ લગાવ્યો કે બીજેપી નેતાનું બસપા નેતા પ્રત્યે જે પ્રકારનું વલણ પીડીએ પરિવારોએ સદીઓથી જોયું છે. અમે હંમેશા અમારો અવાજ ઉઠાવવાનું ચાલુ રાખીશું. મને તેમાં બીજેપીનું ધડયંત્ર પણ દેખાય છે. બીજેપી ઈચ્છતી નથી કે કોઈ અન્ય કોઈની સાથે જોડાણ કરે અને સત્ય એ છે કે ભાજપ પીડીએ પરિવારમાં ક્યારેય કોઈને સાચા અર્થમાં માન આપતું નથી. ઉલ્લેખનીય છે કે, માયાવતીનો પક્ષ બસપા સત્તાવાર રીતે બીજેપીની આગેવાની હેઠળના એનડીએ અથવા વિપક્ષી ઈન્ડિયા બ્લોક સાથે જોડાયેલ નથી.

પીએમ મોદીની યુકેનની મુલાકાત, બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષા અંગે અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેન સાથે ચર્ચા

નેતાઓએ યુકેનમાં ચાલી રહેલી પરિસ્થિતિ અને બાંગ્લાદેશમાં રાજકીય વાતાવરણ વિશે વાત કરી, જેમાં હિન્દુઓની સુરક્ષાનો સમાવેશ થાય છે

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૭ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે વાત કરી અને બાંગ્લાદેશ અને યુકેનની સ્થિતિ પર ચર્ચા કરી. નેતાઓએ યુકેનમાં ચાલી રહેલી પરિસ્થિતિ અને બાંગ્લાદેશમાં રાજકીય વાતાવરણ વિશે વાત કરી, જેમાં હિન્દુઓની સુરક્ષાનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ સોમવારે જણાવ્યું હતું કે, "મેં આજે રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે ફોન પર વાત કરી. અમે બાંગ્લાદેશની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી અને બાંગ્લાદેશમાં વહેલી તકે સામાન્યતાની પુનઃસ્થાપના અને લઘુમતીઓ, ખાસ કરીને હિંદુઓની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો." અને ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના પત્ની ઓગસ્ટે ઢાકામાંથી ભાગી ગયા બાદ પણ ખાસ કરીને હિંદુઓની હિંસાની ઘટનાઓ સતત બની રહી છે. મંદિરોમાં તોડફોડ કરવામાં આવી



છે, એક હિન્દુ કાઉન્સિલરની હત્યા કરવામાં આવી છે અને ઘણા (૧૦૦થી વધુ) શિક્ષકોને રાજીનામું આપવાની ફરજ પડી છે. હજુ પણ પરિસ્થિતિ યાજ્ઞ પડી નથી. ભારતીય અમેરિકન ધારાશાસ્ત્રીઓ દ્વારા બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો અંગે ચિંતા વ્યક્ત કરતા વિરોધ બાદ, વ્હાઈટ હાઉસે ૧૩મી ઓગસ્ટે કહ્યું હતું કે તે બાંગ્લાદેશની સ્થિતિ પર નજર રાખવાનું ચાલુ રાખશે. તેઓએ ભારતપૂર્વક જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ બાઈડેન માનવ અધિકારના મુદ્દાઓ પર મોટીથી અને સ્પષ્ટ બોલવામાં સુસંગત હતા. મોદીએ ભારત યુએસ

કોમ્પ્રિહેન્સિવ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ માટે બિડેનની પ્રતિબદ્ધતાની પણ પ્રશંસા કરી, જે લોકશાહી અને કાયદાના શાસન અને લોકો વચ્ચેના સંબંધોના સહિયારા મૂલ્યો પર આધારિત છે. બંને નેતાઓએ ક્વાડમાં સહકારને મજબૂત કરવાની પણ વાત કરી હતી. દરમિયાન પીએમ મોદીએ, જેઓ હમણાં જ યુકેનથી પાછા ફર્યા છે, તેમણે યુકેનના રાષ્ટ્રપતિ વોલોદોમિર ઝેલેન્સ્કીને કહ્યું હતું કે તેઓ શાંતિ અને રશિયા સાથેના સંઘર્ષના પહેલા ઉકેલ માટેના સંદેશ સાથે કિવ આવ્યા છે, જેને ભારત તમામ મદદ કરવા તૈયાર છે. તેણે તેના યુએસ સમકક્ષની પણ પ્રશંસા કરી. 'X' પરની એક પોસ્ટમાં, મોદીએ કોલમ્બી ફળશ્રુતિ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, "અમે યુકેનની સ્થિતિ સહિત વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિગતવાર મતવ્યોનું વિનિમય કર્યું હતું. મેં શાંતિ અને સ્થિરતા વહેલી તકે પરત ફરે તે માટે ભારતના સંપૂર્ણ સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો."

ટુડો સરકાર કેનેડામાં ઓછા વેતનના કામચલાઉ વિદેશી કામદારોમાં ઘટાડો કરશે

(એજન્સી) તા.૨૭ કોવિડ પછીની મજૂરોની તીવ્ર અછત દરમિયાન સરકારે પ્રતિબંધો હળવા કર્યા પછી કેનેડામાં વિદેશી કામદારોમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો. કેટલાક કેનેડિયન નિષ્ણાતો માને છે કે આ પગલાથી ઈમિગ્રેન્ડસ અને યુવાનોમાં બેરોજગારી વધી છે. કેનેડા ઓછા વેતનના વિદેશી કામદારોમાં ઘટાડો કરશે



રોકાણ કરવાનો સમય આવી ગયો છે." કોવિડ પછીની મજૂરોની તીવ્ર અછત દરમિયાન સરકારે પ્રતિબંધો હળવા કર્યા પછી કેનેડામાં વિદેશી કામદારોમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો. કેટલાક કેનેડિયન નિષ્ણાતો માને છે કે આ પગલાથી ઈમિગ્રેન્ડસ અને યુવાનોમાં બેરોજગારી વધી છે. મીડિયાના અહેવાલ મુજબ, ઉચ્ચ બેરોજગારીવાળા વિસ્તારોમાં નોકરીઢાતાઓ - જ્યાં બેરોજગારીનો દર છ ટકા કે તેથી વધુ છે - "પાઘ સુરક્ષા ક્ષેત્રો" માટે મર્યાદિત અપવાદો સાથે, ઓછા વેતનના અસ્થાયી વિદેશી કામદારો (TFW)ને નોકરી પર રાખી શકશે નહીં. જેમ કે કૂચ અને ખોરાક અને માછલીની પ્રક્રિયા તેમજ બાંધકામ અને આરોગ્ય સંભાળ જેવાં સ્ટાફની તીવ્ર તંગી હજુ પણ

છે. અહેવાલમાં જણાવ્યું છે કે, એમ્પ્લોયરોને હવે TFW પ્રોગ્રામ દ્વારા તેમના કુલ વર્કફોર્સના ૧૦ ટકાથી વધુ નોકરી પર રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કામચલાઉ વિદેશી કામદારોનો બે વર્ષનો કોન્ટ્રાક્ટ પણ ઘટાડીને એક વર્ષનો કરવામાં આવશે. એક સરકારી નિવેદન અનુસાર, TFW પ્રોગ્રામનો ઉપયોગ "કેનેડામાં પ્રતિભાશાળી કામદારોની ભરતીને અટકાવવા" માટે કરવામાં આવ્યો છે. રેન્ડી બોઈસોનોલ્ટ, રોજગાર, કાર્યબળ વિકાસ અને સત્તાવાર ભાષાઓના પ્રધાને જણાવ્યું હતું કે, "ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ થ્રમ બજારની અછતને દૂર કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો હતો જ્યારે લાયકાત ધરાવતા કેનેડિયનો તે ભૂમિકાઓ ભરવા માટે સક્ષમ ન હતા. અત્યારે, અમે જણીએ છીએ કે ઓપન પોલિશન્સ ભરવા માટે વધુ કેનેડિયનો લાયક છે. આજે અમે જે ફેરફારો કરી રહ્યા છીએ તે કેનેડિયન પ્રતિબદ્ધતાને પ્રાથમિકતા આપશે. અને સુનિશ્ચિત કરે છે કે કેનેડિયનો વિશ્વાસ કરી શકે છે કે પ્રોગ્રામ આપણા અર્થતંત્રની જરૂરિયાતોને પૂર્ણ કરે છે."

'ગોળીબાર કરવામાં આવશે, જાનહાનિ થવી જોઈએ': TMCએ ડોક્ટરના બળાત્કાર-હત્યા કેસ પર ૨૭ ઓગસ્ટના રોજ વિરોધ દરમિયાન હિંસા ભડકાવવાનું કાવતરું રચી રહેલા ભાજપના કથિત ગુંડાઓના વીડિયો શેર કર્યા

ટુડો સરકાર કેનેડામાં ઓછા વેતનના કામચલાઉ વિદેશી કામદારોમાં ઘટાડો કરશે

(એજન્સી) તા.૨૭ મમતા બેનરજીના પક્ષ ટીએમસીએ સોમવારે X પર વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં બે પુરુષો કથિત રીતે RG કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને હત્યા અંગે કોલકાતા નજીક ૨૭ ઓગસ્ટના રોજ 'નબન્ના અભિયાન' વિરોધ દરમિયાન હિંસા ભડકાવવાની વાત કરે છે. આ પોસ્ટમાં ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે આ વીડિયોમાં દેખાતા પુરુષો ભાજપના છે. આ આવાહનકર્તા વિડિયો સાથે આવ્યા છે જે આવતીકાલે નબાન્ના



TMCએ સોમવારે X પર વીડિયો પોસ્ટ કર્યો જેમાં ૨૭ ઓગસ્ટના રોજ કોલકાતા નજીક 'નબન્ના અભિયાન' વિરોધ દરમિયાન કથિત રીતે હિંસા ભડકાવવાની વાત કરતા બે માણસો દેખાય છે

અભિયાન પાછળ એક ભયાનક કાવતરું દર્શાવે છે. ભાજપે ન્યાયના બહાના હેઠળ હિંસાની રાજનીતિનો આશરો લીધો છે. સીબીઆઈને તપાસ ઝડપી કરવા કહેવાને બદલે, ભાજપ હિંસા કરવામાં વ્યસ્ત છે. પશ્ચિમબંગા છાત્ર સમાજ દ્વારા ૨૭ ઓગસ્ટના નબાન્ના અભિયાનનું એલાન આપવામાં આવ્યું છે. જે કે આ સંગઠન અરાજકીય હોવાનો દાવો કરે છે, ઘણા ભાજપના નેતાઓએ આ વિરોધને સમર્થન આપ્યું છે. આ વીડિયોમાં, બે અલગ-અલગ સ્થળોએ બે માણસો વિરોધ દરમિયાન હિંસા ભડકાવવા વિશે વાત કરતા જોઈ અને સાંભળી શકાય છે. તે કહે છે કે, તેનો અર્થ શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનો નથી. તેમાં ગોળીબાર કરવામાં આવશે. રબરની ગોળીઓ ચલાવવામાં આવશે. એક અન્ય વ્યક્તિ કહે છે કે, મને નથી લાગતું કે તેઓ રબરની ગોળીઓ ચલાવશે. અન્ય વ્યક્તિ કહે છે કે, ના વિરોધીઓ તેમને રબરની ગોળીઓ ચલાવવા માટે ઉશ્કેરશે, આની પાછળ એક મોટું રાજકીય કાવતરું છે. ચાલો રાહ જોઈએ કે શું થાય છે. તમે સામાન્ય રીતે રાજકારણ ન કરી શકો. જો કોઈ જાનહાનિ ન થાય, તો તે બધું નિરર્થક છે. અમને વિશ્વાસ છે કે ૨૭ ઓગસ્ટે જાનહાનિ થશે. ૨ મિનિટ ૧૧ સેકન્ડનો વિડિયો એ પછી બીજું દ્રશ્ય બતાવે છે જ્યાં એક માણસને વાત કરતા સાંભળવામાં આવે છે કે કેવી રીતે ૨૭ ઓગસ્ટના રોજ કોઈ જાનહાનિ ન થાય તો આ વિરોધનો આખો

હેતુ નાશ પામશે. આ વીડિયોમાં દેખાતો વ્યક્તિ સ્વીકારે છે કે એવું વાતાવરણ ઊભું કરવાની જરૂર છે જે હિંસા અને જાનહાનિ તરફ દોરી જાય. દરમિયાન, ડાબેરી પક્ષોએ આ વિરોધ કૂચથી પોતાને દૂર રાખ્યા છે અને તેને લોકોની ચળવળને વિચલિત કરવા માટે ભાજપ-આરએસએસનું ધડયંત્ર ગણાવી ગેજેટ્યુએટ ટ્રેઈનીંગ ડોક્ટરની બળાત્કાર-હત્યા અંગે મમતા બેનરજીના રાજનામાની માંગણીને ગેરકાયદેસર અને અશાંતિ ભડકાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. એક કોલકાતાના નેતાએ જણાવ્યું હતું કે ડોક્ટરની બળાત્કાર-હત્યાની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને ટ્રાન્સફર કરવામાં આવી છે અને CMના કોઈ જાનહાનિ માંગેને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને ફગાવી દીધી છે. આ રેલી માટેનો કોલ છાત્ર સમાજ દ્વારા સોશિયલ મીડિયા પર આપવામાં આવ્યું છે, જેણે પોલીસને તેમની યોજના વિશે જાણ કરી નથી. અમે બધા પીડિતા માટે ન્યાય અને ગુનેગારોને અનુકરણીય સજા ઈચ્છીએ છીએ. આ કેસ સીબીઆઈ અને પોલીસને સાંપવામાં

બદલાપુર કેસ : "છેલ્લા ૧૫ દિવસના સીસીટીવી ફૂટેજ ગુમ" : શિક્ષણમંત્રી દીપક કેસરકરનો ધડાકો

(એજન્સી) મુંબઈ, તા. ૨૭ મહારાષ્ટ્રના બદલાપુરના માસૂમ બાળા દુષ્કર્મના કેસમાં નવો જ વળાંક આવ્યો છે અને રાજ્યના શિક્ષણ મંત્રી દીપક કેસરકરે ધડાકો કર્યો છે કે, એ શાળાના છેલ્લા ૧૫ દિવસના સીસીટીવી ફૂટેજ ગુમ થઈ ગયા છે. શાળાની ટોઈલેટ બહાર પણ સીસીટીવી લગાડવામાં ન આવ્યાનું માલુમ પડ્યું છે. બદલાપુરની એક શાળામાં સફાઈ કામદારે શાળાની ટોઈલેટમાં લઈ જઈને ચાર વર્ષની બે માસૂમ બાળા પર દુષ્કર્મ આચર્યું હતું જાહેર થયું હતું. ગઈ ૧૭ ઓગસ્ટે આરોપી અક્ષય શિંદે (૨૩)ની ધરપકડ કરી લેવાઈ હતી અને ૧૪ દિવસની અદાલતની કસ્ટડીને હવાલે કરવામાં આવ્યો હતો. મંત્રીએ જણાવ્યું હતું કે દરેક શાળાઓ અને હોસ્ટેલમાં પેનિક બટન લગાડવાની જરૂર છે. જ્યારે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ તથા શિક્ષણ મંત્રાલયની સમિતિએ તેનો અહેવાલ રજૂ કર્યો ત્યારે મંત્રીએ આવું સુચન કર્યું હતું. મંત્રી આ માહિતીના પગલે વિરોધ પક્ષો



ઉડગળી ઉઠ્યા છે. શિવસેના (ઉધવ)ના એમપી પ્રિયંકા ચતુરવેદીએ જણાવ્યું હતું કે, ધારણા મુજબ જ બદલાપુરની શાળાના એ દિવસના જ સીસીટીવી ફૂટેજ ગુમ થઈ ગયા છે. આવી અપરાધખોરી કરનાર શાળાને કઈ રીતે છોડી દેવાય? આમ આ જૂદી સરકાર આવી જ છે.

વિશ્વભરમાં મુસ્લિમ તથા અન્ય સમાજમાં આદરભર્યું સ્થાન ધરાવનાર ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર (સ.અ.વ.) સાહેબની શાનમાં ગુસ્તાખી કરનાર કટ્ટરવાદી રામગીરીની ધરપકડની માંગ

આમોદના મુસ્લિમ સમાજ દ્વારા આમોદ મામલતદાર તથા આમોદ પોલીસ સ્ટેશનના પીઆઈને આવેદન પાઠવી કટ્ટરવાદી સામે કડક કાર્યવાહી કરી ધરપકડની માંગ કરાઈ

આમોદ, તા.૨૭

સંભાજનગરમાં કટ્ટરવાદી રામગીરી મહારાજે ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર (સ.અ.વ.) સાહેબની શાનમાં ગુસ્તાખી કરતા તેના સમગ્ર ભારત તથા વિશ્વભરના મુસ્લિમોમાં ઘેરા પડઘા અને પ્રત્યાઘાત પડ્યા છે. જેમાં રોજરોજ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જેમાં આમોદના મુસ્લિમ સમાજ દ્વારા મામલતદાર તથા આમોદ પોલીસ સ્ટેશનના પીઆઈને આવેદન પાઠવી તેની સામે કડક કાયદાકીય પગલા ભરી ધરપકડ કરવાની માંગ કરી છે.



તાજેતરમાં મહારાષ્ટ્રમાં એક કીર્તનસભા દરમ્યાન રામગીરી મહારાજે ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર હજરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબની શાનમાં અભદ્ર ટિપ્પણી કરી અશોભનીય ધાર્મિક લાગણી દુભાવતા મુસ્લિમ સમાજમાં પ્રચંડ રોષની લાગણી ફેલાઈ જવા પામી છે અને ચોમેરથી વિરોધનો લાવા ફાટી નીકળ્યો છે. સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શનો કરી રેલી કાઢી જે તે સ્થાનિક તંત્રની કચેરીમાં આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે. અને કટ્ટરવાદી રામગીરી સામે ભારતના સંવિધાનની કલમો મુજબ ગુનો નોંધી કડક કાર્યવાહી કરી ધરપકડ કરવાની માંગ ચોમેરથી ઉઠવા પામી છે. વિશ્વના તમામ ધર્મોમાં સન્માનીય સ્થાન ધરાવનાર આપનાર અને પ્રાણથી પ્યારા મુસ્લિમ સમાજના પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) સાહેબની શાનમાં ગુસ્તાખી કરી દેશની એકતા અને અખંડિતતા તોડવાનો હીન પ્રયાસ કર્યો છે. આવા કટ્ટરવાદી તથા દેશમાં કોમી

બોરસદ પંથકમાં ૧૨ ઈંચ વરસાદથી ઠેર-ઠેર જળબંબાકાર : અનેક લોકોને સલામત સ્થળે ખસેડાયા

ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી, તમામ તળાવો ઓવરફ્લો, અનેક માર્ગો બંધ : લોકોના મકાનોમાં પાણી ઘૂસી જતાં ધરવખરીને ભારે નુકસાન (સંવાદદાતા દ્વારા)

આણંદ, તા. ૨૭
આણંદ જિલ્લાનાં બોરસદ શહેર સહિત તેમજ તાલુકામાં બે દિવસ દરમિયાન ૧૨ ઈંચથી વધુ વરસાદ ખાબકતા ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ભારે પવન સાથે વરસાદ ખાબકતા ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બનવા પામી છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. લોકોના ઘરોમાં બોરસદ શહેરમાં વન તળાવ, માંજરા તળાવ, બાટલા તળાવ, કુરઈ તળાવ, વાસણ તળાવમાં ભારે વરસાદને લઈ પાણીનો પ્રવાહ વધતા આ તમામ તળાવો ઓવરફ્લો થઈ જતાં તળાવોની આસપાસ આવેલ વિસ્તારોમાં પાણી ઘૂસી જતા આજુબાજુમાં રહેતા લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. તેમજ તળાવો ઓવરફ્લો થતા પાસેથી પસાર થતા માર્ગો પર પણ પાણી ફરી વળતા માર્ગો પણ બંધ કરવામાં આવ્યા છે. વન તળાવ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાની સાથે જ સ્થાનિક રહીશોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા તેમજ માર્ગ ઉપર પણ કેડસમાણાં પાણી ભરાઈ જતા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. તેમજ પામોલ રોડ ઉપર આવેલ અશ્વ નગર વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતા ટ્રેક્ટરોમાં બેસાડીને સ્થાનિકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.



બોરસદ તાલુકાના સીસવા ગામે અવિરત મેઘમહેરને લઈ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ગામના બસ સ્ટેન્ડથી ગામમાં પ્રવેશવાના માર્ગ ઉપર કેડસમાણાં પાણી ભરાઈ ગયા જવા પામી હતી. બોરસદ આવાસ-અભ્યાર્ણ માર્ગ, બોરસદ પામોલ માર્ગ, બોરસદ નાવડ માર્ગ, બોરસદ ભાદરણ માર્ગ ઉપર ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થતા માર્ગો બંધ થઈ જવા પામી હતી. બોરસદ નીસરાયા-અભ્યાર્ણ માર્ગ, બોરસદ રાસ માર્ગ, બોરસદ આણંદ માર્ગ, બોરસદ પામોલ માર્ગ, બોરસદ નાવડ માર્ગ, બોરસદ ભાદરણ માર્ગ ઉપર ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થતા માર્ગો બંધ થઈ જવા પામી હતી.

બોરસદ તાલુકાના રાસ ગામે ૧૫૦૦ વીધામાં ખેડૂતો દ્વારા ડાંગરની વાવણી કરવામાં આવી હતી. જેમાં વરસાદી પાણી ભરાઈ જતા સમગ્ર ચારી જાણે કે દરિયો હોય તેવા દશ્યો જોવા મળ્યા હતા. ડાંગરની રોપણી કરેલ ખેતરોમાં ઘૂંટણસમાણાં પાણી ભરાઈ જતા ડાંગરનો પાક પાણીમાં ડૂબી ગયો હતો અને સમગ્ર પાક નિષ્ફળ જતા ખેડૂતોને લાખો રૂપિયાનો નુકસાન વેઠવાનો

સુરત : પોલીસ હેડક્વાર્ટરમાંથી ભાગી ગયેલ ચાર બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ

(સંવાદદાતા દ્વારા)
સુરત, તા. ૨૭
સુરતના ઘણી પોલીસ હેડ ક્વાર્ટરમાં નજરકેદ રખાયેલ ૪ બાંગ્લાદેશી મહિલાઓ ફરાર થઈ ગઈ હતી ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં આ મહિલાઓને ઝડપી પડી હતી. પાસપોર્ટ વિના આ ચારેય મહિલાઓ રહેતી હતી જેના કારણે પોલીસે આ મહિલાઓને નજર કેદ રાખી હતી. સુરત ગ્રામ્ય વિસ્તારમાં

આવેલ ઘણી પોલીસ હેડ ક્વાર્ટરમાં ચાર મહિલાઓને નજરકેદ રાખવામાં આવી હતી. પરંતુ પોલીસ ના હોય ત્યારે આ ચારેય મહિલાઓ નજરકેદમાંથી ફરાર થતા પોલીસ દોડતી થઈ હતી. મહિલાઓ સુરત છોડે તે પહેલા તેને ઝડપી લેવામાં આવી હતી, પરંતુ આ રીતે મહિલાઓ ફરાર થાય છે તો પોલીસ શું કરતી હતી. તેના પર પણ સવાલો ઊભા થયા છે.

ધાર્મિક કાર્યક્રમ જૂનાગઢ મસ્જિદે રજામાં આલા હજરતના ઉર્સ શરીફ નિમિત્તે જલ્સાનું આયોજન

જૂનાગઢ ખાનકાહે રજાવિધ્યાહ નૂરીવ્યાહ દ્વારા મર્કેડે એલેક્સ સુન્નાત, મસ્જિદે રજામાં આ'લા હજરત, ફાજીલે બરેલવી રટીઅલ્લાહી તા'આલા અન્નોના ૧૦૬માં ઉર્સ શરીફ નિમિત્તે તેમને ખિરાજે અકિદત પેશ કરવા તા.૩૦-૮-૨૦૨૪ શુક્રવારે રાત્રે જીશાની નમાઝ બાદ ખત્મે કાદરીયાહ શરીફ, નાત શરીફ તેમજ સલાતો સલામની રૂહાની મહેફીલ થશે તથા તા.૩૧-૮-૨૦૨૪ શનિવારે બપોરે ૧થી ૩ વાગ્યા સુધી મર્કેડે એલેક્સ સુન્નાત, મસ્જિદે રજામાં

ભારે વરસાદને પગલે દ.ગુ.નો રેલ વ્યવહાર ખોરવાયો : મુસાફરો અટવાયા

(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૨૭
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી સતત ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે નદીને અડીને આવેલા નીચાણવાળા વિસ્તારોએ પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. પાસ કરીને નવસારી અને આસપાસના વિસ્તારોમાં પૂરની સ્થિતિ ગંભીર બની ગઈ છે, જેના કારણે પરિવહન વ્યવસ્થામાં મોટો ખલેલ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાત તરફ આવતી અને અહીંથી જતી ટ્રેનો રાતથી મોડી પડી છે લાંબા અને ટૂંકા અંતરની કેટલીક ટ્રેનોને રદ અથવા પૂર્ન ટર્મિનેટ કરવામાં આવી છે. શુદ્ધ કારણે, દક્ષિણ ગુજરાત તરફ આવતી અને ત્યાંથી જતા ટ્રેનોને રદ કરવાની ફરજ પડી છે અથવા મોટાભાગની ટ્રેનોમાં ઘણી મોડી થવા લાગી છે. નવસારી રેલવે સ્ટેશન પર અનેક મુસાફરો મોડી રાતથી સવાર સુધી અટવાયા હતા છે. આ પરિસ્થિતિમાં મુસાફરો કરવી મુશ્કેલ બની છે. લાંબા અંતરની ટ્રેનોને પાસ કરીને પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને રદ કરવામાં આવી છે. આથી, દૈનિક અપગ્રાઉન કરતા ઘણા મુસાફરોને સુરત અને વાપી જેવા શહેરોમાં પહોંચવા માટે અન્ય વિકલ્પો શોધવા પડ્યા છે, જેમ કે બસ સેવા અથવા આનગી વાહનવ્યવહાર, સરકાર અને રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને સલામત રીતે તેમના ગંતવ્ય પર પહોંચાડવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા મુસાફરોને હાલની પરિસ્થિતિને લગતી માહિતી સમસર આપવા અને અનુકૂળ પરિવહન સેવા પુરી પાડવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટના પગલે ડીસા પાલિકા પ્રમુખ સહિત ટીમો ખડેપગે



(તસવીર : જમીલ મેમણ, ડીસા)
(સંવાદદાતા દ્વારા) ડીસા, તા. ૨૭
આગામી ૨૫થી ૩૦ ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં પણ ગાજવીજ સાથે ભારે પવન ફુંકાવાની અને ભારે વરસાદ થવાની સંભાવનાને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સતર્ક અને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે સાથે વહીવટી તંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેના પગલે ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દેવે દ્વારા સેનિટેશન વિભાગના અધિકારીઓ અને

નર્મદા નદીની ભયાનક સપાટીને લઈ ભરૂચ-અંકલેશ્વરના કાંઠાના ગામોને એલર્ટ

(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા. ૨૭
નર્મદા નદી ભરૂચ નજીક ભયજનક સપાટીથી બે ફૂટ ઉપર વહી રહી છે. તંત્ર આગમ્યેતીના તમામ પગલાં ભરી સજજ થઈ રહ્યું છે. ભરૂચ નગરપાલિકા દ્વારા કંટોલરૂમ શરૂ કરાયો છે તેમજ ૨૦૦ જેટલાં લોકોનું સ્થળાંતર કરી સલામત સ્થળે આશ્રય અપાયો છે. નર્મદા ૩૦ મંચી છોડવામાં આવી રહેલ સાડા ત્રણ લાખ ક્યુસેક પાણીના કારણે ભરૂચ ખાતે નર્મદા નદી ગોલ્ડન બ્રિજ પર ૨૪ ફૂટ ભયજનક સપાટીથી બે ફૂટ ઉપર ૨૬ ફૂટે વહી રહી છે ભરૂચ અંકલેશ્વરના કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. જેના પગલે વહીવટી

હથનુર ડેમના ૧૨ દરવાજા ખોલાયા

(સંવાદદાતા દ્વારા)
સુરત, તા. ૨૭
આજે સવારે સુરતના વિસ્તારમાં આવેલા ભગવાન મહાવીર કોલેજ પાસે પાણી ભરાયા હતા. આ તરફ મકાઈ પુલ નાવડી ઓવારની લગોલગ પાણી પહોંચી ગયા છે. જો કે બપોરના બે વાગ્યા સુધીમાં ડેમમાંથી પાણી છોડવાની માત્ર ઘટાડામાં આવી છે. હાલ ઉકાઈમાંથી ૨.૪૩ લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં આવેલ હથનુર ડેમનાં કેચમેન્ટ વિસ્તારમાં સતત સાંબેલાવાર વરસાદને પગલે ડેમની સપાટીને જળવી રાખવા માટે તંત્ર દ્વારા આજે સવારે ડેમના તમામ ૧૨ દરવાજા પુરેપુરા ખોલી દેવામાં આવ્યા છે. હાલમાં હથનુર ડેમમાંથી ૫૦ હજાર ક્યુસેક પાણી ઉકાઈમાં છોડવામાં આવી રહ્યું છે અને જેની સીધી અસર ઉકાઈ ડેમની સપાટી પર જોવા મળી રહી છે. હાલ બપોરના બે વાગ્યા સુધી ઉકાઈમાંથી પાણી છોડવાની માત્રમાં અંશત ઘટાડામાં આવ્યો છે, ઉકાઈમાંથી ૨.૪૩,૮૪૦ ક્યુસેક પાણી ૧.૮૦,૪૭૧ ક્યુસેક થઈ ગઈ છે. ઉકાઈની સપાટી ઘટીને ૨૩૬.૨૬ ફૂટ પહોંચી છે. આ ઉપરાંત સુરતીઓને ભારે મહિના પીવાનું પાણી પુરું પાડતાં કોલવેની સપાટી સિઝનમાં પહેલી વખત ૧૦.૦૨ મીટરને પાર પહોંચી છે. હાલમાં કોલવે ૧૦.૦૨

હથનુર ડેમના ૧૨ દરવાજા ખોલાયા
સુરતના વિસ્તારમાં આવેલા ભગવાન મહાવીર કોલેજ પાસે પાણી ભરાયા હતા. આ તરફ મકાઈ પુલ નાવડી ઓવારની લગોલગ પાણી પહોંચી ગયા છે. જો કે બપોરના બે વાગ્યા સુધીમાં ડેમમાંથી પાણી છોડવાની માત્ર ઘટાડામાં આવી છે. હાલ ઉકાઈમાંથી ૨.૪૩ લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં આવેલ હથનુર ડેમનાં કેચમેન્ટ વિસ્તારમાં સતત સાંબેલાવાર વરસાદને પગલે ડેમની સપાટીને જળવી રાખવા માટે તંત્ર દ્વારા આજે સવારે ડેમના તમામ ૧૨ દરવાજા પુરેપુરા ખોલી દેવામાં આવ્યા છે. હાલમાં હથનુર ડેમમાંથી ૫૦ હજાર ક્યુસેક પાણી ઉકાઈમાં છોડવામાં આવી રહ્યું છે અને જેની સીધી અસર ઉકાઈ ડેમની સપાટી પર જોવા મળી રહી છે. હાલ બપોરના બે વાગ્યા સુધી ઉકાઈમાંથી પાણી છોડવાની માત્રમાં અંશત ઘટાડામાં આવ્યો છે, ઉકાઈમાંથી ૨.૪૩,૮૪૦ ક્યુસેક પાણી ૧.૮૦,૪૭૧ ક્યુસેક થઈ ગઈ છે. ઉકાઈની સપાટી ઘટીને ૨૩૬.૨૬ ફૂટ પહોંચી છે. આ ઉપરાંત સુરતીઓને ભારે મહિના પીવાનું પાણી પુરું પાડતાં કોલવેની સપાટી સિઝનમાં પહેલી વખત ૧૦.૦૨ મીટરને પાર પહોંચી છે. હાલમાં કોલવે ૧૦.૦૨

હથનુર ડેમના ૧૨ દરવાજા ખોલાયા
સુરતના વિસ્તારમાં આવેલા ભગવાન મહાવીર કોલેજ પાસે પાણી ભરાયા હતા. આ તરફ મકાઈ પુલ નાવડી ઓવારની લગોલગ પાણી પહોંચી ગયા છે. જો કે બપોરના બે વાગ્યા સુધીમાં ડેમમાંથી પાણી છોડવાની માત્ર ઘટાડામાં આવી છે. હાલ ઉકાઈમાંથી ૨.૪૩ લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં આવેલ હથનુર ડેમનાં કેચમેન્ટ વિસ્તારમાં સતત સાંબેલાવાર વરસાદને પગલે ડેમની સપાટીને જળવી રાખવા માટે તંત્ર દ્વારા આજે સવારે ડેમના તમામ ૧૨ દરવાજા પુરેપુરા ખોલી દેવામાં આવ્યા છે. હાલમાં હથનુર ડેમમાંથી ૫૦ હજાર ક્યુસેક પાણી ઉકાઈમાં છોડવામાં આવી રહ્યું છે અને જેની સીધી અસર ઉકાઈ ડેમની સપાટી પર જોવા મળી રહી છે. હાલ બપોરના બે વાગ્યા સુધી ઉકાઈમાંથી પાણી છોડવાની માત્રમાં અંશત ઘટાડામાં આવ્યો છે, ઉકાઈમાંથી ૨.૪૩,૮૪૦ ક્યુસેક પાણી ૧.૮૦,૪૭૧ ક્યુસેક થઈ ગઈ છે. ઉકાઈની સપાટી ઘટીને ૨૩૬.૨૬ ફૂટ પહોંચી છે. આ ઉપરાંત સુરતીઓને ભારે મહિના પીવાનું પાણી પુરું પાડતાં કોલવેની સપાટી સિઝનમાં પહેલી વખત ૧૦.૦૨ મીટરને પાર પહોંચી છે. હાલમાં કોલવે ૧૦.૦૨

હથનુર ડેમના ૧૨ દરવાજા ખોલાયા
સુરતના વિસ્તારમાં આવેલા ભગવાન મહાવીર કોલેજ પાસે પાણી ભરાયા હતા. આ તરફ મકાઈ પુલ નાવડી ઓવારની લગોલગ પાણી પહોંચી ગયા છે. જો કે બપોરના બે વાગ્યા સુધીમાં ડેમમાંથી પાણી છોડવાની માત્ર ઘટાડામાં આવી છે. હાલ ઉકાઈમાંથી ૨.૪૩ લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં આવેલ હથનુર ડેમનાં કેચમેન્ટ વિસ્તારમાં સતત સાંબેલાવાર વરસાદને પગલે ડેમની સપાટીને જળવી રાખવા માટે તંત્ર દ્વારા આજે સવારે ડેમના તમામ ૧૨ દરવાજા પુરેપુરા ખોલી દેવામાં આવ્યા છે. હાલમાં હથનુર ડેમમાંથી ૫૦ હજાર ક્યુસેક પાણી ઉકાઈમાં છોડવામાં આવી રહ્યું છે અને જેની સીધી અસર ઉકાઈ ડેમની સપાટી પર જોવા મળી રહી છે. હાલ બપોરના બે વાગ્યા સુધી ઉકાઈમાંથી પાણી છોડવાની માત્રમાં અંશત ઘટાડામાં આવ્યો છે, ઉકાઈમાંથી ૨.૪૩,૮૪૦ ક્યુસેક પાણી ૧.૮૦,૪૭૧ ક્યુસેક થઈ ગઈ છે. ઉકાઈની સપાટી ઘટીને ૨૩૬.૨૬ ફૂટ પહોંચી છે. આ ઉપરાંત સુરતીઓને ભારે મહિના પીવાનું પાણી પુરું પાડતાં કોલવેની સપાટી સિઝનમાં પહેલી વખત ૧૦.૦૨ મીટરને પાર પહોંચી છે. હાલમાં કોલવે ૧૦.૦૨

પયગમ્બર હજરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબની શાનમાં ગુસ્તાખી કરનાર મહારાષ્ટ્રના કટ્ટરવાદી રામગીરી મહારાજ સામે કડક કાર્યવાહી કરી ધરપકડની માંગ

હિંમતનગર શહેરના મુસ્લિમ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પોલીસ વડાને આવેદન પાઠવી કટ્ટરવાદીની ધરપકડની માંગ કરાઈ

હિંમતનગર, તા. ૨૭
હિંમતનગર શહેરના મુસ્લિમ સમાજના નેજા હેઠળ મુસ્લિમ સમાજના આગેવાનો પટ્ટણી સુન્ની જમાત, અશરફનગર કરુબા જમાત, મુસ્લિમ વેલ્ફેર સોસાયટી તેમજ દાડૂલ ઉલુમ હસનીયાના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને તથા જિલ્લા પોલીસ અધિકારીને આવેદનપત્ર આપી પયગમ્બર હજરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબના વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી સમગ્ર મુહમ્મદ (સ.અ.વ.) સાહેબની શાનમાં અભદ્ર ટિપ્પણીઓ કરી ગુસ્તાખી કરી સમગ્ર મુસ્લિમ સમુદાયની લાગણીને ઠેસ પહોંચાડી છે. પયગમ્બર સાહેબે સમગ્ર વિશ્વને અમન, શાંતિ અને ભાઈચારાનો પયગામ આપ્યો એવા પયગમ્બર સાહેબ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરાણે અન્ય ધર્મ સાથે નફરત વધે, લાગણીઓ દુભાય તેવું ન બને.



હિંમતનગર શહેરના મુસ્લિમ સમાજના નેજા હેઠળ મુસ્લિમ સમાજના આગેવાનો પટ્ટણી સુન્ની જમાત, અશરફનગર કરુબા જમાત, મુસ્લિમ વેલ્ફેર સોસાયટી તેમજ દાડૂલ ઉલુમ હસનીયાના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને તથા જિલ્લા પોલીસ અધિકારીને આવેદનપત્ર આપી પયગમ્બર હજરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબના વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી સમગ્ર મુહમ્મદ (સ.અ.વ.) સાહેબની શાનમાં અભદ્ર ટિપ્પણીઓ કરી ગુસ્તાખી કરી સમગ્ર મુસ્લિમ સમુદાયની લાગણીને ઠેસ પહોંચાડી છે. પયગમ્બર સાહેબે સમગ્ર વિશ્વને અમન, શાંતિ અને ભાઈચારાનો પયગામ આપ્યો એવા પયગમ્બર સાહેબ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરાણે અન્ય ધર્મ સાથે નફરત વધે, લાગણીઓ દુભાય તેવું ન બને.

શેઢી તથા વાત્રક નદીમાં આવેલ પૂરના પાણી ખેડાના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા જનજીવન પ્રભાવિત : અનેક લોકોનું સ્થળાંતર

સોષણ ગામના નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા : રતનપુરનું તળાવ ઓવરફ્લો

ખેડા, તા. ૨૭
ખેડા તથા આસપાસના વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદથી સમગ્ર જનજીવન પ્રભાવિત થઈ ગયું છે. ખેડા શહેર તથા આસપાસના વિસ્તારમાં છેલ્લા બે દિવસથી શેઢી તથા વાત્રક નદીમાં પૂર આવ્યાનું જોવા મળે છે. શેઢી નદીના પાણી નીચાણવાળા વિસ્તારમાં શા.લી.મા.૨૦૧૨, ઈન્દિરાનગર, વાસવાડા વિસ્તાર, મચ્છી માંડેડ, આમેના પાર્ક, બસ સ્ટેન્ડ, અંબિકાનગરના ગ્રાઉન્ડ ફ્લોરમાં સહિત અનેક વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. શેઢી તથા વાત્રક નદીના પાણીને જોવા માનવ મહરમણ ઉમટી પડયો ખેડા મુખ્ય બજારની ડુકાનોના માલસામાન સલામત સ્થળે ખસેડવાનું કાર્ય વેપારીઓ કરી

શેઢી તથા વાત્રક નદીમાં આવેલ પૂરના પાણી ખેડાના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા જનજીવન પ્રભાવિત : અનેક લોકોનું સ્થળાંતર
ખેડા, તા. ૨૭
ખેડા તથા આસપાસના વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદથી સમગ્ર જનજીવન પ્રભાવિત થઈ ગયું છે. ખેડા શહેર તથા આસપાસના વિસ્તારમાં છેલ્લા બે દિવસથી શેઢી તથા વાત્રક નદીમાં પૂર આવ્યાનું જોવા મળે છે. શેઢી નદીના પાણી નીચાણવાળા વિસ્તારમાં શા.લી.મા.૨૦૧૨, ઈન્દિરાનગર, વાસવાડા વિસ્તાર, મચ્છી માંડેડ, આમેના પાર્ક, બસ સ્ટેન્ડ, અંબિકાનગરના ગ્રાઉન્ડ ફ્લોરમાં સહિત અનેક વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. શેઢી તથા વાત્રક નદીના પાણીને જોવા માનવ મહરમણ ઉમટી પડયો ખેડા મુખ્ય બજારની ડુકાનોના માલસામાન સલામત સ્થળે ખસેડવાનું કાર્ય વેપારીઓ કરી

શેઢી તથા વાત્રક નદીમાં આવેલ પૂરના પાણી ખેડાના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા જનજીવન પ્રભાવિત : અનેક લોકોનું સ્થળાંતર
ખેડા, તા. ૨૭
ખેડા તથા આસપાસના વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદથી સમગ્ર જનજીવન પ્રભાવિત થઈ ગયું છે. ખેડા શહેર તથા આસપાસના વિસ્તારમાં છેલ્લા બે દિવસથી શેઢી તથા વાત્રક નદીમાં પૂર આવ્યાનું જોવા મળે છે. શેઢી નદીના પાણી નીચાણવાળા વિસ્તારમાં શા.લી.મા.૨૦૧૨, ઈન્દિરાનગર, વાસવાડા વિસ્તાર, મચ્છી માંડેડ, આમેના પાર્ક, બસ સ્ટેન્ડ, અંબિકાનગરના ગ્રાઉન્ડ ફ્લોરમાં સહિત અનેક વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. શેઢી તથા વાત્રક નદીના પાણીને જોવા માનવ મહરમણ ઉમટી પડયો ખેડા મુખ્ય બજારની ડુકાનોના માલસામાન સલામત સ્થળે ખસેડવાનું કાર્ય વેપારીઓ કરી

અભિષેક બેનરજીની સગીર પુત્રી પર બાળાત્કારની કર હોસ્પિટલ દેખાવો દરમ્યાન અપાયેલી ધમકીની તપાસ માગતું પશ્ચિમ બંગાળ બાળ સુરક્ષા પંચ વિરોધ રેલીમાં એક શખ્સ આવી ધમકી આપતો અને બાળાત્કાર કરનારને રૂા.૧૦ કરોડનું ઈનામ જાહેર કરતો વીડિયો વાયરલ થતાં બળભળાટ

(એજન્સી) કોલકાતા, તા. ૨૭ આરજી કર હોસ્પિટલની ઘટનાના વિરોધ પ્રદર્શન દરમ્યાન ટીએમસીના મહામંત્રી અને ટીઆરપી નેતા અભિષેક બેનરજીની સગીર દીકરી પર બાળાત્કારની ધમકી આપતો અને આતુ કામ કરે અને રૂા.૧૦ કરોડનું ઈનામ જાહેર કરતો એક શખ્સનો વીડિયો વાયરલ થતાં જ પશ્ચિમ બંગાળ બાળ સુરક્ષા પંચ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને સંચાન લીધું છે અને પોલીસ તાત્કાલિક પગલાં લે તેનો અનુરોધ કર્યો છે. પંચે એવો દાવો કર્યો છે કે, વિરોધ રેલી દરમ્યાન એક શખ્સ બાળાત્કારની ધમકી આપતો અને તેના માટે ઈનામ જાહેર કરતો વીડિયોમાં દેખાવ્યો છે એ વ્યક્તિની સ્વતંત્ર રીતે ઓળખ થઈ નથી પણ આ માણસ ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના મિનાપાન તાલુકામાં મન્યા ગામનો રહેવાસી હોવાનું કહેવાય છે. પંચ જણાવે છે



કે, ડોક્ટરની હત્યાથી આખા રાજ્યમાં શોક ખેલાયો છે પણ બદલો લેવા માટે બાળાત્કાર કરવાની ધમકી આપવી એ દેખીતી રીતે કાયદાનો ભંગ છે અને જો શિક્ષાત્મક પગલાં નહીં લેવાય તો સમાજમાં એક ભયજનક સંદેશ જશે આવી ધમકીઓથી માત્ર આ બાળા નહીં પણ દરેક માસુમ દીકરી ભયમાં મુકાશે. બાળ અધિકાર સુરક્ષા પંચે અપરાધીઓને

તાત્કાલિક પકડી લેવા અને અભિષેક બેનરજીની દીકરીને પુરતી સુરક્ષા આપવા પોલીસને અનુરોધ કર્યો હતો. પંચે બસીર હાટના એસપીને પણ પત્ર લખ્યો છે જેમાં પંચના ચેરપર્સન સુલીકા દાસે પત્ર મળ્યાના બે દિવસમાદ એફઆઈઆરની કોપી અને અન્ય દસ્તાવેજોની સાથે એટીઆર પણ રજૂ કરવા વિનંતી કરી છે જેથી કરીને પંચ આગળની કાર્યવાહી કરી શકે. આવી ધમકીની સજ્જ ટીકા કરતા ટીએમસીના સાસંદ રેક ઓબાઇયનેને પોસ્ટ મુકી છે કે, તેમને તમારી ગંદી રીત રસમો સાથે અમારી સાથે રાજકીય લડાઈ કરતા રહો, જે તમે પહેલાથી જ કરી રહ્યા છો. પણ હવે તમે તમામ હદો વટાવી દીધી છે. માસુમ બાળકોને ધમકીઓ આપવાનું બંધ કરો. આવી હલકી કક્ષાની ધમકીને વખોડી કાઢવા માટે મારી પાસે પુરતા શબ્દો નથી.

આરજી કર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલનું નામ ભ્રષ્ટાચાર કેસની FIRમાં દાખલ કરતી CBI, બિનજામીનલાયક કલમો લગાડી FIRમાં IPCની કલમ ૧૨૦(B ગુનાહિત કાવતરું) સાથે કલમ ૪૨૦(છતરપિંડી) અને અપ્રામાણિકતા) તેમજ ભ્રષ્ટાચાર પ્રતિરોધક ધારો ૧૯૮૮ની કલમ ૭ મુજબ FIR દાખલ

(એજન્સી) કોલકાતા, તા. ૨૭ આરજી કર હોસ્પિટલના પૂર્વ આચાર્ય સંદીપ ધોષની સળંગ ૧૦ દિવસ સુધી પૂછપરછ કરવામાં આવ્યા બાદ સીબીઆઈ દ્વારા ધોષના કાર્યકાળ દરમ્યાન થયેલી નાણાકીય ગેરરીતિઓના મામલામાં FIR નોંધવામાં આવી છે જેમાં ધોષનું પૂર્ણ નામ આરોપી તરીકે નોંધવામાં આવ્યું છે. FIRમાં બિનજામીન કલમો લગાડવામાં આવી છે. આઈપીસીની કલમ ૧૨૦B (ગુનાહિત કાવતરું), કલમ ૪૨૦ (છતરપિંડી) અને અપ્રામાણિકતા) તથા ભ્રષ્ટાચાર પ્રતિરોધક ધારો ૧૯૮૮ની કલમ ૭ જે જાહેર સેવક દ્વારા ગેરકાયદે ભેટ સોગાદ લેવાની પ્રવૃત્તિને આવરી લે છે એવી કલમો એજન્સી એ લગાડી છે. આ તમામ અપરાધો કોંગ્રેસને બળ છે અને તમામ કલમો બિનજામીનલાયક છે તેવું



કોલકાતા આઈકોર્ટના એક સિનિયર વકીલે જણાવ્યું હતું, અન્ય કેટલીક એજન્સીના નામ પણ એફઆઈઆરમાં દર્શાવામાં આવ્યા છે. આઈકોર્ટના આદેશથી સીબીઆઈએ સીટ પાસેથી તપાસ સંબંધી વીધા બાદ શનિવારે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

વડા અમ્મર અલીએ હોસ્પિટલમાં થયેલી નાણાકીય ગેરરીતિઓ અને બેફામ ભ્રષ્ટાચાર બદલ ઈંટીની તપાસ કરવાની માંગણી સાથે આઈકોર્ટમાં એક અરજી કરી હતી. અરજીમાં અલીએ એવો આલેખ કર્યો હતો કે, સંદીપ ધોષ જેના વાલી વારસ ન હોય એવા મુતદેહો ગેરકાયદે વેચી નાખતો હતો. બાયોમેડિકલ વેસ્ટનો પણ વેપાર ચલાવતો હતો અને દવાઓ તથા તબીબી સાધનો સલાહ કરનાર પેઢીઓ કમિશન આપે તેના જતનર મજૂર કરતો હતો એટલું જ નહીં પણ પરીક્ષામાં પાસ કરવા માટે વિદ્યાર્થીઓ પાસે થી રૂા.૫થી ૮ લાખ જેટલી રકમ લેવા માટે સતત દબાણ કરતો હતો. આ અરજી પર આઈકોર્ટે સીબીઆઈને તપાસ સોંપી હતી. રવિવારે પણ સીબીઆઈએ આખો દિવસ ધોષની પૂછપરછ કરી હતી.

કોલકાતાના ડોક્ટર પર બાળાત્કાર-હત્યા : સંજય રોયની બાઈક પોલીસ કમિશનરના નામે શા માટે નોંધવામાં આવી હતી ?

(એજન્સી) તા. ૨૭ કોલકાતા બાળાત્કાર અને હત્યા : મહિલા ઇ ઓગસ્ટના રોજ હોસ્પિટલના સેમિનાર હોલમાં મૃત હાલતમાં મળી આવી હતી. કોલકાતા ડોક્ટર બાળાત્કાર-હત્યા : સંજય રોય, કોલકાતા પોલીસના નાગરિક સ્વયંસેવક કે જેના પર આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડોક્ટર પર બાળાત્કાર અને હત્યા કરવાનો આરોપ છે, તે પોલીસ કમિશનરના નામે નોંધાયેલ મોટરસાઈકલનો ઉપયોગ કરતો હતો. આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈ કોલકાતા પોલીસમાં તેના કનેક્શનની તપાસ કરી રહી છે. દરમિયાન, મીડિયા અહેવાલો અને સોશિયલ મીડિયામાં માહિતી બહાર આવતા, કોલકાતા પોલીસે એક નિવેદન બહાર પાડ્યું. તેઓએ કબુલ્યું હતું કે બાઈક પોલીસ કમિશનરના નામે નોંધાયેલ છે. જો કે, તેઓએ કહ્યું કે પોલીસ કમિશનરના નામે તમામ સરકારી વાહનોની નોંધણી કરવાની પ્રમાણભૂત પ્રથા છે. 'સંજય રોય દ્વારા ઉપયોગમાં લેવાતી બાઈક-આરજી કર હોસ્પિટલના કથિત જાતીય શોષણ અને હત્યા કેસમાં મોંઘા આરોપી- જે સીબીઆઈને સોંપવામાં આવે તે પહેલા કોલકાતા પોલીસે કબજે કરી હતી, તે



પોલીસ કમિશનર, કોલકાતાના નામે રજીસ્ટર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પરના કેટલાક લોકો આની આસપાસ મૂંઝવણ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, કોલકાતા પોલીસના તમામ સરકારી વાહનો વિવિધ એકમોને સોંપવામાં આવે તે પહેલાં સત્તાવાર રીતે પોલીસ કમિશનર હેઠળ નોંધવામાં આવે છે. મહિલા ઇ ઓગસ્ટના રોજ હોસ્પિટલના સેમિનાર હોલમાં મૃત હાલતમાં મળી આવી હતી. તે ઉદ્ કલાકની લાંબી શિફ્ટ દરમિયાન ત્યાં સૂવા ગઈ હતી. તેના શબપરીક્ષણમાં બાળાત્કાર અને ૨૫

આંતરિક અને બાહ્ય ઈજાઓ બહાર આવી હતી. ગુના સમયે કોરોડોરમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં સંજય રોય જોવા મળ્યો હતો. કેટલાક અહેવાલો અનુસાર, કથિત રીતે ગુનો કરતા પહેલા, સંજય રોયે શહેરની ગલીમાં અન્ય એક મહિલાની છોડતી કરી હતી. તેણે તેના મિત્ર સાથે શહેરના બે રેડ-લાઈટ વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી પરંતુ તેણે સેક્સ ક્યું ન હતું. સંજય રોયની મનોવિશ્લેષણાત્મક રૂપરેખા, સીબીઆઈના અધિકારીઓ દ્વારા દોરવામાં આવે છે, તે સૂચવે છે કે તે વિકૃત છે અને પોનોગ્રાફીનો ગંભીર વ્યસની છે.

કેન્દ્રના મીડિયા એડવાઈઝર તરીકે પોતાની નિમણૂકની મશ્કરી ઉડાવનાર કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીની સેક્સ સીડી જાહેર કરી દેવાની દલિત નેતા દિલીપ મંડલની ધમકી

(એજન્સી) તાજેતરમાં કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયના નવા મીડિયા સલાહકાર તરીકે દિલીપ મંડલની કેન્દ્ર દ્વારા કરવામાં આવેલી નિમણૂકની કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીએ મજાક ઉડાવી હતી. આથી વળતો હલ્લો બોલીને દલિત નેતા અને યજ્ઞવલકાર દિલિપ મંડલે અભિષેકની સેક્સ સીડી જાહેર કરી દેવાની ધમકી આપી હતી. કોંગ્રેસ નેતાએ એક પોસ્ટ મુકીને મંડલની નિમણૂક કરવા બદલ કેન્દ્રની મજાક ઉડાવી હતી અને લખ્યું હતું કે, આ છે નવો ભાજપ ! ભાજપ કાર્યકરો માટે મોંઘે મોંઘેની પળ છે ! કોંગ્રેસ નેતાએ આરએસએસના વડા ભાગવતની ટીકા કરતી દિલિપ મંડલની એક જૂની પોસ્ટ સાથે મુકી હતી. આથી મંડલે પણ વળતો આકરો જવાબ આપ્યો હતો અને લખ્યું હતું કે, ચીફ જસ્ટિસ ભલે તમારા શાળા અને કોલેજના સહપાઠી હોય, તમે ભલે કોંગ્રેસના ટોચના નેતા હોય અને સોદાબાજી કરવાની તમારી કાબેલિયતને કારણે ભલે તમે સૌથી મોંઘા વકીલ હો પણ તમે મને તમારા ગળાની હેઠળ ઉતારી નહીં શકો અને તમારા ગળાનું હાડકું બની જઈશ. તમે મારા પર કૂદી ન પડાતા નહીંતર હું તમારી ૨૦૧૨ની સેક્સ સીડી



બહાર પાડી દઈશ. તમે જ્યાં જજની નિમણૂક કરી રહ્યા છો ત્યાં શિષ્ટાચાર ન હતો એ સમયે તમે સંસદીય કાયદા સમિતિના ચેરમેન હતા એટલે તમારે આવું કરવું જોઈતું નહોતું. આ તો અદાલતોનો આદેશ છે એટલે સીડી જાહેર કરતો નથી. જો તિરસ્કારની વાત આવે તો હું પ્રશાંત ભુષણની જેમ ૬૭ ઉધરાવીશ અને રૂા.૧નો દંડ ભરી આપીશ. ભુષણ અને મારા માટે અલગ અલગ દંડ નહીં જ હોય, કેમ બરાબરને ચંદ્રુડ સાહેબ ?

'આ પિતૃસત્તાક માંગ છે' : મમતા બેનરજીના રાજીનામાની હાકલ અંગે TMCએ વિદ્યાર્થીઓના વિરોધની નિંદા કરી કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટર પર બાળાત્કાર અને હત્યાનો મામલે વિપક્ષ મમતા બેનરજીના રાજીનામાની માંગ કરી રહ્યો છે

(એજન્સી) તા. ૨૭ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટરની બાળાત્કાર અને હત્યા અંગે ભારે હોબાળા વચ્ચે, તુષ્ટમૂલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીના રાજીનામાની હાકલ વચ્ચે તેણીનો બચાવ કર્યો છે અને વિપક્ષની આ માંગને 'પિતૃસત્તાક' ગણાવી છે. ટીએમસીએ પ્રશ્ન કર્યો હતો કે જ્યારે તેમના રાજ્યોમાં જુવન્ય ગુનાઓ થાય છે ત્યારે પુરૂષ મુખ્યમંત્રીઓ પર શા માટે આવા સમાન આલેખો કરવામાં આવતા નથી. ઘણી જગ્યાએ આટલી બધી ઘટનાઓ બની છે. સતત ત્રણ ચૂંટણી જીતનાર દેશના એકમાત્ર મહિલા મુખ્યમંત્રીના રાજીનામાની માંગ શા માટે ? અન્ય સ્થળોએ બનેલી ઘટનાઓ માટે કોઈ પુરૂષ મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી નથી. આ પિતૃસત્તાક વલણ છે.



ફાયરિંગ કરવાનું કાવતરું છે. આવતીકાલે પરીક્ષાઓ છે. શું વિદ્યાર્થીઓ આવું કરી શકે છે ? તેઓ રાજકારણ કરી રહ્યા છે. ભટ્ટાચાર્યએ જણાવ્યું કે, આવા વિરોધ માટે પોલીસ પાસેથી કોઈ પરવાનગી માંગવામાં આવી નથી. વિરોધ પ્રદર્શનો થઈ શકે છે પરંતુ તેઓએ પરવાનગી લેવી પડશે અને તેઓ નિયુક્ત સ્થળોએ શાંતિપૂર્ણ રીતે યોજવા જોઈએ. ટીએમસીના નેતા કુષાલ ઘોષે રાજ્ય સચિવાલયમાં રેલી પાછળના હેતુઓ પર સવાલ ઉઠાવ્યા, અને વિદ્યાર્થીઓને પૂછ્યું કે તેઓ સીબીઆઈ ઓફિસ તરફ ક્યૂ થા માટે કરી રહ્યા નથી, કારણ કે એજન્સીએ તપાસ શરૂ કરી છે. ઘોષે રેલીમાં હિંસાની હિમાયત કરતા બે વ્યક્તિઓને કથિત રીતે દર્શાવતા વિડિયો પણ રજૂ કર્યા હતા.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવના નેતૃત્વમાં બુલડોઝર અન્યાય સાથે મુસ્લિમોના ઘરો તોડી પાડવા અને પક્ષપાતી ભેદભાવપૂર્ણ શાસન

'બુલડોઝર સ્ટેટ' મધ્યપ્રદેશમાં બુલડોઝરની કાર્યવાહીના ફરી સમાચાર આવ્યા હતા અને રાજ્યના નવા મુખ્યપ્રધાન યાદવ સ્પષ્ટપણે તેમના પુરોગામી શિવરાજસિંહ ચૌહાણના પગલે ચાલી રહ્યા છે, અઠવાડિયા પહેલાં કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સભ્ય દિગ્વિજયસિંહે ડી.એમ. સંજય શ્રીવાસ્તવ સામે ભેદભાવપૂર્ણ બંધારણ વિરોધી કૃત્યો બદલ કાર્યવાહી કરવાની માંગ કરી હતી (એજન્સી) તા. ૨૭ મધ્યપ્રદેશમાં મોહન યાદવની આગેવાની હેઠળની ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારને મહારાષ્ટ્રના પૂજારી રામગિરિ મહારાજની પયગમ્બર હઝરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબ પર અભદ્ર ટિપ્પણીના વિરોધ દરમિયાન પથ્થરમારોના આરોપો પર છતરપુરમાં સત્તાવાળાઓએ એક મુસ્લિમ નેતાનું ઘર તોડી પાડ્યું, તેની કારનો નાશ કર્યો પછી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ગયા ગુરૂવારે હાજી શહજાદ અલીની માલિકીનો એક બંગલો અને ત્રણ લકઝરી કારોનો નાશ કરવામાં આવ્યો હતો અને એવો આરોપ લગાવ્યો હતો કે, તેમનું નિવાસસ્થાન 'પરવાનગી વિના' બનાવવામાં આવ્યું હતું. સત્તાવાળાઓ દ્વારા યોગ્ય પ્રક્રિયા અથવા સૂચનાનું પાલન કર્યા વિના આવી કાર્યવાહી કેવી રીતે અને શા માટે કરવામાં આવી તે અંગે કોઈ પૂછપરછ થતી નથી.



સાહેબ પર કેટલીક વાંધાજનક ટિપ્પણીને લઈને એક મેમોરેન્ડમ આપવા પહોંચ્યા હતા. રોષે ભરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો અને પોલીસ અધિકારીઓને ઈજા પહોંચાડી હતી. પોલીસ કમ્પ્યારીઓએ આ હુમલા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને એમપી સરકારને કડક પગલાં લેવાની માંગ કરી હતી.

કાયદાની કઈ જોગવાઈઓ હેઠળ આ બધું કરવામાં આવ્યું ? વહીવટીતંત્રે પહેલાં ઘરને સરકારી જમીન પર હોવાનું કહીને તોડી પાડવાને યોગ્ય ટેરવું પછી કહ્યું કે, તે એક જળાશયની ખૂબ નજીક છે અને પછી કહ્યું કે, આ જમીન શહજાદ અલીની છે પરંતુ ઘરનો નકશો મજૂર થયો નથી. એપ્રિલ ૨૦૨૨માં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં રામનવમીની શોભાયાત્રા સંબંધિત હિંસાના પગલે ત્યાં પણ આવા મકાનો તોડી પાડવાની ઘટનાઓ બની હતી, જે અન્યાયી હતી. મધ્યપ્રદેશના ખરગોનમાં એમપી વહીવટીતંત્ર દ્વારા પાંચ સ્થળોએ ૧૬ મુસ્લિમોના ઘર તોડી પાડવામાં આવ્યા હતા. સભરંગ ઈન્ડિયા દેશભરમાં આર્થિક રીતે પછાત લોકો અને લઘુમતીઓ આ ચોક્કસ લક્ષ્યનો ભોગ બને છે તેને ટ્રેક કરી રહ્યું છે. છતરપુરમાં કોંગ્રેસના પૂર્વ ઉપાધ્યક્ષ શહજાદ અલી કથિત રીતે હિન્દુ સંત વિરુદ્ધ તેમની નિંદાત્મક ટિપ્પણી માટે કાર્યવાહીની માંગ સાથે વિરોધનું નેતૃત્વ કરી રહ્યા હતા. અલીના બંગલા સિવાય તેના ભાઈ અને અન્ય આરોપીઓની મિલકતો પણ તોડી પાડવામાં આવી હતી. મોહન યાદવની સીધી સૂચના પછી સત્તાવાળાઓ દ્વારા સ્પષ્ટપણે આ ગેરકાયદેસર અને ગેરબંધારણીય કૃત્ય કરવામાં આવ્યું હતું. ચોકાવનારી વાત એ છે કે, છતરપુર કલેક્ટર દ્વારા ગુરૂવારે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ડિમોવિશનના વીડિયો પણ મુકવામાં આવ્યા હતા. તેમણે લખ્યું કે, રાજ્યના મુખ્યમંત્રીના નિર્દેશન હેઠળ છતરપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોલકાતા પોલીસ પર પથ્થરમારોના કેસમાં આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પરવાનગી વિના બાંધવામાં આવેલી ઈમારત તોડી પાડવામાં આવી હતી. મુસ્લિમો પાસે સત્તાવાળાઓ દ્વારા આ બુલડોઝરની કાર્યવાહીની ટીકા કરવામાં

આવી છે. મળતી માહિતી મુજબ શહજાદ અલી મોટી સંખ્યામાં લોકો સાથે પોલીસ સ્ટેશનને પયગમ્બર હઝરત મુહમ્મદ સાંભળવામાં આવ્યું હતું અને રાજ્યસભા સાંસદ દિગ્વિજયસિંહની આગેવાની હેઠળ કોંગ્રેસના નેતાઓએ શુક્રવાર, ૮ ઓગસ્ટના રોજ એક વિશાળ રેલી યોજી ભીડ જિલ્લા મેજિસ્ટ્રેટ સંજય શ્રીવાસ્તવ સામે ત્રણ આરોપીઓના ઘરોને તોડી પાડવા માટે ધાર્મિક અંગલ બદલ FIR નોંધવાની માંગ કરી હતી. કોંગ્રેસ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ શ્રીવાસ્તવના નિર્દેશ પર પ્રશાસને ત્રણ આરોપીઓના ઘરોને તેમની મુસ્લિમ ઓળખના કારણે બુલડોઝર કરી દીધા હતા. ફરિયાદમાં ધ્યાન દોરવામાં આવ્યું હતું કે, વહીવટીતંત્રે અન્ય સમાન કેસમાં આરોપીના ઘરને બુલડોઝર કરવાનો ઈન્કાર કર્યો હતો કારણ કે, તે મુસ્લિમ ન હતો. ફરિયાદમાં જણાવાયું છે કે, અધિકારીઓએ બુલડોઝર કરેલા ઘરોમાંથી કિંમતી વસ્તુઓ અને રોકડની પણ લૂંટ કરી હતી. રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના નેતા ઈમરાન પ્રતાપગઢીએ કહ્યું કે, તેઓ સરકારની કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે. તેમણે કહ્યું કે, આ ખ્વંસ ભાજપની મુસ્લિમો પ્રત્યેની નફરત દર્શાવે છે. અલીના નિવાસસ્થાનને તોડી પાડવા અંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, અતિક્રમણ વિરોધી અભિયાનના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી અને અલીને અગાઉથી સૂચના આપવામાં આવી હતી. નોંધનીય છે કે, આરોપી ફરાર છે. એવા પણ અહેવાલ છે કે, હિંદુ ધાર્મિક નેતા રામગીરી મહારાજ વિરુદ્ધ પયગમ્બર હઝરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબ અને ઈસ્લામ વિરુદ્ધ તેમની કથિત વાંધાજનક ટિપ્પણીઓ બદલ પુણેમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી.

ભારે વરસાદ ગુજરાત પર અતિભારે પડ્યો : ઠેર-ઠેર તારાજીના દર્શયો




વડોદરા



ટંકારા



જામનગર



વડોદરા

અનેક સ્થળોએ મકાનો અને દુકાનોમાં પાણી ઘૂસતાં ભારે નુકસાનની ભીતિ

મોરબીના ટંકારામાં ૨૪ કલાકમાં ૧૪ ઈંચ ખાબકયો

૧૦ જિલ્લામાં ૧૨ ઈંચથી વધુ વરસાદ

ડીપ-ડિપ્રેશનને પગલે આગામી ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી

૨૫૧ તાલુકાઓમાં સરેરાશ ૩ ઈંચથી વધુ વરસાદ

રાજકોટ-વડોદરામાં દયનીય સ્થિતિ અનેક સ્થળો ભેટમાં ફેરવાયા

અમદાવાદ,તા.૨૭ રાજ્યમાં અતિભારે વરસાદ આકાશી આફતના રૂપમાં વરસી રહ્યો છે. અતિભારે વરસાદને પગલે ઠેર ઠેર તારાજીના ભયાનક દર્શયો સામે આવ્યા છે. નાના ગામડાઓથી લઈને વરસાદે મહાનગરોની પણ હાલત ખરાબ કરી નાંખી છે. સુરત, રાજકોટ, વડોદરા, જામનગર સહિતના મોટા શહેરો પણ પાણીમાં ડૂબ્યા છે. ત્યારે હજુ રેડએલર્ટની આગાહીથી લોકોના જીવ તાળવે ચાલ્યા છે. બીજા તરફ રાજકોટમાં

સુરતમાં સો મવારે મેઘરાજાએ વિસ્ફોટક ભેટિંગ કરી હતી. હવામાન વિભાગ પાસેથી મળતા આંકડા પ્રમાણે, ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૨૫૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં મોરબીના ટંકારામાં સૌથી વધુ ૧૪

મોરબા હડકમાં ૧૩.૮૪ ઈંચ, ખેડના નડિયાદમાં ૧૩.૦૮ ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે મોરબીના વાંકાનેર, આણંદના તારાપુર, ગોધરા, ખંભાત, પાટણ, આણંદ, વડોદરા, ભોરસદમાં ૧૨ ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં ખેડના વસો અને આણંદના સોજાત્રામાં ૧૦ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. અમદાવાદના ધોળકા, મેઘરાજ, મહુવા, મહેમંદાવાદ, સંતરામપુર, શેરા, કાલાવાડ, ગળતે ચર, ખંભાળિયા, રાજકોટ, પેટલાદ, નખત્રાણા, મોરબી, ભાલાશિનોર, માંડવીમાં ૯ ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. તો ગુજરાતના મોટા શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં ૬ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજકોટમાં ૯.૧૬ ઈંચ, સુરતમાં ૨૮ mm એટલે કે એક

ઈંચથી થોડો વધારે વરસાદ નોંધાયો છે. વડોદરામાં ૧૨ ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના મેપમાં જણાવ્યા પ્રમાણે, આજે ગુજરાત પ્રદેશના જિલ્લાઓ એટલે કે ખેડ, આણંદ, પંચમહાલ, દાહોદ, તાપી, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, વડોદરા, ભરૂચ, સુરત અને ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર, દારકા, પોરબંદર,

જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, ડીવ અને કચ્છમાં કેટલાક સ્થળોએ અતિભારે વરસાદની સંભાવના છે. આ સાથે અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે ઉત્તર ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા અને પાટણ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં આવતીકાલે શાળા-કોલેજોમાં ૨૪ જાહેર જામનગર, દારકા, પોરબંદર,

રાજ્યના ૩૪ સ્ટેટ હાઈવે સહિત ૬૩૬ રસ્તાઓ બંધ

રાજ્યમાં ભારે વરસાદના કારણે આજીવન સુધીમાં રાજ્યના સ્ટેટ હાઈવે સહિત ૬૩૬ રસ્તાઓ બંધ છે. ગુજરાતના ૩૪ સ્ટેટ હાઈવે, ૧ નેશનલ હાઈવે બંધ થયું છે અને અમદાવાદ-મુંબઈ વચ્ચે ચાલતી ૩૦ ટ્રેન ૨૬, એસ.ટી. બસના ૪૩૩ ટ્રેન અને ૨૦૮૧ ટ્રીપ ૨૬ કરવામાં આવી છે. માળિયા હાઈવે બંધ થતા એસ.ટી. વિભાગના ૧૦૦ ટ્રેન ૨૬ કરવાયા છે.

રાજ્યમાં ૨૩,૦૦૦થી વધુ લોકોનું સ્થળાંતર : ૧૬૦૦થી વધુ લોકોનું રેસ્કયુ

રાજ્યમાં ભારે વરસાદથી સર્જાયેલી પૂરની સ્થિતિના કારણે બે સ્થળો પર હેલિકોપ્ટરથી રેસ્કયુ આપેલા હતા. ૧૨ લોકોને બચાવવામાં આવ્યા હતા. સિદ્ધપુરમાં રાત્રિ દરમિયાન વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ૨૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. મહુવાના મહીસાગર ગામમાં ફસાયેલા ૪૨ લોકોનું રેસ્કયુ કરાયું હતું. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં ૨૩,૮૭૧ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જ્યારે પૂરમાં ફસાયેલા ૧૬૦૦થી વધુ લોકોનું રેસ્કયુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સમીક્ષા રાજ્યમાં હજી ભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર તંત્રને એલર્ટ સાથે સજજ કરાયું

રાજ્યમાં વરસાદને લઈ NDRFની ૧૪ અને SDRFની ૨૨ પ્લાટૂન તૈનાત

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૨૭ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં વહિવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને બચાવ રાહત પગલાંની સમીક્ષા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વીડિયો કોન્ફરન્સ યોજીને કરી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરો અને મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો પાસેથી તેમના દ્વારા જે ત્વરિત કાર્યવાહી કરીને લોકોનું સલામત સ્થળે સ્થળાંતર, રેસ્કયુ, જીવન આવશ્યક પુરવઠાની ઉપલબ્ધિની વ્યવસ્થા, રાહત રસોડા વગેરેની તલસ્પર્શી વિગતો મેળવી હતી.

૨૩,૮૭૧ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તેમજ ૧,૬૮૬ લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં ભારે વરસાદની આગાહી અને ચેતવણી હજી યથાવત છે તે સંજોગોમાં પ્રજાજનોને પણ સાવચેતી-સલામતી રાખવા અનુરોધ કર્યો હતો. રાજ્યમાં ભારે વરસાદને કારણે દિવાલ પડી જવાથી પાણીમાં ડૂબી જવાથી તથા ગ્રાડ પડવાની ઘટનાઓમાં કુલ ૭ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. તેમના કિસ્સામાં નિયમાનુસારની સહાય ચૂકવવાની કાર્યવાહી ત્વરિતે હાથ ધરવા બેઠકમાં સુચનાઓ આપવામાં આવી હતી. હવામાન વિભાગે માછીમારોને ઠરિયો નહિ ખેડવા જે ચેતવણી આપી છે તેના ચુસ્ત પાલન માટે દરિયાકાંઠા વિસ્તારોના જિલ્લા કલેક્ટરોને ખાસ તકીદ કરી હતી કે, તા.૩૦/૦૮/૨૦૨૪ સુધી કોઈ માછીમાર દરિયામાં જાવ નહિ તે કલેક્ટરો સુનિશ્ચિત કરે. બેઠકમાં વધુમાં જણાવવાયું કે કુલ ૮૮૨ ગામોમાં બીજા પુરવઠાને અસર પડી હતી. તેમાંથી ૭૮૦માં સ્થિતિ પુર્વાત થઈ ગઈ છે. જ્યારે રાજ્યમાં કુલ ૮૦૬ જેટલા જે માર્ગો બંધ છે તે માટે વરસાદ અટકે કે તુરંત જ સત્વરે મરામત કામગીરીની ઉપાડી પુર્વવત વાહનવ્યવહાર મોડ્ય બનાવવા માર્ગ મુક્તિ વિભાગને તેમણે તકીદ કરી હતી. તેમણે વરસાદથી પાણીના ભરાવાને કારણે રોગચાળો ન ફેલાવે તે માટે આ પાણીના નિકાલની વ્યવસ્થા, પાણીનું કલોરિનેશન તથા માટી કાપ વગેરે દૂર કરી સફાઈ માટે અને મચ્છર ઉપવેગ અટકાવવા દવા છંટકાવ તેમજ અન્ય આરોગ્ય વિષયક બાબતોમાં પણ જિલ્લાતંત્રોને સજ્જ રહેવા માગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ જિલ્લા અને શહેરોના સમગ્ર વહિવટી તંત્રને એલર્ટ મોડ પર રહીને ઝીરો કેન્જીઆલિટી એપ્રોચ સાથે આ વરસાદી આફતમાંથી પાર ઉતરવા માગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં એરફોર્સ, નેવી, કોસ્ટગાર્ડ અને આર્મીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

પાણીની સતત આવકને લઈ રાજ્યના કુલ ૨૦૭ જળાશય ૭૮ ટકા ભરાઈ ગયા રાજ્યમાં ભારે વરસાદને લઈ ૭૬ ડેમ છલકાયા, કુલ ૧૨૨ ડેમમાં હાઈએલર્ટ નર્મદા ડેમમાંથી ૩.૮૫ લાખ ક્યુસેક છોડાઈ રહેલું પાણી

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૨૭ રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદને પરિણામે મોટાભાગના તાલુકાઓમાં છેલ્લા બે દિવસમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. વરસી રહેલા આ સાર્વત્રિક વરસાદના ભાગરૂપે ૧૦૮ જળાશયો સંપૂર્ણ એટલે કે ૧૦૦ ટકા જ્યારે ૪૬ જળાશયો-૩૬ ૭૦થી ૧૦૦

ગાંધીનગર, તા.૨૭ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં વહિવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને બચાવ રાહત પગલાંની સમીક્ષા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વીડિયો કોન્ફરન્સ યોજીને કરી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરો અને મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો પાસેથી તેમના દ્વારા જે ત્વરિત કાર્યવાહી કરીને લોકોનું સલામત સ્થળે સ્થળાંતર, રેસ્કયુ, જીવન આવશ્યક પુરવઠાની ઉપલબ્ધિની વ્યવસ્થા, રાહત રસોડા વગેરેની તલસ્પર્શી વિગતો મેળવી હતી.

સ્થિતિની સમીક્ષા કર્યા બાદ કેન્દ્ર સરકારે આર્મી ફાળવી વરસાદથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં હવે આર્મીના જવાનો કામગીરીમાં જોડાશે

ગુજરાતમાં ભારે વરસાદની આપણિમાં રાહત-બચાવ તેમજ આપણિ વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારે રાજ્યમાં આર્મીની ૬ કોલમ ફાળવી છે. આ આર્મી કોલમ વરસાદથી વધુ પ્રભાવિત એવા દેવભૂમિ દારકા, આણંદ, વડોદરા, ખેડ, મોરબી અને રાજકોટના જિલ્લા હવેલી તંત્રને મદદરૂપ થવા ઉલ્લેખ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ભારે વરસાદે ખાના-ખરાબી સર્જતા તે અંગેના અહેવાલ કેન્દ્ર સરકારે મેળવી બચાવ-રાહત કામ માટે આર્મી મોકલવાનો નિર્ણય લીધો હતો. રાજ્યમાં હાલમાં વિવિધ વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં NDRF અને SDRFની પ્લાટૂનો બચાવ-રાહત કામગીરી કરી રહી છે.

ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના ૨૩ ડેમ ૫૦ ટકાથી ૭૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. એટલે હવે ૩૦ ડેમ જ રાખી ૫૦ ટકા જેટલા વીજ ક્યુસેક ૩૧ ડેમ ૨૫ ટકા કરતા ઓછા ભરાયા છે.

જ્યારે અન્ય ૨૦૬ જળાશયોમાં ૭૨.૭ ટકા જેટલો જળસંગ્રહ થતાં કુલ ૨૦૭ જળાશયોમાં ૭૮ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. સૌથી વધુ સરદાર સરોવર ડેમમાં ૩.૮૫ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૩.૮૫ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે વણાકબોરી જળાશયમાં ૨.૮૭ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૨.૮૭ લાખની જાવક, ઉકાઈમાં ૨.૪૭ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૨.૪૬ લાખ પાણી છોડવામાં આવી રહ્યું છે. ગત વર્ષે આ સમયે આ ૨૦૭ જળાશયોમાં ૭૬ ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો હતો તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.

રાજ્યમાં ભારે વરસાદના કારણે ૩૦ ટ્રેન ૨૬, ૩૬ ટ્રેન ડાયવર્ટ રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાના પગલે ૧૩ જેટલી ટ્રેનોના રૂટ ટૂંકાવી દેવાયા

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા. ૨૭ રાજ્યમાં રવિવાર રાત્રીથી શરૂ થયેલા ભારે વરસાદના પગલે રેલવે વ્યવહારને પણ ગંભીર અસર થઈ હોવાનું સામે આવ્યું છે. ઘણી જગ્યાએ રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવતા ટ્રેનો રદ કરવાની ફરજ પડી હતી. જેમાં ૩૦ જેટલી ટ્રેનોને રદ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જ્યારે ૩૬ જેટલી ટ્રેનોના રૂટને ડાયવર્ટ કરી દેવાયા હતા. આ ઉપરાંત ૧૩ જેટલી ટ્રેનોના રૂટ ટૂંકાવી દેવામાં આવ્યા હોવાનું

જાણવા મળે છે. વરસાદની અસર ઘટના બાદ રેલવે ટ્રેક પરથી પાણી ઓસર્યા પછી સુરક્ષાની ચકાસણી કરી ટ્રેનો ફરી પોતાના રાખેતા મુજબના રૂટ પર ચાલુ કરવામાં આવશે તેમ રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું. પ્રામ માહિતી અનુસાર, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં રવિવાર રાત્રીથી ભારે વરસાદ શરૂ થયો હતો. જેમાં સોમવારે તો વરસાદ સમગ્ર રાજ્યને ઘમરોળતા ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. જેમાં વડોદરા ડિવિઝનના બાજવા રેલવે સ્ટેશન અને આસપાસના

પગલે હવે પોલીસ માટે આરોપી પીઆઈ બી. કે. ખાયરની ધરપકડનો માર્ગ મોકળો થયો હતો. પીઆઈ બી. કે. ખાયરે પોલીસ સમક્ષ સરેન્દ્ર થવાનો સમય માંગ્યો પણ હાઈકોર્ટે સમય આપવાનો આ વચ્ચે આરોપી પીઆઈ બી. કે. ખાયરની ગુનામાં કોઈપણ તબીબની આત્મહત્યાના ચકચારી કેસમાં આરોપી પીઆઈ બી. કે. ખાયરની આગોતરા જામીન અરજીનો વિરોધ કરતાં સરકારી વકીલ દ્વારા રજૂઆત કરાઈ હતી કે, જણાવ્યું હતું કે, આરોપી પોતે એક ઉચ્ચ પોલીસ અધિકારી અને જાહેર સેવક છે. તેની વિરૂદ્ધ મહિલા તબીબને આત્મહત્યા માટે ઢુબેરણનો ગંભીર ગુનો છે. અન્યથા મહિલા તબીબ કોઈમધ્યમ સંકુલમાં જાત હતી. આ કેસમાં પોતાની સંભવિત ધરપકડ ટાળવા કોઈમધ્યમ આરોપી પીઆઈ બી. કે. ખાયરે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજીમાં ગુજરાત હાઈકોર્ટે આરોપી પીઆઈને હવે વધુ કોઈ રાહત આપવાનો સાફ ઈશાર કરી દીધો હતો. જરિસ એમ.આર. મેંગડેએ આરોપી પીઆઈની આગોતરા જામીન ફગાવી દેવાનું વલણ રાખવામાં આવતા પરત ખેંચાઈ હતી. જે બાદ આખરે પોલીસ દ્વારા પીઆઈ ખાયરની ધરપકડ કરી લેવામાં આવી છે. કેસની વિગતો સુજબ ગાયકવાડ હવેલી કોર્ટમધ્યમ સંકુલમાં જાત હતી. ૩-૨૦૨૪ના રોજ ૨૬૨મમ અત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં પોતાની સંભવિત ધરપકડ ટાળવા કોઈમધ્યમ આરોપી પીઆઈ બી. કે. ખાયરે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજીમાં ગુજરાત હાઈકોર્ટે આરોપી પીઆઈને હવે વધુ કોઈ રાહત આપવાનો સાફ ઈશાર કરી દીધો હતો. જરિસ એમ.આર. મેંગડેએ આરોપી પીઆઈની આગોતરા જામીન ફગાવી દેવાનું વલણ રાખવામાં આવતા પરત ખેંચાઈ હતી. જે બાદ આખરે પોલીસ દ્વારા પીઆઈ ખાયરની ધરપકડ કરી લેવામાં આવી છે. કેસની વિગતો સુજબ ગાયકવાડ હવેલી કોર્ટમધ્યમ સંકુલમાં જાત હતી. ૩-૨૦૨૪ના રોજ ૨૬૨મમ અત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં પોતાની સંભવિત ધરપકડ ટાળવા કોઈમધ્યમ આરોપી પીઆઈ બી. કે. ખાયરે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજીમાં ગુજરાત હાઈકોર્ટે આરોપી પીઆઈને હવે વધુ કોઈ રાહત આપવાનો સાફ ઈશાર કરી દીધો હતો. જરિસ એમ.આર. મેંગડેએ આરોપી પીઆઈની આગોતરા જામીન ફગાવી દેવાનું વલણ રાખવામાં આવતા પરત ખેંચાઈ હતી. જે બાદ આખરે પોલીસ દ્વારા પીઆઈ ખાયરની ધરપકડ કરી લેવામાં આવી છે. કેસની વિગતો સુજબ ગાયકવાડ હવેલી કોર્ટમધ્યમ સંકુલમાં જાત હતી. ૩-૨૦૨૪ના રોજ ૨૬૨મમ અત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં પોતાની સંભવિત ધરપકડ ટાળવા કોઈમધ્યમ આરોપી પીઆઈ બી. કે. ખાયરે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજીમાં ગુજરાત હાઈકોર્ટે આરોપી પીઆઈને હવે વધુ કોઈ રાહત આપવાનો સાફ ઈશાર કરી દીધો હતો. જરિસ એમ.આર. મેંગડેએ આરોપી પીઆઈની આગોતરા જામીન ફગાવી દેવાનું વલણ રાખવામાં આવતા પરત ખેંચાઈ હતી. જે બાદ આખરે પોલીસ દ્વારા પીઆઈ ખાયરની ધરપકડ કરી લેવામાં આવી છે. કેસની વિગતો સુજબ ગાયકવાડ હવેલી કોર્ટમધ્યમ સંકુલમાં જાત હતી. ૩-૨૦૨૪ના રોજ ૨૬૨મમ અત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં પોતાની સંભવિત ધરપકડ ટાળવા કોઈમધ્યમ આરોપી પીઆઈ બી. કે. ખાયરે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજીમાં ગુજરાત હાઈકોર્ટે આરોપી પીઆઈને હવે વધુ કોઈ રાહત આપવાનો સાફ ઈશાર કરી દીધો હતો. જરિસ એમ.આર. મેંગડેએ આરોપી પીઆઈની આગોતરા જામીન ફગાવી દેવાનું વલણ રાખવામાં આવતા પરત ખેંચાઈ હતી. જે બાદ આખરે પોલીસ દ્વારા પીઆઈ ખાયરની ધરપકડ કરી લેવામાં આવી છે. કેસની વિગતો સુજબ ગાયકવાડ હવેલી કોર્ટમધ્યમ સંકુલમાં જાત હતી. ૩-૨૦૨૪ના રોજ ૨૬૨મમ અત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં પોતાની સંભવિત ધરપકડ ટાળવા કોઈમધ્યમ આરોપી પીઆઈ બી. કે. ખાયરે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજીમાં ગુજરાત હાઈકોર્ટે આરોપી પીઆઈને હવે વધુ કોઈ રાહત આપવાનો સાફ ઈશાર કરી દીધો હતો. જરિસ એમ.આર. મેંગડેએ આરોપી પીઆઈની આગોતરા જામીન ફગાવી દેવાનું વલણ રાખવામાં આવતા પરત ખેંચાઈ હતી. જે બાદ આખરે પોલીસ દ્વારા પીઆઈ ખાયરની ધરપકડ કરી લેવામાં આવી છે. કેસની વિગતો સુજબ ગાયકવાડ હવેલી કોર્ટમધ્યમ સંકુલમાં જાત હતી. ૩-૨૦૨૪ના રોજ ૨૬૨મમ અત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં પોતાની સંભવિત ધરપકડ ટાળવા કોઈમધ્યમ આરોપી પીઆઈ બી. કે. ખાયરે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજીમાં ગુજરાત હાઈકોર્ટે આરોપી પીઆઈને હવે વધુ કોઈ રાહત આપવાનો સાફ ઈશાર કરી દીધો હતો. જરિસ એમ.આર. મેંગડેએ આરોપી પીઆઈની આગોતરા જામીન ફગાવી દેવાનું વલણ રાખવામાં આવતા પરત ખેંચાઈ હતી. જે બાદ આખરે પોલીસ દ્વારા પીઆઈ ખાયરની ધરપકડ કરી લેવામાં આવી છે. કેસની વિગતો સુજબ ગાયકવાડ હવેલી કોર્ટમધ્યમ સંકુલમાં જાત હતી. ૩-૨૦૨૪ના રોજ ૨૬૨મમ અત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં પોતાની સંભવિત ધરપકડ ટાળવા કોઈમધ્યમ આરોપી પીઆઈ બી. કે. ખાયરે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજીમાં ગુજરાત હાઈકોર્ટે આરોપી પીઆઈને હવે વધુ કોઈ રાહત આપવાનો સાફ ઈશાર કરી દીધો હતો. જરિસ એમ.આર. મેંગડેએ આરોપી પીઆઈની આગોતરા જામીન ફગાવી દેવાનું વલણ રાખવામાં આવતા પરત ખેંચાઈ હતી. જે બાદ આખરે પોલીસ દ્વારા પીઆઈ ખાયરની ધરપકડ કરી લેવામાં આવી છે. કેસની વિગતો સુજબ ગાયકવાડ હવેલી કોર્ટમધ્યમ સંકુલમાં જાત હતી. ૩-૨૦૨૪ના રોજ ૨૬૨મમ અત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં પોતાની સંભવિત ધરપકડ ટાળવા કોઈમધ્યમ આરોપી પીઆઈ બી. કે. ખાયરે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજીમાં ગુજરાત હાઈકોર્ટે આરોપી પીઆઈને હવે વધુ કોઈ રાહત આપવાનો સાફ ઈશાર કરી દીધો હતો. જરિસ એમ.આર. મેંગડેએ આરોપી પીઆઈની આગોતરા જામીન ફગાવી દેવાનું વલણ રાખવામાં આવતા પરત ખેંચાઈ હતી. જે બાદ આખરે પોલીસ દ્વારા પીઆઈ ખાયરની ધરપકડ કરી લેવામાં આવી છે. કેસની વિગતો સુજબ ગાયકવાડ હવેલી કોર્ટમધ્યમ સંકુલમાં જાત હતી. ૩-૨૦૨૪ના રોજ ૨૬૨મમ અત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં પોતાની સંભવિત ધરપકડ ટાળવા કોઈમધ્યમ આરોપી પીઆઈ બી. કે. ખાયરે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજીમાં ગુજરાત હાઈકોર્ટે આરોપી પીઆઈને હવે વધુ કોઈ રાહત આપવાનો સાફ ઈશાર કરી દીધો હતો. જરિસ એમ.આર. મેંગડેએ આરોપી પીઆઈની આગોતરા જામીન ફગાવી દેવાનું વલણ રાખવામાં આવતા પરત ખેંચાઈ હતી. જે બાદ આખરે પોલીસ દ્વારા પીઆઈ ખાયરની ધરપકડ કરી લેવામાં આવી છે. કેસની વિગતો સુજબ ગાયકવાડ હવેલી કોર્ટમધ્યમ સંકુલમાં જાત હતી. ૩-૨૦૨૪ના રોજ ૨૬૨મમ અત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં પોતાની સંભવિત ધરપકડ ટાળવા કોઈમધ્યમ આરોપી પીઆઈ બી. કે. ખાયરે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજીમાં ગુજરાત હાઈકોર્ટે આરોપી પીઆઈને હવે વધુ કોઈ રાહત આપવાનો સાફ ઈશાર કરી દીધો હતો. જરિસ એમ.આર. મેંગડેએ આરોપી પીઆઈની આગોતરા જામીન ફગાવી દેવાનું વલણ રાખવામાં આવતા પરત ખેંચાઈ હતી. જે બાદ આખરે પોલીસ દ્વારા પીઆઈ ખાયરની ધરપકડ કરી લેવામાં આવી છે. કેસની વિગતો સુજબ ગાયકવાડ હવેલી કોર્ટમધ્યમ સંકુલમાં જાત હતી. ૩-૨૦૨૪ના રોજ ૨૬૨મમ અત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં પોતાની સંભવિત ધરપકડ ટાળવા કોઈમધ્યમ આરોપી પીઆઈ બી. કે. ખાયરે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજીમાં ગુજરાત હાઈકોર્ટે આરોપી પીઆઈને હવે વધુ કોઈ રાહત આપવાનો સાફ ઈશાર કરી દીધો હતો. જરિસ એમ.આર. મેંગડેએ આરોપી પીઆઈની આગોતરા જામીન ફગાવી દેવાનું વલણ રાખવામાં આવતા પરત ખેંચાઈ હતી. જે બાદ આખરે પોલીસ દ્વારા પીઆઈ ખાયરની ધરપકડ કરી લેવામાં આવી છે. કેસની વિગતો સુજબ ગાયકવાડ હવેલી કોર્ટમધ્યમ સંકુલમાં જાત હતી. ૩-૨૦૨૪ના રોજ ૨૬૨મમ અત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં પોતાની સંભવિત ધરપકડ ટાળવા કોઈમધ્યમ આરોપી પીઆઈ બી. કે. ખાયરે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજીમાં ગુજરાત હાઈકોર્ટે આરોપી પીઆઈને હવે વધુ કોઈ રાહત આપવાનો સાફ ઈશાર કરી દીધો હતો. જરિસ એમ.આર. મેંગડેએ આરોપી પીઆઈની આગોતરા જામીન ફગાવી દેવાનું વલણ રાખવામાં આવતા પરત ખેંચાઈ હતી. જે બાદ આખરે પોલીસ દ્વારા પીઆઈ ખાયરની ધરપકડ કરી લેવામાં આવી છે. કેસની વિગતો સુજબ ગાયકવાડ હવેલી કોર્ટમધ્યમ સંકુલમાં જાત હતી. ૩-૨૦૨૪ના રોજ ૨૬૨મમ અત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં પોતાની સંભવિત ધરપકડ ટાળવા કોઈમધ્યમ આરોપી પીઆઈ બી. કે. ખાયરે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજીમાં ગુજરાત હાઈકોર્ટે આરોપી પીઆઈને હવે વધુ કોઈ રાહત આપવાનો સાફ ઈશાર કરી દીધો હતો. જરિસ એમ.આર. મેંગડેએ આરોપી પીઆઈની આગોતરા જામીન ફગાવી દેવાનું વલણ રાખવામાં આવતા પરત ખેંચાઈ હતી. જે બાદ આખરે પોલીસ દ્વારા પીઆઈ ખાયરની ધરપકડ કરી લેવામાં આવી છે. કેસની વિગત